



# આદ્યાત્મ ભાગ

માટેર



શ્રી જો.મ. પી.પટેલ કાર્ટોના પ્રકાશન

## પ્રકાશકનું નિવેદન

આત્મારતું આપણું જીવન અનેક મથુરાખોથી ભરપૂર છે. આપણી આસપાસનાં અનેક પરિણામો આપણુને મૂંજવી રહ્યાં છે. આ બધાંની વર્ચ્યેથી રહ્યો કેમ કાઢવો અને જીવનને ઉધ્વર્ગામી કેમ બનાવવું એનો માગં આપણુને સુઝતો નથી. પરિણામે આપણે દિશાશૂન્ય બની આથડું કરીએ છીએ.

આપણું જીવન અધ્યાત્મને પંથે વાળવા શું કરવું જોઈએ, કેવા પ્રકારની સાધના કરવી જોઈએ, એનું માગં દર્શાન આ પુસ્તકમાંથી મળી રહે છે.

શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન તરફથી સને ૧૯૮૩ થી શરૂ કરેલ જીવનલક્ષી શ્રેણીને મળેલા ઉભાભર્યા આવકારથી પ્રેરાઈ આ પુસ્તક પ્રગટ કરતાં અમે આનંદ અનુભવનીએ છીએ. અમારી વિનંતીને માન આપી આ પુસ્તકનું સ પાદન તેમજ અનુવાદનું કાયં કરી આપવા બદલ શ્રીમતી મીરાબેન બાહુના અમે અત્યંત આભારી છીએ. તેમના સંપાદકીયમાં જણાવ્યા મુજબ આ પુસ્તકનો આધાર છે પ્રણપ્તિાખાડુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત સને ૧૯૮૫-૧૯૮૬ની “અભ્યક્તા વાણી.”

આ પુસ્તકના પ્રકાશન-આયોજન પાછળ લીધેલ પરિશ્રમ બદલ અમારા સનેહી મિત્ર શ્રી મુકુન્દ પી. શાહનો આલાર માનીએ છીએ.

આ પુસ્તક સંબંધી વાચકમિત્રોનાં રચનાત્મક સૂચના આવકારીશું.

શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન  
‘મીના’, ૬, સરદાર પટેલ કોલોની,  
નવજીવન, અમદાવાદ-૩૮૦ ૦૧૪

મંગળલાઈ પી. પટેલ  
મૂકેશ એમ. પટેલ  
૧૩ મી ફેલુઆરી, ૧૯૮૮

શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન  
 ‘જીવનધડતર પ્રકાશન એણ્ટી’ ની અગિયારમી લેટ  
 જીવનને જીબ્ખાગમી બનાવવા માટે પ્રેરણાદ્યાં  
 માર્ગદર્શન પૂરું પાડતું અમૃત્ય પુરતક


## અધ્યાત્મ જીવન

સંપાદન—અનુવાદ  
 મીરા ભરુ

સનેહી શ્રી.....

જીવનને જીબ્ખાગમી બનાવવા માટે પ્રેરણાદ્યાં  
 માર્ગદર્શન પૂરું પાડતું આ અમૃત્ય પુરતક આપના પરિવારને  
 ઉપરોગી બની રહેા તેવી શુભ કામનાઓ સહ.....

સપ્રેમ  
 મંગળભાઈ પી. પટેલ  
 મુકેશ એમ. પટેલ



શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન પ્રકાશન  
 ‘મીના’, ૬, સરદાર પટેલ ડેલોની, નવજીવન,  
 અમદાવાદ-૩૮૦ ૦૧૪. ફોન : ૪૮૨૩૧૦; ૪૪૮૫૩૪

- o श्री एम. पी. पटेल फाउन्डेशन  
ज्ञानधडतर प्रकाशन श्रेणीनुसार अगियारमुं प्रकाशन
- o अध्यात्म ज्ञान
- o संपादन-अनुवाद : भीरा भट्ट
- o प्रकाशन वर्ष : इप्पुआरी, १६८८
- o मूल्य : सद्विवाच-सुविचान-सद्विवेग
- o प्रकाशक :  
श्री एम. पी. पटेल फाउन्डेशन वती  
भूकेश एम. पटेल  
'मीना', ६, सरहार पटेल कोलोनी, नवज्ञवन,  
अमदावाद-३८० ०१४
- o प्रकाशन-आयोजन : कुसुम पञ्चकेशन्स, अमदावाद-३८० ००७  
इन : ४१०६५८
- o आवरण : भयूर जनी
- o मुद्रक :  
हरिआम् प्रिन्टरी  
दूधेश्वर रोड, अमदावाद-३८० ००१

## સંપાદકીય

રનેહો ભાઈ શ્રી મંગળભાઈએ પ્રજાપિતા અલાકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, માર્ઝિન આખુ, દ્વારા પ્રકાશિત એપ્રિલ ૧૯૮૫ થી એપ્રિલ ૧૯૮૬ની “અવ્યક્તા વાણી” પુસ્તકનો સંપાદિત અનુવાદ કરવાનું હતું, ત્યારે હું થોડી અચકાયેલી, પરંતુ મારી અવ્યક્તા મૂંજવણે સમજ જર્ઝ તરત તેમણે કહેલું : “આ સંપાદન તમારે તમારી રીતે કરવાનું છે. અંદરનો મર્મ પ્રગટ થાય એટલે ધાણું !”

તો આ પુસ્તક એટલે મારી રીતને સંપદિત અનુવાદ છે. આ “અવ્યક્તા વાણી” પુસ્તકનો પણ જે અવ્યક્તા અંશ છે તેને મારી સાધામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. જીવનને મેં પણ સત્યરોધનની એક સાધના ગણી છે. એટલે સાધકોના વ્યક્તિગત તેમ જ સામૃદ્ધિક જીવનની મથામણેનો થોડો અંદર છે તેના આધારે સાધકના જીવનમાં પથેયઃપ થર્ડ શરૂ તેવી સામની શોધી શોધીને સંયોજન કરી એકરસ કરવાનો પ્રયત્ન કર્યો છે.

“અવ્યક્તા વાણી” એટલે હૈનિક પાથેય છે. રોનેરોઝનું ભાયું. પરંતુ તેમાં ધાણુંથાણું વેરવિભેર. એકસ્ક્રૂતા ન મળે. એટલે અમરૈ જે રીતે ફૂલેફૂલે ફરીને રસ એકઠો કરી તેમાંથી મધ તૈયાર કરે એ રીતે થોડી રાસાયણિક પ્રક્રિયા કરવી પડી છે. દાક્તર બાટ્ટિમાં દવા આપે તે દ્વારા લેતા પહેલાં બાટલીને બરાબર હુલાવની પડે છે, એવું આ પુસ્તકના ઔપધને હુલાવનું પડ્યું છે. એટલે કોઈ આને મૂળ પુસ્તક સાથે સરખાવે તો સંભવ છે કે કોઈ સામ્ય ન જરૂર. વળી, મર્યાદિત પૃષ્ઠામાં સંપાદકીય દાખિમાં જે લેવા જેવું લાગ્યું તે લીધું છે અને છોડવા જેવું છોડયું છે. પણ આ પુસ્તકના હાંદને કેન્દ્રમાં રાખી સંયોજન કર્યું છે. આશા છે કે જીવનસાધકોને કાંઈક પ્રકાશ તો અવશ્ય મળશે.

આ નિભિતે, સૌ જીવનશોધકોના જીવનમાં અવ્યક્તા જગતનો નાનકડો સરખો પણ પ્રદેશ ઘૂલે તેવી પ્રભુયરણોમાં પ્રાર્થના.

૪૪૭, શિશુવિહાર સામે, }  
લાવનગર-૩૬૪ ૦૦૧ } }

—મીરા લલુ

## અનુક્રમ

૧. વ્યક્તા જગતને પેદે પાર	૧
૨. અવ્યક્તને પામવાની સાધના	૮
૩. સમાજ સાથે અનુસંધાન	૩૫
૪. સાધક-વિવિધ ભૂમિકાઓમાં	૬૨
૫. વિવિધ ઉત્સવોનું રહસ્ય	૭૮
૬. ભાગળ વિશ્વની રચના	૮૪



## [ ૧ ] વ્યક્ત જગતને પેલે પાર

વિશ્વમાં એ મહાન શક્તિ છે. એક છે, વિજાન અને ઓળ છે અધ્યાત્મ. આ બંને શક્તિઓની સમ્યકું ઉપાસના થાય તો જ જીવન પરિપૂર્ણ, સર્વાંગી અને સુંદર બની શકે.

આ બંને શક્તિઓને સાધવા માટે ઈશ્વરે મનુષ્યને સાધન પણ આપ્યાં છે. ઈશ્વરની યોજનામાં કશું અધ્યુરું નથી હેતું. એની સમય યોજના પરિપૂર્ણ હોય છે. વિજાનની શક્તિની યોજ માટે કુદરતે મનુષ્યને ઈન્ડ્રિયો આપી છે. ઈન્ડ્રિયો પણ એ પ્રકારની છે. અંતમુખી ઈન્ડ્રિયો અને બહિમુખી ઈન્ડ્રિયો. બહિમુખી ઈન્ડ્રિયો. એટલે હાથ, કાન, નાક, પગ, વળોરે, જેના દ્વારા આપણે આપણી ભાષ્ય સુણિનો પરિચય મેળવી શકીએ છીએ. સ્પર્શ, શ્રવણ, ગંધ વળોરેનો અનુભંધ આ ભાષ્ય ઈન્ડ્રિયો દ્વારા બાંધી શકાય છે.

### આંતરિક ઈન્ડ્રિયો દ્વારા અધ્યાત્મ

જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વળોરે અંતમુખી ઈન્ડ્રિયો દ્વારા આંતર્જગતનો પરિચય સાધી શકાય છે. માનવની અંતર્શૈતનામાં અનેક પ્રકારની વૃત્તિઓ કામ કરે

છે. કામ, કૌદ્ધ, રાગ, દ્રેષ, મહ, મત્સર જેવી વૃત્તિઓ સર્વસાધારણુ રીતે ઉદ્ભબતી રહેતી હોય છે. મતુષ્યના લુચનની આ સાધના છે કે આ બધી વૃત્તિઓને સંતુલિત કેવી રીતે રાખવી.

બાધ્ય જગતમાં પણ સંતુલન જરૂરી છે, આંતરિક જગતમાં પણ સંતુલન જરૂરી છે. આ સંતુલન રાખવા માટે, સાચું શું છે, ઐથું શું છે તે પારખવા માટે જ્ઞાન-વિજ્ઞાનખુદ્ધિ જોઈએ. આંતરિક સત્ય પ્રાપ્ત કરવા માટે વિવેકખુદ્ધિ જોઈએ, જે અંતરાત્મા તરફ ધ્યાન આપવાથી ખીલે છે. સ્થૂળ વैજ્ઞાનિક સત્ય સાધવા માટે તટસ્થ, વैજ્ઞાનિક ખુદ્ધિ જોઈએ, જેના પર કશો જ રંગ ચઢ્યો ન હોય. આ જ રીતે અંદરનો વિવેક પણ તો જ ખીલી શકે, જે ખુદ્ધિ તટસ્થ હોય, અવ્યક્તિચારણી હોય.

### દાખિથી પર તેથું જગત

નરી આંખોએ હેખાય છે તેથું જ જગત આ વિશ્વમાં નથી. વિશ્વ અત્યંત વ્યાપક છે. નરી આંખે હેખાય નહીં, છતાં ય આંતર્ચ્છુ દ્વારા નિહાળી શકાય, સગા કાને કશું સંભળાય નહીં, છતાં ય એવા ધ્વનિ ભડે જે વિશિષ્ટ વ્યક્તિ સાંભળી શકે, આ બધું શકાય છે. રસ, રૂપ, રંગ, ગંધ, સ્પર્શ પણ અવ્યક્તા, અમગટ રહી શકે છે. સાધના દ્વારા આ અવ્યક્તા જગત પ્રગટ થઈ શકે છે.

સાકરમાં જેમ ગળપણ ગુપ્ત છે, અદેશ્ય છે, મીઠામાં આરાશ ગુપ્ત છે એ જ રીતે સર્વશક્તિમાન પરમનિયંતા

सौमां विलसतो હોવा છતां અવ्यક्त છે, અપ્રગટ છે. આપણા રેન્જિંહા જીવનમાં એને અનુભવવો એ મનુષ્યનું પ્રાથમિક કર્તવ્ય છે.

### પ્રગટ-અપ્રગટનો લેખ

માનવીનાં એ સ્વરૂપ છે. એક છે, વ્યક્ત અને બીજું છે, અવ્યક્ત. એનો બાધ્ય દેહ વ્યક્ત છે પરંતુ તેની લીતર એનું એક અવ્યક્ત સ્વરૂપ પણ છે. પોતાના આ અવ્યક્ત સ્વરૂપને પામવાની અને તેનામાં સ્થિર થવાની જાખના માણુસમાં જીહતી રહે છે. એ પોતાના અવ્યક્ત સ્વરૂપને જેવા પણ જાખે છે. પરંતુ હિંય દશ્ચિ મળી જાય અને તે સ્વરૂપની જાખી થાય, તેના કરતાં હિંય બુદ્ધિના આધારે અવ્યક્ત સ્વરૂપનો જે અલૌકિક અનુભવ થાય છે તે એનોએ છે.

અવ્યક્તને પામવાની જાખના હોય તો અમૃતવેળાએ શાંત સ્થિતિમાં એસી ધ્યાન દ્વારા અવ્યક્તની સાથે અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આવું અનુસંધાન એ લોકો જ સાધી શકશે જે બાકીના સમયમાં પણ અંતર્મુખ રહીને અવ્યક્ત સાથે મનોમન જોડાયેલા હશે.

વિજ્ઞાને આજ્ઞાદાલ એવાં શાસ્ત્રાખ્યો શોધ્યાં છે કે પોતાના સ્થાને રહીને જ હરસુદ્ધરના પ્રહેશમાં શાસ્ત્રોને ઝેંકી શકાય. વિજ્ઞાનની આ શક્તિ અધ્યાત્મમાં પણ છે. મૌન, ધ્યાન દ્વારા આ શક્તિને વિકસાવી શકાય છે કે કશે પણ ગયા વગર કેવળ ચૈતસિક સ્પર્ધનો દ્વારા પ્રભાવ જોલો

કરી શકાય. પરંતુ અધ્યાત્મ શક્તિની ખૂબી એ છે કે વિજ્ઞાનની શક્તિની જેમ એનો હુકુમ્યોગ થઈ શકતો નથી. જેનો હુકુમ્યોગ થાય છે તે અધ્યાત્મવિદ્યા નથી. તે અધોરી વિદ્યા છે, તામસી શક્તિ છે. અધ્યાત્મ તો ઈશ્વરીય સંસ્પર્શ પામવા માટેની વિદ્યા છે.

અધ્યાત્મનું ખેડાણું કરવું હશે તો આત્મપરીક્ષણ ખૂબ જરૂરી છે. જેવી રીતે દાક્તાર અત્યંત નિર્મભ બનીને શરીરની વાઢકાય કરે છે તે રીતે આપણાં મન, બુદ્ધિ અને ચિત્તનું પરીક્ષણ કરાય તો જ અધ્યાત્મના દરવાજા ખૂલ્યો શકે.

મનુષ્યને એ દેહ મળેલા છે. તો તેણે ધીરે ધીરે બૌતિક દેહનું વર્યસ્વ ધરાડતા જઈ આત્મીય દેહનો પ્રભાવ વધારવાનો છે. આત્મીય દેહના પ્રભાવ બણે જીવનમાં આત્મમય ક્ષણો વધતી જશે. દેહ પાસે કામ લેવાનું હશે ત્યારે જ અંતરાત્મા દેહમાં રહેશે, બાકી તે અધ્યક્ષતા જગતની શક્તિની ઉપાસનામાં લીન રહેશે.

અધ્યક્ષતની સાથેનો સંખાંધ તે સાધનાનું પ્રથમ ચરણ છે. બહારથી જેટલા ખાલી, હળવા કૂદાશ થઈશું, તેટલે આ સંખાંધ વધારે જીવંત અને પ્રાણવાન બનશે. છેવટે તો ઈશ્વરના હાથનું એના, એના હોઠની મોરલી બની જવાનું છે. એનાને પોતાને કશું સર્જવાનું નથી, માલિકને એની પાસેથી જે કામ લેવું હોય તે એ આપી હે, એ જ રીતે મોરલી પણ સાવ પોતી હોય છે, ઈશ્વરની કૂંક તેમાં પુરાય તો જ તે વાગે.

### મૂળ વતનમાં સહાવાસ

જીવનમાં જે કાંઈ અવ્યક્ત છે, સૂક્ષ્મ છે તેની આંખી વર્ચ્યે વર્ચ્યે થતી રહે તે એક બાખત છે, અને અવ્યક્ત સ્વરૂપમાં સતત સ્થિર થવું તે બીજુ બાખત છે. માણુસનું જે સૂક્ષ્મ મૂળ વતન છે, તેમાં વર્ચ્યે વર્ચ્યે જતા—આવતા રહેવું તે એક સ્થિતિ છે, અને પોતાના મૂળ વતનમાં સહાવાસ કરવો તે બીજુ બાખત છે. સૂક્ષ્મવતનના સહાનિવાસી અની જવામાં સાર્થકતા છે.

અવ્યક્ત સ્થિતિમાં જેટલું વધારે રહેવાશે, તેટલું કર્મન્દ્રિય દ્વારા જે કર્મો થશે, તે બાંધનારાં નહીં હોય. મન, બુદ્ધિ કે ચિત્તમાં કોઈ ગૂંઘવાડા નહીં રહે. નિશ્ચલતા, અહંગતા વધતી જશો—અવ્યક્તતાનો. જેમને પરિચય છે, તેઓ અવ્યક્ત શક્તિને પામી શકશે. વ્યક્ત જગત સાથેના તમામ સંપર્ક, વ્યવહાર છતાં થ લીતરનાં મૂળિયાં સતત અવ્યક્ત સાથે જોડાયેલાં હશે.

આ જ સાચું ધ્યાન છે. પરમશક્તિ સાથે સતત અનુસંધાન રહે, અખંડ જગૃતિ, સમૃતિ રહે. ધ્યાનસ્થ થવું એટલે કર્મો છોડવાં તેવું નથી. દિવસમાં થોડો વખત ધ્યાનસ્થ પણ રહેવું જોઈએ, પરંતુ આપણું એ ધ્યાન દિવસની પ્રત્યેક કિયામાં ભાગી નીકળવું જોઈએ, પ્રગટ થવું જોઈએ. અવ્યક્ત સ્થિતિમાં સ્થિર થઈને બાધ્ય કર્મોમાં જતનો વિસ્તાર કરવાનો છે. આવાં કર્મને જ કર્મથોળા

કહે છે. આપણે કર્માની જંનળ નથી જોઈતી, કર્મથોગ જોઈએ છે. થોગણ દ્વારા જ કર્મથોગ સાધી શકાય.

આ થોગ એટલે જ ચુન્ય, જેડાણ. આપણું આત્માનું અવ્યક્ત પરમાત્મા સાથેનું જેડાણ. આ થોગાનું ભૂતિ થાય છે પણી જ સમજન્ય છે કે આપણું ભીતર જેવો આત્મરસ છે, આત્મચેતના છે, તેવી જ આત્મચેતના પ્રાણી માત્રમાં, ચલ-અચલ સમસ્ત વિશ્વમાં છે અને તેથી સૌ એકરૂપ છીએ. સૌ સાથેની આ એકરૂપતા અનુભવવી, અંદરના આત્માના ચુણની છખી પોતાના હૃદયમાં જીવિ, તે જ કે અધ્યાત્મ. જગતને છોડીને અધ્યાત્મ પામી શકાતું નથી. તેને આત્મસાતું કરીને જ તે પામી શકાય છે.

આમ, વિજ્ઞાન અને અધ્યાત્મ, આ એઉ જીવનમાં અતિમહત્વનાં અંગ છે. ઐમાંથી એકેયને વિસારીને કે ખાનું પર મૂકી હઈને જીવનની સર્વાંગીતા અનુભવી શકાય નહીં. માનવ માટે આ એઉ ક્ષેત્ર પરાક્રમનાં ક્ષેત્ર છે. આ ખંને ક્ષેત્રો જેટલાં વધુ જેડાશે, તેટલું આ પૃથ્વી પરનું જીવન વધુ ને વધુ સંપન્ન, સુંદર અને મંગળ બની શકશે.

વૈજ્ઞાનિકોનો એ અનુભવ છે કે રોકેટ દ્વારા જ્યારે અવકાશમાં પગ મુકાય છે ત્યારે અત્યંત હળવાપણું અનુભવાય છે અને પૃથ્વીનું આકર્ષણું ત્યાં ખતમ થઈ જાય છે. આ જ રીતે સાધકોનો એ અનુભવ છે કે ધ્યાન દ્વારા જ્યારે સ્થૂળ જગતની સીમાઓને છોડીને સૂક્ષ્મ જગતમાં દાખલ થવાય છે ત્યારે સંભારની પકડ, સંસારનું જેંચાણું

ઉત્તરોત્તર ઘટતું જાય છે. અવકાશમાં જ્યારે જવાનું થાય  
ત્યારે પાછા વળવાની ચાવી પૃથ્વીવાસી પાસે હોય છે.  
પરંતુ આધ્યાત્મિક જગતમાં આવી જરા પણ પરાધીનતા  
નથી. સૂક્ષ્મમાં જવું કે સ્થૂળમાં રહેવું, બંનેની ચાવી  
આપણું પોતાના હાથમાં છે. પ્રત્યેક માનવે દેહાવસ્થામાં  
રહીને આ સૂક્ષ્મતાનો, દેહાતીત અવસ્થાનો અનુભવ કરવો  
જોઈએ. મનુષ્યમાં જેટલો દેહ વાસ્તવિક છે, સત્ય છે,  
તેટલો જ સત્ય તેનો આત્મા છે. આત્મશક્તિનું ભાન પ્રાપ્ત  
કરવું તે મનુષ્યનું સર્વ્યપ્રથમ કર્ત્વ છે.



## [ ૨ ] અવ્યક્તને પામવાની સાધના

આપણે અવ્યક્ત સાથે અનુસંધાન કેળવવાની સાધના સમજી રહ્યા છીએ. આંતરિક જગત અવ્યક્ત છે. આ આંતરિક જગતના સંતુલન માટે પ્રથમ તો બુદ્ધિને સ્વચ્છ કરવી પડશે, નિર્મણ કરવી પડશે. મલિન, રાગદ્વૈષયુક્ત બુદ્ધિને કદ્દી સત્યની પરખ થઈ ના શકે. બુદ્ધિ સ્વચ્છ, તટસ્થ જોઈએ, વળી વૈજ્ઞાનિક જોઈએ, નિરાસકત જોઈએ. આથી તટસ્થ બુદ્ધિને ધીરે ધીરે સ્થિર કરવાની છે. અડોલ, નિશ્ચલ બુદ્ધિ દ્વારા જ આંતર્ગતનું યથાર્થ આકલન શક્ય છે. આવી સ્થિરબુદ્ધિ દ્વારા આંતર્ગતની તમામ વૃત્તિઓને કાણ્ણું, અંકુશમાં લેવાની છે. માણુસમાં કામ-કોધ વગેરે વાસના પ્રથળ હોય છે, જે તેની વિવેક-બુદ્ધિને આંધળી કરી મૂકી હગમગાવી હે છે.

### બુદ્ધિની કાન-આંખે તથ્યોને સમજો

અધ્યાત્મ તરફની આ યાત્રામાં પ્રથમ મુકામ આવે છે—તથ્યોને સાંકળવાં, સમજવાં અને પછી સંકલ્પ કરવો. જેમનામાં આ સંપ્રજ્ઞતા આવી ગઈ છે તેવા પ્રબુદ્ધ લોકે જીવનના અંત સમયે કાળસાગરમાં રૂષી ન જતાં અહગપણે

સ્થિર જીલા રહે છે અને ત્યાર પછીની લૂભિકામાં સિદ્ધાત્મા પરમ તત્ત્વ ભણી આગળ વધે છે અને આત્માના સ્કુલિંગ રૂપે વિહુરે છે.

જીવનનાં નર્યાં તથ્યોનો તટસ્થપણે અલ્યાસ થાય તો સમજાય છે કે જીવન એક વહેતું જરણું છે. અહીં કશું સ્થાયી નથી, ચિરંતન છે. જીવન તે મુકામ નથી, ચાત્ર છે. આ ચાત્રોનો પણ કોઈ અંતિમ મુકામ છે, અંતિમ મંજિલ છે. આ મંજિલે પહોંચવાના નિશ્ચય સાથે જે ચાત્રા શરૂ થાય તો જ મુકામે પહોંચાય.

અડગ નિશ્ચય, તે પહેલું સોપાન

આ સાધનાપથમાં સુખ્ય વાત છે -નિશ્ચય ! પુરુષાર્થમાં કોઈ આગળ-પાછળ હોઈ શકે, સાધનાક્ષેત્રમાં તો કોઈ પહેલો-બીજો હોઈ શકે, પરંતુ નિશ્ચયના ક્ષેત્રમાં કોઈ કંમ નથી. માણુસમાં કાં નિશ્ચય હોય, કાં તે ન હોય. ઈશ્વર પૂજું નિશ્ચયમાં વાસ કરે છે. ‘નિશ્ચયના મહેલમાં વસે મારો બહાલમો’-ભક્તા નરસૈયાએ ગાયું છે ને !

એટલે કાં હોય છે નિશ્ચય, કાં હોય છે સંશય. મન, વચન કે કર્મમાં સહેજ પણ સંશયનું બિન્હુ ભળેલું હોય તો સાધના શરૂ જ નથી થઈ શકતી. પરંતુ માણુસની નિશ્ચયભુદ્ધિ એની આંખોમાં છલકાય છે. પોતાનું નિશાન સર કરવા માટે એના ચહેરા પર એકાચતા હેખાશે. નિશ્ચયી મનુષ્ય નશાખાજ જેવો પોતાનામાં સ્થિર છે, દઠ છે, અડગ છે. એને ઉગાવવાની તાકાત હુનિયાની કોઈ શક્તિમાં નથી.

આધ્યાત્મિક નશો તે નિશ્ચયનું દર્શાવું

નિશ્ચય બુદ્ધિ એટલે વિજયપ્રાપ્તિનો દર સંકલ્પ.  
સાચો વિજેતા હરમાં પણ જીત અને જીતમાં પણ જીતનો  
અનુભવ કરશો. એ કશાથી પીછેહડ નહીં કરે. ન સમસ્યાથી,  
ન કોઈ વિરોધી વ્યક્તિથી. એ ખીંજ પર આક્ષેપ પણ  
નહીં કરે. આક્ષેપણાં એ તો અધૂરાપણાંની-પોતાપણાંની  
નિશાની છે. અધૂરો ધડો છલકાય એ રીતે. જ્યારે નિશ્ચિત  
બુદ્ધિવાળો મનુષ્ય નીચે પડેલાને જીંચા ઉડાવશે. એના  
જીવનમાં વ્યર્થ, નિર્થક કશું નથી. એના મોહ નાશ  
પામ્યા છે, એટલે જ એની બુદ્ધિ નિશ્ચલ છે.

પરંતુ કયારેક નિશ્ચય હોય છે, છતાં ખુશી નથી હોતી.  
એનું કારણ એ કે નિશ્ચયનો નશો નથી. આધ્યાત્મિક નશો  
એ નિશ્ચયનું દર્શાવું છે, તેમાં સહા આત્મસમૃતિ જગૃત  
રહે છે. આ છે આત્મિક સ્વરૂપનો નશો, ખીંજે છે અલૌકિક  
જીવનનો નશો, ત્રીજે છે પયગંખરપણાંનો નશો અને ચોથો  
છે લવિષ્યનો નશો. જેનામાં આધ્યાત્મિક નશો હશે, તે  
છૂંઘો છુપાશે નહીં: ‘સૂરજ છૂપે નહીં બાદલ છાયો’—ની જેમ  
આ પણ સ્વયંપ્રગટ હશે. પોતાના પ્રકાશમાં સ્થિત, એ  
ખીંજને પોતાના તરફ એંચતો રહેશે. ઐક્ષિકર બાહશાહની  
જેમ તે સહા મસ્ત હશે. તેની લીતર માયાનો પ્રવેશ નહીં  
હોય. આત્મસ્વરૂપ પ્રગટ કરવું એ જ એનો જીવનધર્મ  
હશે. આ નિર્વિકલ્પ નિરીચ્છ રહેવાની જે વિશોષતા છે  
તેને કારણે જ આવે મનુષ્ય સૌનો પ્રિય બની રહે છે.  
સૌનો ખ્યારો, છતાંય ન્યારો.

આ ન્યારા, છતાંય ર્યારા સંખ્યાંધની ખૂખીએ છે કે તે પરિપૂર્ણ ગ્રેમનો અનુભવ કરાવશે, પરંતુ આસક્તિનો તેમાં છાંટો ય નહીં હોય. માણસને જીવનમાં આસક્તિ, વળગણો, પાડે છે, ઓટાં કામો કરવાં પ્રલોકનમાં નાંખે છે. જીવનમાં સંખ્યાનું મહત્વ છે, પરંતુ તેનાથી ય વધુ સત્યનું મહત્વ છે. સત્ય પર આધારિત સંખ્યામાં જ શક્તિ હોય છે. એવી શક્તિ કે જે બંને પક્ષ માટે હિતકારી અને ઉદ્વિભૂતી હોય. આવી શક્તિ પ્રાપ્ત થવાનું સુધ્ય કારણ છે, પેલો અહગ નિશ્ચય.

પરંતુ અહગ નિશ્ચય થયા પછી પણ બધા માટે રસ્તો જાજમાર્ગ બની જાય છે તેવું નથી. અનેક જન્મોના સંસ્કાર આપણા ચિત્ત પર અંકિત થયા છે. એ બધા સંસ્કારોથી આપણી જતને સુકૃત કરવી પડશે. સંસ્કાર એટલે છાપ, મહોર. આપણા ચિત્ત પર આપણા પાદ્યારિક સંખ્યાની, કાર્યક્ષેત્રના સંપર્કોની, બહારની હુનિયાની અનેક છાપો અંકિત થયેલી હોય છે. હું કોઈ નો પુત્ર, પિતા, બંધુ છું, વેપારી—અમલદાર કે વડીલ—દાડતાર છું. આ બધા સંસ્કારો બાદ્ય સંસ્કારો છે. આ આપણું મૂળ સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપમાં આપણે કેવળ પરમ તત્ત્વના અંશ છીએ અને આપણે આ અપૂર્ણ હસ્તિમાં પૂર્ણતાને પ્રગટ કરવા માટે જન્મ્યા છીએ. આ મૂળ સ્વરૂપને યાદ રાખી આપણી બાદ્ય ભૂમિકામાં રહીએ તો વાંધી નથી, પરંતુ અંદરનો તંતુ સાંદ્રયા સિવાય કેવળ બાદ્ય ભૂમિકામાં રહેવાથી અવ્યક્તની સાધના થઈ શકતી નથી.

### આધ્યાત્મિક શક્તિ

શક્તિઓ તો અનેક પ્રકારની હોય છે. એ શક્તિઓનો સહૃપદોગ, હુકુપદોગ બંને થઈ શકે. માત્ર આધ્યાત્મિક શક્તિ એવી ચીજ છે, જેનો હુકુપદોગ ન થઈ શકે. આધ્યાત્મિક શક્તિ માટે ત્રણુ ચીજને કામે લગાડવી પડે છે—મન, વાણી અને કર્મ. આ ત્રણુ એકી સાથે કામ કરતાં થવાં જોઈએ. પરંતુ આપણે કચારેક મનથી મજબૂત રહીએ છીએ, તો વાણીથી ઢીલા પડી જઈ એ છીએ. વાણીમાં મજબૂત હોઈ એ તો કાર્ય કરતી વખતે પાછા પડી જઈ એ છીએ. આ ત્રણુની શક્તિ એક સાથે લાગે તો મુક્તિની દિશા મળે. જેવી રીતે સુષ્ઠિની ર્ઘ્યનામાં સ્થાપના, પાલન—પોષણ અને વિનાશ ત્રણુ ચીજ કામ કરે છે, એ રીતે મનસા, વાચા, કર્મણુ સાધના થાય તો જ તે પરિપૂર્ણ સાધના બને છે.

બંધનયુક્ત આત્મા જે કાંઈ સુખ કે ઝુશી અનુભવે છે તે કાયમી ટકનારાં નથી હોતાં. અત્યંત કામચલાઉ હોય છે, ક્ષણલુંવી હોય છે. વળી એમના સુખનો આધાર કોઈ ને કોઈ બાહ્ય ચીજમાં રહેલો હોય છે. બાહ્ય સાધન હાથમાં ન રહ્યું, તો ઝુશી પણ અલોપ. કેવળ મનને આધીન નાચતા રમકડા જેવી હાલત થાય છે. એટલે માનસિક વિકલ્પોને આધીન ન થવાથી આધ્યાત્મિક શક્તિ વિકસે છે.

આ માનસિક વિકલ્પોનું બંધન મોટા હોરડા જેવું નથી હોતું. કાચા સૂતરના તાંત્રણા જેવું ઓણું હોય છે.

પણ અનેક સંકદ્વય-વિકદ્વય જિડતા જ રહે છે એટલે તે બંધનપાશ તોડવા મુશ્કેલ પડે છે. આપણે કોઈ પણ ઉત્સવ સુકૃત અનીને ઉજવવો છે.

### મન જીત-જગત જીત

આધ્યાત્મિક શક્તિ મનોજ્યની શક્તિ છે. મન જીત્યું તો જગ જીત્યાં-આવું જે કહેવાય છે તેનું આ જ રહુસ્થ છે. એટલે મન પર અંકુશ મેળવવાથી વિશ્વના અધિકારી અની શકાશે. પરંતુ માલિક અનવા માટે બાળક અનવું જરૂરી છે. કોઈ ગમે તેટલું મોટું હોય, પણ પરમાત્માના દરખારમાં તો તે નાનકડાં બાળક જ છે.

બાળક અનવું એટલે હળવાં ફૂલ અનવું. આખી હુનિયાનો એન્ઝે ચિત્ત પર લઈને ફરવાથી બાળક ન અનાય. નિરૂપાધિક ચિત્ત તે બાળક હોવાની નિશાની છે. બીજું માયાથી અચતા રહેવું, તે છે બાળક હોવાની નિશાની. જે અચ્યું તે અચ્યું. કશું આપણું નથી. આ શરીર છે તે પણ પ્રભુની અમાનત છે. આપણે તો તેના દ્રસ્ટી છીએ. ઈશ્વરીય કાર્ય કરવા દેહ મળ્યો છે, એનો ઉપયોગ પૂરો થશે ત્યારે પાછો વાળી દેવાનો છે.

આધ્યાત્મિક સ્નેહનો અનુભવ થવો જોઈએ. પછી એ ખુશખૂને સર્વત્ર ઝેલાવવાની છે. કેવળ પોતાના અંતરને! સંતોષ પર્યાપ્ત નથી. તે સંતોષ સેવાકાર્યમાં જગવો જોઈએ. જે કાઈ ઉપલબ્ધ થઈ છે તેને લોકોમાં વહેંચવાની છે. આપણે પરમ સાગરસ્વરૂપ પિતાનાં સંતાન છીએ, તો

એ સાગરને લુંટાવવાનો છે—સેવારૂપે. દરેકમાં કાંઈક ને કાંઈક વિશેષતા પડેલી છે, તે વિશેષતાને કામે લગાડી સમાજની સેવા કરવાની છે. આપણે વિશ્વકર્માણ માટે પ્રેરિત છીએ. હીવો સળગે છે તો પોતાને અજવાળું મળે તે માટે નથી અળહળતો. એ તો પ્રગટીને બીજાને અજવાળું આપે છે. આપણે લેવતા નહીં, દેવતા બનવાનું છે. જે બીજાને હે છે, તે છે દેવ. પોતાનામાં જે કાંઈ ગુણો છે, તેનો વિસ્તાર કરવાનો છે. નિર્બંધને શક્તિ, અજાનીને જ્ઞાન. જે કાંઈ તમારી પાસે છે તે આપતા જાએઓ. જેટલું આપતાં જરૂરો, તેટલું વધતું જરૂરો. સહા હેવી અર્થાત્ હમેશાં હેનારી શક્તિ. તમારામાં હાતા—દેવતા સાકાર રૂપે પ્રગટ થવો જોઈએ.

સ્વયંસંતુષ્ટિ એ ખૂબ મોટી બાણત છે. આત્મસંતોષ ચહેરા પર ચ્યમકવો જોઈએ. આત્મસંતોષી વ્યક્તિ ન તો કોઈથી ઉખલગીરી અનુભવશે, ન કોઈને ઉખલ કરશે. એને પોતાનામાં જ સંતોષ છે. બીજા કોઈ પાસે અપેક્ષા નહીં, માંગણી નહીં, પછી અસંતોષ થવા માટે કોઈ કારણું જ નહીં રહે. પોતાના સૂળ કેન્દ્રભિન્નમાં સ્થિર થઈ જવાય, બાધ્ય પ્રાપ્તિની કોઈ ઘેવના ના રહે, પછી અસંતોષ માટે કોઈ પ્રયોજન જ નથી રહેતું. કૂલને પોતાની હૈરમ હૈલાવવામાં જ આત્મસંતોષ છે, કોઈ તેને સૂંધે ના સૂંધે તેની તેને પડી નથી હોતી.

બધા મનુષ્યો એક કક્ષા ઉપર હોતા નથી. આત્માના અનુભવની બાણતમાં કોઈ આગળ છે તો કોઈ પાછળ. જેવી

રીતે લોખંડને વાળવું હોય તો તેને તપાવવું પડે અને પછી તેના પર હુથોડા પીઠવા પડે. જ્યારે ગુલાખના કૂલને સહેજ ગોળ ગોળ ફેરવો તો એકદમ એની પાંદડીએ ખરી પડે છે. કેટલાકને પુરાણા સંસ્કાર ભૂસવામાં, દેહ સાથેનું તાદાતમ્ય એગાળવામાં લોખંડને તપાવવા જેટલી મહેનત કરવી પડે છે, કેટલાકના પુરાણા સંસ્કાર ગુલાખની જેમ ખરી પડે છે.

પરંતુ આત્માનુભૂતિ, અવ્યક્ત જગતનો સંસ્પર્શ પામવામાં મોડું ન કરવું જોઈએ. સમય તો પ્રતિપળ આગળ વધતો જ જય છે. નિરંતર જગૃતિ અને સાવધાનીપૂર્વક માનવજીવનના આ લક્ષ્યને સર કરવું જોઈએ. જીવનની કોઈ પણ અનુભૂતિ, કોઈ પણ ચીજ એની કિંમત ચૂકુંયા વગર મળતી નથી. સૂક્ષ્મતાનો અનુભવ પણ એની કિંમત માંગે છે. મનુષ્યની સાધના, પુરુષાર્થ એક તરફ માણુસને એંચે છે, તો બીજુ બાજુ એનાં કર્મક્રણ પણ તેને બીજુ તરફ એંચતાં રહે છે. પરંતુ સાધનાનું, ચોગનું બણ છેવટે વિજ્ઞ્યી સિદ્ધ થાય છે. કર્મક્રણ પાસે હારવું ન જોઈએ. શરીર કર્મોનાં ક્રણ લોગવતું રહે, પરંતુ બીજુ બાજુ આંતરિક વિકાસ કર્મોનાં ક્રણથી અલિંગત રાખે તેવી સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ.

### પ્રેમ અને જ્ઞાન-સાધનાની ઢાલ

અવ્યક્તની આ સાધનામાં પ્રેમ તથા જ્ઞાન બંનેની શક્તિ પ્રાપ્ત કરવી જોઈશે. પ્રેમ અને જ્ઞાન બંને જેમણે

મેળવ્યાં હશે, તે જ અવ્યક્ત જગતને એડી શકશે. ચરાચર સમસ્ત સમાજિ માટે પ્રેમ અને બીજુ આજુ આત્મશક્તિનું ભાન આ બંને આયામ દ્વારા જીવનની નવી ક્ષિતિજે એવી શકાય છે.

જીાન એટલે માત્ર માહિતી મેળવવી, બુદ્ધિથી તથ્યોને જાણું વેવાં તે જીાન નથી. ગોળ મીઠો છે તેની જાણકારી હોવી એક બાખત છે, પરંતુ ગોળનો સ્વાદ ચાખીને પછી તેની મીઠાશ વિષેની જાણકારી હોવી તે બીજુ બાખત છે. માહિતીનું જીવનમાં પ્રત્યક્ષીકરણું થાય ત્યારે જ જીાનનો આવિર્ભાવ થાય છે. તો જીાનની આવી સાધના કરવાની છે.

જીાન દ્વારા, જે વ્યક્ત છે તેવી વ્યક્તિનો અવ્યક્ત સાથે શું સંખ્યાં છે, ધર્તર વ્યક્ત સૃષ્ટિ સાથે શું સંખ્યાં છે તે આત્મસાતું કરવું પડશે. નિજ સ્વરૂપનું મૂળભૂત જીાન જીવનના ધરણા પ્રક્ષોની હુલચલને શરીરી હે છે, ચિત્તને અચળ અનાવે છે.

જીાન જેટલી જ શક્તિ પ્રેમતરવમાં છે. જીાન એ સ્વરૂપને સ્થિર કરનારું પ્રથમ બિનહુ છે, જ્યારે પ્રેમ એ પ્રથમ બિનહુમાંથી રેખા નિર્માણ કરે છે, જે અસીમ સુધી પહોંચી શકે છે. પ્રેમ દ્વારા જીાનની યાત્રા આગળ ધર્પી શકે છે.

પરંતુ આ પ્રેમ, પ્રેમ ત્યારે જ કહેવાય જ્યારે તે શુદ્ધ હોય. નિરપેક્ષ હોય. પ્રેમ આત્માના શુણો સાથે કરવાનો છે, શરીરનાં પાંચ તત્ત્વો પર નહીં. આવો આત્મિક ભૂમિકાનો પ્રેમ હશે તો તેને પોતાને કશી અપેક્ષા જ નહીં

હોય, તેના કોશમાં કેવળ આપવાનું જ આપવાનું હશે,  
લેવાનું લગીરે નહીં. પ્રેમ આપી જણે છે.

આવો પ્રેમ હૃદયમાં અનુભવવાનો છે. પ્રેમની આવી  
શક્તિ નિર્માણું કરવા માટે બીજુ વ્યક્તિ સાથેનું આત્મીય  
અદ્વૈત અનુભવવું પડશે. એ વ્યક્તિ વચ્ચેનું અંતર ઘટાડવું  
પડશે. વચ્ચે સામેની વ્યક્તિની મર્યાદા, દોષો, અવગુણો  
વગેરે અંતરાચ્ચે. અનીને જિલ્લા રહેશે, પરંતુ તે બધા શારીરિક  
હોષેના પહોંચાને લાંઘી અંહરના શુદ્ધ, યુદ્ધ, આત્મસ્વરૂપ  
સાથેની એકત્તા પામવી પડશે. પ્રેમ સાધનાની હીર્ઘાયાત્રા  
છે. માત્ર કોઈ ચીજ કે વ્યક્તિ ગમી જવી અને તેને  
પામવાની ઈચ્છા થવી તે પ્રેમ નથી. એ તો મોહ છે.

મોહની વૃત્તિમાં ચિત્તમાં વળગણું નિર્માણું થાય છે,  
વ્યસન જેવું થઈ જાય છે, નિર્બેંપતા, નિરપેક્ષતા રહેતી નથી.  
મોહ, આસક્તિ જુહી ખાખત છે અને પ્રેમ જુહી ખાખત છે.  
પ્રેમમાં સામા માણુસ માટે નિર્ભાત હોવા છતાં વળગણું  
નથી, આસક્તિ નથી, પ્રેમ નિર્બેંપ છે, નિરાયહી છે.

મોહનું ઇપ છલનારૂપ છે. કયારેક તે શુદ્ધ મોહનો  
પોશાક પહેરીને આવે છે. સતકમેનો પણ માણુસને મોહ  
થઈ જાય છે. એ કર્મ સાથે એ એટલો બધો એકરૂપ થઈ  
જાય છે કે પોતાની મૂળ યાત્રા તે ભૂલી જાય છે. વાસ્તવમાં  
કોઈ પણ કાર્ય કે વ્યક્તિ પ્રત્યે નિરાસક્તિ કેળવી હાર્દિકતા  
પ્રગટ કરવી તેનું નામ પ્રેમ છે. પ્રેમ નિરાસક્ત, નિર્બેંપ,  
અધ્યાત્મ-૨

નિરપેક્ષ, નિર્બંજ હોય છે. પરંતુ મોહ છહ્વાવેશી છે. પ્રેમનો સ્વાંગ ઓઢીને તે માણુસને ભુલાવે છે અને વર્ષોં સુધી અજ્ઞાનનાં વમળોમાં અટવાતો રાખે છે. એટલે મોહનિક્રા જેટલી વહેલી તંત્રય તેટલો ફાયદો છે.

### સ્નેહ સૂર્ય સમો

સ્નેહ નિરપેક્ષ, નિર્બંજ, નિઃસ્વાર્થ હોશે તો તે આધ્યાત્મિક અનુભવ કરાવશે. સાચો સ્નેહ પુરાણા સ્વાર્થી સાંસારિક સંખ્યાને સહેજે ભુલાવી દઈ શકે છે. એને ન ભૂતનું, ન વર્તમાનનું વળગણું હોય છે. આવો સ્નેહ જ પ્રભુમય બનાવી શકે છે. આવો સ્નેહ જીવનમાં શક્તિ સીંચે છે. ન તો એ પોતે કમનેર હોય છે, ન બીજા કોઈને કમનેર બનાવે છે. બલકે આવો સ્નેહ જ બીજના જીવનમાં પણ શક્તિ સીંચી શકે છે.

પ્રેમની પણ અનેક કક્ષા હોય છે. પ્રથમ કોટિનો જે સ્નેહ છે, તેમાં વધઘટ નથી થતી. ચંદ્રની કળામાં જે રીતે વધઘટ થયા કરે છે તે રીતે ઈશ્વરમાં લીન એવા સ્નેહને વધઘટની કળા નથી હોતી. એ તો સૂર્યની જેમ સહા સમાનપણે અળહળ્યા કરે છે. એ સહા સ્નેહી હોવાને લીધે પ્રકૃતિ અને માયા તેની દાસી બની જય છે. માયા પોતાનો રંગ તેના પર ચઠાવી નથી શકતી. માયા તેની પાસે હારી જય છે. આવો સ્નેહી માટે પરમાત્મા જ સર્વ કાંઈ છે, બાકી અધા તેના માટે સમાન છે. એનો સ્નેહ કેન્દ્રમાં જિલ્સા છે, એટલે પરિધિ પરની આખી હુનિયા એના જીમાનાંતરે છે.

બીજુ કક્ષાના સ્નેહી સ્નેહ તો કરે છે, પરંતુ તેમની સ્નેહવર્ષા નિરંતર નથી વરસતી. વચ્ચે વચ્ચે વાવાડોડાં આવી જય છે, એટલે આવા સ્નેહીઓ મુશ્કેલી પણ અનુભવે છે. વળી સ્નેહમાં પણ ભરતીઓટ આવ્યાં કરે છે. એક જ ધારે વરસનારો આ સ્નેહ નથી. એમાં કહી પૂનર છે, તો કહી અમાસ છે.

ત્રીજુ કક્ષામાં એવા સ્નેહી આવે છે, જે સમય પ્રમાણે સ્નેહ કરી જાણે છે. આ લોકો જાણે છે કે સાચો સ્નેહ તો પરમાત્મા પાસેથી જ મળી શકે છે. તેમનામાં આવી સમજ છે, પરંતુ તે કાયમ રફતી નથી એટલે પુરાણું સંસ્કારો ચિત્ત પર ચઢી જય છે અને પછી વ્યર્થ સંકદ્પોના ઓળ હેઠળ દખાઈ જય છે. કચારેક આકાશમાં ઓડે, તો કચારેક પાતાળમાં ચંપાઈ જય. કોઈ ને કોઈ સંસ્કાર તેમને પ્રકૃતિવશ, માયાવશ કરી મૂકે છે. પણ પાછો પેદા સાચા સ્નેહનો સ્વાદ ચાણયો છે એટલે વળી પાછા પ્રયત્નપૂર્વક સાધનામાં ખેંચાઈ આવે છે. તો આ રીતે એમના જીવનમાં સતત ખેંચતાણું છે, સતત સંધર્ષ છે. પ્રકૃતિને જીતી નથી એટલે માયાને વશ થઈ જય છે. માયાના વશીકરણુના બંધ ઢીલાં પડે છે, ત્યારે કરી પ્રભુ તરફ ખેંચાઈ આવે છે. આ કક્ષા ત્રીજા નંબરની છે. પરંતુ સહાસંસારી સાધારણ લોકો કરતાં તો આ કોટિના સ્નેહીજન આગળ છે જ.

પ્રથમ કોટિના સહાસ્નેહી આત્મા કમળપુણ્ય સમાન

છે, નિસ્પૃહ છે. પ્રભુના તે અત્યંત ખ્યારા છે, ન્યારા તો છે જ. એટલે તેમનામાં શક્તિ પણ છે. બીજુ કોટિના સ્નેહી પણ પ્રભુના ખ્યારા તો છે જ, પરંતુ શક્તિનો વિજ્ઞય-ટંકાર તેમનામાં નથી અનુભવાતો. એમના માટે તો ‘તારાં છીએ અને તારાં રહીશુ’ એ જ ગીતરટણ છે. સ્નેહ છે એટલે એમની સલામતી જોખમાતી નથી, પરંતુ ‘સહા’ શાખદ એમના જીવનમાં નથી, એટલે ‘કચારેક કચારેક’ના કાંઠે તેઓ રજણતા રહે છે. બીજુ કોટિના સ્નેહીએ માટે તો પુરુષાર્થ જ સંરક્ષક શક્તિ છે. જેટલો પુરુષાર્થ જથ્થત અને ઉત્કટ હશે એટલો પુરાણા સંસ્કાર પર વિજ્ઞય મળશે. પુરુષાર્થ હીકો પડશે એટલી માયા ફરી વળશે. ધીરજની કૃપા હશે તો ધીરે ધીરે ઉપરની કોટિમાં જઈ શકાશે.

સ્નેહ એવી ભાષા છે, જેને કોઈ અક્ષરજાનની જરૂર નથી. સ્નેહ સૌ કોઈને જીતી લે છે. સ્નેહ કોઈ ભાષા જાણુતો નથી. સ્નેહી આત્મા પુણ્યશાળી આત્મા છે. તે સૌના ઉત્કષ્ણ માટે મથે છે એટલે તે પૂજનીય પણ અની જય છે. એનાં પુણ્ય એને પૂજય અનાવી હે છે. સાચા સ્નેહની કસોટી એ છે કે તે સ્નેહીજનને જાંચે ચઢાવે છે. સ્નેહી-જનોના હુર્ગણોની ઘૃણા નથી કરતો, પરંતુ તે અવગુણોને શુણોમાં પલટાવવાનો પુરુષાર્થ કરે છે. સાચા સ્નેહ હોષેને પચાવી જય છે. સ્નેહ માણુસનું મૂળ પોત જુએ છે. વસ્ત્ર ઉપરની ભાત કેવી છે, તેમાં કેવા રંગ પૂર્યા છે વગેરે તરફ તેનું ધ્યાન નથી. મૂળ પોત કેટલું ઘટ છે, તે કસી લઈ

તેને વધારે મજબૂતી આપવાનું કામ કરે છે. સ્નેહ પોતે પોતાનામાં જ સાર્થક છે. પ્રેમનો બહલો પ્રેમ જ છે. પ્રેમ કરવાથી હૃદયમાં જે પ્રેમની લલકરતા અનુભવાય છે, તે જ પ્રેમની સાર્થકતા છે.

પ્રેમ જ્ઞાનપૂર્વક હોવો જેઈચે. નિર્માણ અને શુદ્ધ મોહુ આ બંને લિન્ન અવસ્થા છે. જે સિદ્ધાત્મા છે તે નિર્માણી હોય છે, જ્યારે સાધકની અવસ્થા શુદ્ધ મોહુની હોય છે. લલે સારી વસ્તુની હોય, પણ આસક્તિ તે આસક્તિ છે. વિરક્તિ તદ્દન જુદી બાખત છે. બંને વચ્ચેનું આ અંતર કષાય છે ત્યારે જ અવ્યક્ત જગતનો સ્પર્શ થાય છે.

માણુસનું ચાલક બળ છે તેની ઈચ્છા. ઈચ્છાને વાસના કહો, કામના કહો, પણ તે માણુસમાત્રમાં ભરપૂર પડી હોય છે. આત્માને ઓળખવો હશે તો આ કામનાના ક્ષેત્રને છોડવું પડશે. કામ અને આત્મરામ સાથે રહી ન શકે.

### કામનાત્યાગ અને જ્ઞાનોપાસના

સાધનાની વાટે આગળ વધવું હોય, અંતરાયેનો સામનો કરવો હોય તો કામના છોડવી પડશે. કામના અને સામનો સાથે સાથે નહીં ચાલી શકે. ત્યાગ, તપશ્ચર્યા અને સેવા. આ ત્રણ સાધન હશે તો જ અવ્યક્તને પામવાની શક્તિ લાઘશે. તપશ્ચર્યા પણ જ્ઞાનપૂર્વક થવી જેઈચે. જેમને દેલવાડાના ફરેરાની મૂર્તિ યાદ હશે તે જાણુતા હશે કે તેમાં તપસ્વીઓની મૂર્તિ ત્રિનેત્રી છે. આ ગ્રીજું નેત્ર તે જ્ઞાનનું

નેત્ર છે. જીનાનનું નેત્ર ખૂલ્યા વગર તપક્ષીર્યા પણ વાંઝું  
સિદ્ધ થાય છે.

કામનાને નાથવા પહેલાં તો કામનાને સમજવી પડશે.  
અસહૃવાસનાનો સમૂળો ત્યાગ અને સહૃવાસનાના જેરને,  
આચહને પણ ધીરે ધીરે ઓછાં કરવાં પડશે. સહૃવાસનામાં  
રહેતો આચહ તે સાપમાં રહેતા ડંખ જોવો છે. સહૃવાસનાને  
જ પોતાનો આચહ કરવા હેવો, બાકી નિરાચહી વૃત્તિ સેવવી.

સાધનામય જીવનમાં કર્મને નિષેધ નથી. પણ કર્મ  
જંલળ ન બનવું જોઈએ, તે બાંધનારું ન હોય જોઈએ.  
કર્મ જોડનારું બનવું જોઈએ. કોની સાથે જોડાવાનું છે?  
પરમતત્ત્વની સાથે, અંતરસ્થ પરમાત્મા સાથે જેડી આપે  
તેવું કર્મ ઈષ્ટ છે. આવા કર્મને જ કર્મચોગ કહે છે.  
પ્રભુ સાથે ચોગ કરાવી આપે તેવાં કર્મો કરતાં રહેવાનું છે.

આપણે કોકો હંમેશાં જે વ્યવહારો ચલાવીએ છીએ  
તે છે કેવળ કર્મ. તેમાં પરમાર્થ પ્રગટ થતો નથી, ચોગ  
નિર્માતો નથી. સાધકે કર્મમાં પરમાર્થ અને ચોગ પ્રગટાવ-  
વાના છે. વ્યવહારી અને પરમાર્થ એમ ઐવડી ભૂમિકા એક  
જ કિયામાં લજવી શકે તે જ સાધનાની કણા છે. જેવી  
રીતે નિષ્કિયતા તે ચોગ નથી, એ જ રીતે નરી કર્મઠતા  
તે પણ ચોગ નથી. કર્મનું અનુસંધાન અભ્યકૃતના ઐડાણ  
સાથે જોડાયેલું રહે તેવાં જ કર્મો બાંધનારં નથી હોતાં,  
બાકી કર્મો માણુસને બાંધે છે.

સાધનામાં એક ઉક્તિ વારંવાર આવે છે, તે છે—

મનસા, વાચા, કર્મણા-મન, વચન અને કર્મ. કોઈપણ કાર્યને મન દઈને, મનોપૂર્વક, માનસિક સાથ આપીને સિદ્ધ કરવું હોય તો નિરાકારી સ્થિતિમાં રહેતાં શોખવું પડશે. નિરાકારી એટલે ભલે કોઈ કાર્યનું સ્થળ પરિણામ આવે ન આવે, નિરાકાર સ્વરૂપમાં જ આપી સાધના મૌનપણે ચાલતી રહે, તો પણ ચિત્તમાં પૂર્ણ સ્વસ્થતા હોય. આપણા દ્વારા થતી સેવા સાકાર બને છે, ત્યારે તેમાં કીર્તિની લાલસા ભણે છે. માટે મનસા સેવા થાય તે માટે નિરાકારિતા ઉત્તમ છે.

સેવાને વાચા દ્વારા સિદ્ધ કરવી હશે તો નિરહંકારી બનવું પડશે. વાણીને જે નિરહંકારિતાની લગામ નથી લગાવતાં, તો તે ધૂટેવા ઘોડાની જેમ બધું કર્યુંકારબધું ધૂળમાં લેળવી ઐહાનમેહાન કરી મૂકે છે. એટલે સેવા વાણી-મૂલક હોય તો તેનો ડંખ કાઢવા એને નિરહંકારિતાની ઉપાસના જરૂરી છે.

કર્મ દ્વારા થતી સેવા તો જ ઉપકારક નીવડે જે તે નિર્વિકારી હોય. મોહ, માયા, આસક્તિ કે મમતાના બંધને બંધાયેલું કર્મ સુગંધી નથી હેતું. કર્મનો યોગ ત્યારે જ થાય, જ્યારે તે નિર્જામ હોય. સકામ કર્મ યોગ બને એ ભારે કપરી બાયત છે. એટલે કાચા દ્વારા જે કર્મો થાય તેમાં જેટલી નિર્જામતા, નિર્વિકારિતા, નિર્મભતા પ્રગટ થશે તેટલું તે પરિપૂર્ણ થશે.

ક્રણની ધંઢાથી થતાં કર્મો માણુસને બાંધે છે. કર્મ કાર્યા સ્વિવાય રહી શકાતું નથી, એટલે ઉપાય આ જ છે

કે કર્મો કરવાં, પરંતુ ફળની અપેક્ષા ન રાખવી. આ જ છે નિષ્કામતા. નિષ્કામતાને નામે હાથ લોડીને કશું કર્યા સિવાય એસી રહીએ તો જીવનમાં જે સાધવાનું છે તે છૂટી જશો. એટલે કર્મો કરવાં અને એનાં પરિણામોની ચિંતા પરમપિતા પર છાડી દેવી.

### દેહપરાયણના ક્ષીલુ કરવી પડશો

દેહના ભાનને છાડવાનું છે. જૈવી રીતે શરીર પરનાં વસ્તો સહજ રીતે છાડી દઈએ છીએ એ જ રીતે દેહ સાથેનું પોતાનું અમાનીકરણ જે મનમાં અંકિત થઈ ગયું છે તેને ત્યજી દેવાનું છે. તંગ વસ્તો શરીર પરથી ઉત્તાસ્તાં વાર લાગે છે એ રીતે કોઈ સંસ્કારોમાં શરીર તંગ થઈ ગયું હોય તો તેનાથી મુક્ત થવું શોડું અધરું પડે છે. એટલે પહેલાં તો તપાસી લેવું પડશો કે ક્યા દદ સંસ્કારના વસ્ત્થી આ દેહ વીં ટળાયેલો છે !

તમામ સંસ્કારોથી મુક્ત થયેલી ચેતના માટે રસ્તો સાવ સરળ છે. દરેકેદરેક બાધતમાં સરળ રહેા, સહજ અનો. સંક્રિય પણ રહેવું અને પ્રભાવક પણ રહેવું પડશો. પરંતુ જ્યાં સુધી ચિત્ત પર કેવળ સ્થૂળ જગત છવાયેલું રહે છે ત્યાં સુધી બાધ્ય સંસ્કારોની પકડમાંથી છુટાતું નથી. દેહસ્થ અવસ્થા ઘટાડતા જઈ, આત્મસ્થની ભૂમિકામાં જેટલું વધારે રહેવાશો, તેટલું જલ્દી સંસ્કારમુક્ત થવાશો.

### કસોયીએ સાધનાને કસો

સ્થૂળ દણિને પેલે પાર વસતી સૂક્ષ્મ સૃષ્ટિ સાથે, અવ્યક્ત જગત સાથે આપણો સંપર્ક સધાઈ રહ્યો છે તેની

કસોટી આ છે કે આપણા પ્રત્યેક કર્મમાં અલૌકિકતા પ્રગટ થાય અને કર્મ કરતી વખતે દરેક કર્મનિર્ધયો દ્વારા હન્ત્રિયાતીત સુખ પ્રાપ્ત થાય. આ છે કસોટી. આપણાં કર્મો આપણું દર્શાયું બનશો; કર્મમાં અવ્યક્ત તત્ત્વની છખી જિલાશો. આપણાં કર્મો આપણા અસદી ચહેરાની આરસી બનશો. કર્મ કરતી વખતે વિકારો પ્રગટ થાય તો સમજવું કે આપણા ચિત્તમાં હજુ મહિનતા પડી છે. જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી દર્શાયુની છખી અંખી ઉપસવાની. એટલે દર્શાયુને પહેલાં ચોળખું કરવું પડશો. કર્મમાં ઇળાસકિત હોય ત્યાં સુધી તે મહિન રહેવાનું, અંખું રહેવાનું. એને ચોળખું કરવા કર્મિણી ભેવના છોડવી પડશો.

પરંતુ આવું શુદ્ધ દર્શાયું પણ કેવી રીતે પ્રાપ્ત કરીશું? દર્શાયું પ્રાપ્ત થશો અર્પણથી, સમર્પણથી. જે સર્વસ્વ ત્યાગી હશો, તેના દર્શાયુમાં અવ્યક્તની અલૌકિક છખી જિલાશો. દર્શાયુમાં અંખી છખી હેખાશો તો મંથન ચાલશો. પુરુષાર્થને વધારે ઉત્કટ કરવાની પ્રેરણા મળશો.

દર્શાયુમાં વિકારો ન જાડવા જોઈએ. કામ, કોધ, મોહ, દોષ, મદ, મતસર, આળસ અને ભય આ વિકારો માણસના દર્શાયુને અંખું કરે છે. આમાંથી સુકૃત થવા સ્વરૂપની પિછાણુ, સ્વધર્મની સમજણુ, સ્વહેશ અંગેની નિશ્ચલતા, સતકર્મ અંગેની સક્રિયતા, સ્વલક્ષ્ણ અંગેની નિઃસંશયતા, સ્વલક્ષ્ણ અંગે જાન અને સ્વદર્શન એટલે કે આત્મહર્શન અંગેની પિપાસા ઉપયોગી થઈ શકે.

આતમદર્શાનં એટલે પોતાના મૂળ ચહેરાનો પરિચય. પોતાના મૂળ વતનની મુલાકાત.

આ દેહભાનનું વિસ્મરણ થાય તે અગાઉ બીજા ધણા હુશમનોનો સામનો કરવો પડશે. સૌથી માટો હુશમન છે—મિથ્યાલિમાન. ‘હું એટલે કોણું?’—આ અહંકાર માણસને અનેક પછડાટો ખવડાવે છે. કામ, કોધ, અહંકાર, રાગ, દ્રોષ, આગસ અને ભય જેવા વિકારાને છોડવા પડશે, અને આગળ કહેવા સાત શુણુંને ધારણ કરવા પડશે. સ્વરૂપ, સ્વધર્મ, સ્વદેશ, સુકર્મ, સ્વલક્ષ્ય, સ્વલક્ષ્ણ અને સ્વદર્શાન ચકધારી બનવું—આ સાત સોયાન ચઠવાં પડશે. આ સાત મંજિલ પાર થશે ત્યારે જીવનમાં શીતળતા આવશે. અસુરો સામે મા કાળીનું સ્વરૂપ અને પોતાના કુળમાં શીતળામાનું સ્વરૂપ હિંટ છે. શાંત, સૌભ્ય, શીતળ મૂર્તિની ઉપાસના થવી જોઈએ. ગરમીનું સ્થાન હૃદય છે—હૃદયમાં ઉભા જોઈએ. પરંતુ દિમાગમાં, ચિત્તમાં તો અત્યંત શીતળતા જોઈએ. તો જ જે કાંઈ નિર્ણય લેવાય તેમાં સમત્વ સધાય

### સમર્પણ દ્વારા દર્શણ

આપણે ત્યાં સર્વસ્વ સમર્પણની વાત ચાલે છે. સર્વસ્વ સમર્પણ કોને કહેવાય? સર્વમાં દેહનું ભાન પણ આવી જય છે. દેહાલિમાન અને દેહનું ભાન સર્વથા તૂટી જવું જોઈએ.

પરંતુ જ્યાં સુધી દેહ સાથેનો હિસાબ ચૂકવાતો નથી, ત્યાં સુધી દેહભાન છૂટી શકતું નથી. જ્યાં સુધી શરીરથી ઉપર ઊડવાનું ન અને ત્યાં સુધી શાસે શાસે પ્રભુસમૃતિ

રહે એ જરૂરી છે. એક પણ શ્વાસ વિસમૃતિનો ન લેવાય. શ્વાસે શ્વાસે જેના હૈયામાં હરિસ્તમરણુ હશે, તેના ચહેરે જ આ વાતની સાખ પૂર્ણો અત્યંત પ્રસન્ન ચહેરે. કહેવાયું છે કે મુનિઃ ગંમીર પ્રસન્નઃ સતતું સમૃતિ રાખનાર વ્યક્તિનો ચહેરે હર્ષિતમુખ હશે. બીજી નિશાની છે—સહનશીલતાની. સતતું સમરણુ રાખનાર વ્યક્તિ કાયર નહીં હોય. હવે શું થશે? કેમ કરીએ?—જેવા નિર્ભળ શાહુદ્દો નહીં નીકળો. મનમાં પણ હુર્ભળતા ન આવે.

સંપૂર્ણતાની પરખ આ છે કે બધી બાબતોને સર્વાંગી રીતે, સમય રૂપોમાં પારખી શકવાની શક્તિ સધાય. દિવસ-લર વ્યક્ત, અવ્યક્ત મનમાં શું શું પ્રગટ થયું? ચિત્ર, ચરિત્ર, વિચિત્ર બધું યાહ આન્યું? આજે કેવળ યાહોમાં રહ્યા કે વિશેષ કાંઈ કાર્ય પણ કર્યું? આ બધું આત્મ-પરીક્ષણ થવું જોઈએ. અવ્યક્ત ક્ષેત્રની સ્થિતિ બધી હશે તો રોજિંદા વ્યવહારોમાં અલૌકિકતા પ્રગટ થશે.

૬૬ નિર્ધય ખાહ સ્નેહ, સહયોગ અને શક્તિના શુણેની ઉપાસના કરવી પડશે. સંકલપશક્તિ વધારવી પડશે. અંગ્રેજુમાં જે Will Power કહે છે તે ત્યારે વિકસશે જ્યારે અંદર-બહાર જે કાંઈ ખૂરાઈ છે તે બધાનું વીલ કરી નાંખવું પડશે. આ બધું ધીરે ધીરે નહીં, એક આઠકે કરવું પડશે. કર્મબંધનોનું હોરડું એકી આઠકે કાપવું પડશે. આ હોરડું કપાય નહીં તો મન પૂર્વાનુભંધોમાં એંચાયા કરે છે.

### કામજ્ય

એક બાજુ છે સંસારીઓનો વિશાળ તપ્ત, વ્રસ્ત, પીડિત સંસાર અને બીજુ બાજુ છે સાધકોનો નાનકડો પણ સુખી, શાંત સંસાર. પેલા સંસારમાં તાપ છે, તો આ સંસારમાં તપ છે. શાંતિ છે.

સાધકના જીવનમાં લગીરેય હુઃખ અનુભવાય તો સમજવું જોઈએ કે ક્યાંક અપવિત્રતા છે. કામજીત અનવું એટલે કેવળ કામવાસના જીતવી તે નથી, તમામેતમામ કામનાઓને, ઈચ્છાઓને જીતી લેવી, તેનું નામ કામજીત છે. તમામ ઈદ્રિયોના વિજેતાને જ ઈદ્રજીત કહી શકાય.

કામના વસ્તુઓની હોય છે, વ્યક્તિના સીમિત પ્રેમની હોય છે, મર્યાદિત સંબંધે બંધાવાની હોય છે, સેવામાં પણ આસક્તિ સંબંધે બંધાઈ જવાની હોય છે. આ ચારેય પ્રકારની કામનાઓથી મુક્ત થવાનું હોય છે. ક્યારેક આપણે આત્મવંચના પણ કરતાં હોઈએ છીએ. કહીશું કે ‘ઈચ્છા તો નથી, પણ ગમે છે.’ વસ્તુ કે વ્યક્તિ ગમે છે, તેનો અર્થ એ છે કે ચિત્તમાં તેની કામના પડી છે. આ ગમવાનું જ આગળ જતાં ઈચ્છામાં ફેરવાઈ જય છે. કામના-વ્રસ્ત વ્યક્તિ હુઃખ અને અશાંતિનો સામનો કરવામાં પાછો પડે છે. કોઈનાથી પ્રલાવિત થવું તે જેમ કામના છે, એ જ રીતે ઈર્ષ્યા કે દ્રેષ્ઠી કોઈ સાથે દુશ્મનાવટ ઊભી કરવી તે પણ કામનાનું જ એક સ્વરૂપ છે. આ સાવના પણ સુખ, શાંતિને હરી લે છે.

‘હું આમ કરીને દેખાડીશા—’ આવા અહુંભાવમાં પણ કામના છે. ન અલિમાન જોઈએ, ન અપમાન જોઈએ. ડેવળ સ્વમાન જોઈએ. સ્વમાન એટલે આત્મગૌરવ. પોતે પ્રભુનો અંશ છે, તેમાં શક્તિ છે. એટલે કોઈની લાચારી કે હીનતા અનુભવવાને કોઈ કારણ નથી. જેવી રીતે આપણું સત્તા કોઈના પર ન ચાલે, એ રીતે આપણું સત્તા કોઈની પર ન ચાલવી જોઈએ. કોઈ ને જે રીતે ઉંઘવું ન જોઈએ, દખાવવું ન જોઈએ, એ રીતે કોઈનાથી હરવું પણ ના જોઈએ, દખાવું પણ ના જોઈએ. પોતાની મસ્તીમાં મગન રહેવું જોઈએ. સેવા માટે જ બહાર જવાનું પ્રયોજન, આકી પોતાનામાં લીન.

### સંયમને સહારે

આત્મમય સ્થિતિમાં સ્થિર થવા જતાં દેહ સતતું નીચે ભૌતિકતામાં સતતું ઐંચ્યતો રહે છે. આ ઐંચાણુને ધટાડવા સંયમશક્તિ ભીલવવી પડશે. સતતું પોતાના મૂળ સ્વરૂપનો અધ્યાત્મ રહે, પોતાની જત વહી ન જાય તે માટે સંયમશક્તિ જોઈએ. આસક્તિનો પ્રવાહ માણુસને ઐંચી જાય છે. એટલે સતતું યાદ રહે કે જે કાંઈ છે તે ઈશ્વરનું છે, મારું કાંઈ નથી. આપણું તો મરજીવા ઘનવાનું છે. પુરાણું બધું મારીને નવેસરથી જીવવા આવ્યા છીએ. હવે તો તદ્દૂપતા સધાય, સતતું તન્મય રહેવાય એ જ ધોય ! એ જ નિશાન !

### કથની તેવી જ કરણી

સાધકના જીવનની કથની, કરણી અને રહણીમાં તક્ષાવત ન હોવો જોઈએ. જે કાંઈ કરેવાય તે કરવા માટે જ હોય.

આચરણુની પીઠિકા ઉપર જ વિચાર, સંચાર ઉદ્ભવતા રહે. હુનિયામાં સૌથી લયાનક માણુસ એ છે, જેનામાં અંદર કાંઈક જુડું છે અને બહાર કાંઈક જુડું છે. જે કહે છે કાંઈક અને કરે છે કાંઈક. આવા માણુસ પાસે કોઈ ન જઈ શકે. સૌ કોઈ તેનાથી ફૂર રહેવા ઈચ્છે. એટલે ભાઘ્યાંતર સર્વચાઈ, સંનિધા એ તો સાધનાનો પાયો છે. જીવનનો પાયો જ છે સત્ય. સત્ય એટલે સત્ત, જે છે તે. ઈશ્વરનું અસ્તિરૂપ છે તે જ સત્ય છે. એ સત્યનો ઈન્કાર કરી કોઈ કશું મેળવવા મથે તો તે કેવળ કાંકાં છે. અસત્યના સહારે મેળવેલી પ્રાપ્તિ તે પ્રાપ્તિ નથી. એટલે વિચાર અને આચાર, કથન અને કર્મમાં એકવાક્યતા હોવી જોઈએ. આ એકવાક્યતા હોશે તો જ પરમતત્વ સાથેની એકવાક્યતા નિર્માણ થઈ શકશે. વિચાર, વાણી અને વર્તન ત્રણે ય પરસપર એકમેકનાં પ્રતિષ્ણિંબ ઓલાતાં હોય તેવો પ્રયાસ હોવો જોઈએ. વિચાર અને આચાર વચ્ચે એટલું બધું અંતર વધી ન જવું જોઈએ કે બનેનો મોમેળો કહાપિ થાય જ નહીં.

### યજમાન નહીં, મહેમાન

અધ્યક્તમાં સ્થિર થવા માટે આપણે આપણું જતને હુંમેશાં મહેમાનની ભૂમિકામાં રાખતાં શીખવું પડશે. આપણે આપણું શરીર માટે પણ મહેમાન, આપણું પુરાણું સંખ્યા માટે પણ મહેમાન. મહેમાનવૃત્તિ કેળવવાથી ભમતા—આસક્તિ ફૂર લાગે છે. આપણે કોઈને ત્યાં મહેમાન થઈએ તો તેમના ધરની કોઈ ચીજ આપણુંને ગમી જય તો પણ

આપણુને તેને માટે ભરત્વ જગતું નથી. આપણા મોહને આપણે અંકુશમાં રાખી શકીએ છીએ. આ જ રીતે આપણા શરીર માટે પણ મહેમાનની લાવના રાખીશું તો મોહમાયાનાં બંધન નિર્માણ નહીં થાય.

આ મહેમાનવૃત્તિની સાથોસાથ બીજુ એક વૃત્તિ પણ જગશે. અહીં આપણે મહેમાન, તો પછી આપણે માલિક કયાંના? આપણું પોતાનું ધર કર્યું? આપણે ધરધણી છીએ કે કાયમી મહેમાન બનીને જ જીવન વિતાવવાનું છે? આ પ્રક્રના જવાબ રૂપે આપણુને આપણું મૂળ વતન લાંઘશે. અવ્યક્તનાં રહેવું તે જ છે આપણું અસલી ધર. આ અસલી ધરને પામવા આ ધર છોડી દેવાની જરૂર નથી. આ ધરમાં રહેવા છતાં અસલી વતનનું સમરણ, અનુસંધાન, તેમાં રહેવાની અનુભૂતિ થતી રહે એ જરૂરી છે.

આ સાધના પ્રતિક્ષણુની સાધના છે. સવારે સૂરજ ઊંઘે તે પહેલાં અરુણોદયની આભા આકાશમાં છવાય છે. આપણા ચિત્તમાં પણ વહેલા પરોદ્ધી આકાશમાં આભા છવાવી જોઈ એ. ભલે જળહળતા સૂર્યને ઊગતાં વાર લાગે, પણ જાનની આછી અરુણિમા ચિત્તમાં ફેલાશે, તો ધીરે ધીરે સૂર્યોદય આપોઆપ થશે. અરુણોદય વેળાએ સંકલ્પ, ત્યાર ખાઢ દ્વિવસભર પુરુષાર્થ મય સાધના, સાંજે સૂરજ ઝૂભે ત્યારે પુરુષાર્થનો પણ સંકેદો કરી જે કાંઈ ઝળપાણ્ઠ થઈ તે પ્રભુચરણોમાં સર્મર્ણણ, આ છે નિત્ય સાધના.

અમૃતવેળાથી ઠેક રાત્રિ સુધી સાધનાને જીવવાની છે.

રાતે સૂવાનું છે તો સૂવું તે પણ સાધના. એ કેવી રીતે બને? સૂવું છે તો સુવર્ણની ફુનિયામાં સૂવું છે. માત્ર પથારીમાં નથી સૂવું. જે સુવર્ણમય, હિરણ્યમય ચૈતન્ય સ્વરૂપ છે, તેના સમરણુમાં, તેની ગોદમાં વિશ્રાંતિ લેવી છે. સૂવું એટલે હિવસ દરમિયાન દેહ, મન, બુદ્ધિ, ચિત્ત વગેરે સતત સક્રિય રહ્યાં છે, તેમને વિશ્રાંતિ મળે તે જેવું. માત્ર દેહને વિશ્રામ મળે તે નિદ્રા નથી. નિદ્રામાં મન, બુદ્ધિ, વૃત્તિ વગેરેને પણ આરામ મળવો જોઈએ. મન અતિ ચંચળ છે. એના વ્યાપારને ન રાત છે, ન હિવસ છે. હાથ-પગ પહુંચા રહે તો તે સ્વર્ણ બનીને પોતાનો વ્યાપાર શરૂ કરી હે છે. એટલે સાધનામાં નિઃસ્વર્ણ નિદ્રાનું ખૂબ મહત્વ છે. આવી નિઃસ્વર્ણ નિદ્રા જ ધીરે ધીરે સમાધિ સુધી પહોંચાડી શકશે. વૃત્તિઓનું સમધારણ ન કેળવાય, ત્યાં સુધી નિઃસ્વર્ણ નિદ્રા પ્રાપ્ત ન થઈ શકે.

મનને, પરિસ્થિતિને પારખવાની, અન્ય વ્યક્તિઓને પારખવાની એક કણા છે. આ કણા તો જ સધાઈ શકે, જે આપણે નિર્વિકલ્પ બનીએ. આપણા પોતાના ચિત્તમાં જાતજાતનાં સ્પંદનો, ભાવો, વિચારો, તરંગો જીડ્યા કરે તો તેવી ચિત્તની મિશ્રિત સ્થિતિ ભીજને પારખવામાં ભૂલથાપ ખાઈ એસે. પરિસ્થિતિના આકલન માટે એકાગ્રતા જોઈએ. બુદ્ધિની સક્રાઈ જોઈએ. સ્પષ્ટતા જોઈએ.

કેટલાક સાપના ભર્તા પર મણિ હોય છે, તેનામાં જેર પણ હોય છે. આપણે મણિ જેવાની દર્શિ ભીલવવી

પડશો. જેવું જોઈશું તેવા અનીશું. એટલે સુચિત્રમાં કે મંગળ છે તે જેવાની દર્શિ ખીલવવી પડશો. મંગળમય દર્શિ અનશો તો જીવનમાં પરિપક્વતા આવશો. જીવનમાં પરિવર્તન લાવવું હોય તો પરિપક્વતા જોઈએ. પરિવર્તન લાવવા માટે એ ચોજ સાધવી પડશો-હસ્તમણો સ્વભાવ અને આકર્ષણ વ્યક્તિત્વ.

પોતાની બુદ્ધિ, વૃત્તિ, સંકલ્પ વગેરેથી ઉપર ડાઢી જવું એને ઉપરતિ કહે છે. હું-પદમાંથી ઉપરામ થવું અને પછી તટસ્થ અનીને જાતને તપાસવી, સાક્ષી અનવું. ઉપરામ અનીને દૃષ્ટા થઈ જવું. જેવી રીતે રમતમાં કે અમ્યાયસ્ય હોય છે તે પોતે રમતો નથી, આખી રમતને સાક્ષી અનીને જુએ છે અને એનું યથાવત् વણુંન કરે છે એ જ રીતે સાક્ષી અનવાની શક્તિ આવવી જોઈએ. સાક્ષી અનવામાં પોતાની આંખોનો રંગ ન ચઠવો જોઈએ. જે હેખાય તેનું જ અવલોકન, અલ્યાસ થવો જોઈએ.

મનનું આવું સાક્ષીલાવે અવલોકન થયા કરશો તો મન થાડું શાંત પડશો. એને જ્યાલ આવી જશો કે મને કોઈ જેનારું છે, રપારનારું છે. એટલે ધીરે ધીરે એની નિરંકુશા હોટ કાણ્યુમાં આવશો. પછી એને માટે બાંધી આપેલા ધોરી રસ્તા પર જ જવાનું એનું વલણું વધશો.

પરંતુ આપણી સાધના અહીં અટકતી નથી. શરીરમાંથી અશરીરમાં જવું તે તો પૂર્વાર્ધ થયો, ઉત્તરાર્ધ હજુ બાકો અધ્યાત્મ-૩

છે. આપણું સાધના છે, શરીરી હોવા છતાં અશરીરી બનીને ફરી શરીરમાં આવવું. અવ્યક્તને પામી, તેમાં સ્થિર થઈ પછી વ્યક્તામાં ફરી આવવું. રોજેરોજ આ પ્રક્રિયાને અભ્યાસ કરવાનો છે. દેહમાં વસવા છતાં વિહેઠી અવસ્થામાં સ્થિર થવું અને પછી વિહેઠી ચેતના સાથે દેહમાં વિલસવું.

આ કપરી સાધના છે. સૂક્ષ્મ સાધના છે. આમાં આ કરવાનું છે—દહીને વલોવીએ ઈંચે ત્યારે માખણું નીકળે છે, એ રીતે વૃત્તિએને વલોવવાની છે. સાગરમંથનમાંથી અનેક ચીને બહાર આવી, હળાહળ જેર સુદ્ધાં બહાર આવ્યું. તે બધાને અંતે અમૃત પ્રગટ થયું તો આપણું સાધના દ્વારા અંતે પરમામૃતકંલ પ્રગટ થવો જોઈએ.



### [ ૩ ] સમાજ સાથે અનુસંધાન

કોઈ શિખર પર ચઢવું હોય તો એક પછી એક પગથિયાં ચઢવાં પડે છે. આ જ રીતે સાધનાનાં પણ વિવિધ સોયાન છે, પગથિયાં છે. સાધના વ્યક્તિગત પણ કરવાની છે, સામુહિક પણ કરવાની છે. આપણે સમાજ સાથે સંકળાયેલા છીએ. એટલે આપણી સાધનાને સંગઠન સાથે પણ સંબંધ હુશે.

વિકાસ માટે સંગઠનની શક્તિ તો મહદ કરશે, પરંતુ મુખ્ય ચીજ છે પોતાની આત્મશક્તિ. બહુરની શક્તિ મહદરૂપ થઈ તમારી પ્રગતિમાં જડપ લાવી શકશે, પરંતુ મુખ્ય આધારરૂપ છે તમારી પોતાની આંતરિક શક્તિ-હિંમતવાન અનવાનું છે. આત્મવિશ્વાસ અને હિંમતપૂર્વક પોતાની પ્રગતિકૂચ આગળ ચલાવવાની છે. સમાનધર્મી સમાજ-પરિવર્તણ સાથે સ્નેહ, આદર અને વિશ્વાસના મૂલ્યની સહયોગ આદરવાની છે.

### સામુહિક મુક્તિ માટે સજજનોની જમાત

વ્યક્તિગત રીતે માનવ પ્રભુને પામી કે, પોતાના જીવનમાં અધ્યાત્મને વણી લઈ અવ્યક્ત સાથેનો નિરંતર સંબંધ સ્થાપી સ્થિર થઈ જય તેટલું પૂરતું નથી. ઈશ્વરી

ચૈતન્યને આ પૃથ્વી પર વહેવડાવવાનું છે, પ્રાણીમાત્રને અનુભૂધ અભ્યક્ત સાથે જોડાય તે માટે પુરુષાર્થ કરવાની ઝરજ માનવની છે. એટલે સાધના પણ સામુહિક જોઈએ.

આવી સામુહિક સાધના કરવા માટે એકલદોકલા વ્યક્તિ પૂરતી ન થાય. તે માટે આ પ્રલુપ્રેમીઓની એક જમાત જોઈએ. આ જમાતને કોઈ સંસ્થા કે સંગઠનનું નામ આપો કે ન આપો, પરંતુ આ સૌએ સાથે મળીને સહયોગી વૃત્તિ વિકસાવીને અભ્યક્ત જગતનો સંહેશો વ્યક્ત જગતમાં રેલાવવો પડશે.

### ઇંદ્રી બંને પક્ષે નુકસાનકારક

સંગઠનના જે સુખય વાહકે છે, તેમના પર સહેને વિશેષ જવાબદારી આવે છે. કઈ જવાબદારી ? સેવાનો સુખય આધાર કર્યો છે ? પહેલાં સ્વ ઉદ્ઘાર, પછી સર્વ ઉદ્ઘાર ! એટલે પોતાનું જીવન પરમ આદર્શ રૂપ બનવું જોઈએ. હૃદય અત્યંત ઉદ્ઘાર, દાખિમાં સમત્વ. આવા ઉદ્ઘારચિત થવું પડશે, ઇંદ્રી, ધૂણાથી મુક્તા. અહેખાઈ પોતાને પણ પરેશાન કરે છે, સામેની વ્યક્તિને પણ પરેશાન કરે છે. કોઈ મોટો અભિન છે, તો ઇંદ્રી નાનો અભિન છે. ધૂણાવાળા ચિત્તમાં કદી શુલ ચિંતન પ્રગટી શકતું નથી. ધૂણા એટલે પોતે તો પડવું જ, ખીંબને પણ પાડવું. ધૂણા કરવી એટલે કોઈ ચાલે છે, તેને ધક્કો મારીને પાડી દેવું. કોઈને આવું હુઃખ હેવાનો આપણુંને કોઈ અધિકાર નથી.

### એકતા-એકાથતા

સેવા માટે ઉદ્ઘારતા અનિવાર્ય છે. અંતરની એકતા મહત્વની છે. એક ખનીને જ સર્વોપરિ એકને પામી શકાશે. એકતા સ્થાપિત કરવા માટે એકાથતા જોઈશે. એકાથતા માટે નિર્વિકલ્પ થવું પડશે. મનમાં જાતાજતના તરંગોનો વ્યાપાર, સંકલ્પ-વિકલ્પ ચાલ્યા કરે તો એકાથતા સધાય નહીં. એકતા અને એકાથતા આ બંને લુણ ઉમેરાશે તો ચતુર્ભું જ ખની શકાશે.

ચિત્તમાં સહા સમાધાન રહેવું જોઈએ. પોતે સાક્ષાતું સમાધાન સ્વરૂપ હુદ્ધશું તો જ ભીજને સમાધાન આપી શકીશું. પોતે કોઈ પણ પરિસ્થિતિમાં સમસ્યારૂપ નહીં અને, ન તો સામે ચાલીને જલ્દી રહેલી કોઈ સમસ્યાથી હરવાનું રહેશે.

આકી તો સેવા એ જ સર્વસ્વ છે. ઉત્તરોત્તર સેવા મનસા દ્વારા અધિક થતી જાય. હોલવાથી જ સેવા થાય છે તેવું નથી. માત્ર ઉપસ્થિતિ જ સેવાની પ્રેરણા આપી શકે. કર્મ ગમે તે કરતાં રહીએ, આત્મવિસ્મૃતિ ના થવી જોઈએ.

### સંગઠનમાં પ્રેમ અનિવાર્ય

સજજનોની શક્તિ એકન્નિત અને સંગઠિત થવી જોઈએ. આજે સમાજમાં સજજનતાનો ફુકાળ છે તેવું નથી. સજજનતા તો ઠેર ઠેર પડી છે, પરંતુ તે વેરવિભેર છે, અસંગઠિત છે, અનિયોજિત છે. સંઘળી સજજનશક્તિને

એકનિત કરી તેનો પ્રવાહ બનવો જોઈએ. આવી સજજન-  
શક્તિ સમાજજીવનની મુખ્ય ધારા બને.

સંગળન માટે કેટલોક વસ્તુએ અનિવાર્ય છે. સૌથી  
મહત્વની બાધત છે પરસ્પર સ્નેહાદર. હૃદય પ્રેમથી  
ભીજાયેલું રહેવું જોઈએ. બધાના સ્વભાવ, સંસ્કાર એક-  
સરખા તો કયાંથી હોય? પરંતુ ભીજની લિન્નતાને પચા-  
વવા માટે આદ્યાણુનો એક ગુણ અપનાવવો પડશે. પ્રેમ માટે  
સર્વસ્વત્યાગી બનવું પડશે. તેમાં ભીજના દોષ ન જોવા,  
આ ત્યાગ સૌ પહેલો કરવો પડશે. ત્યાગનો મુખ્ય ગુણ છે  
સરળતા અને સહનશીલતા. સરળતા હશે તો ભીજને  
પોતાના તરફ સહેલાઈથી એંચી શકાશે. એકદમ બાળવત  
નિર્દેખતા, ઋગુતા! ગુણોમાં વૃદ્ધ, પરંતુ સ્વભાવે બાળવત!  
બાળક પણ બનવાનું અને માલિક પણ બનવાનું. જે તો  
મુદ્દા અંગે પોતાનો સ્વતંત્ર અલિપ્રાય વ્યક્ત કરવો તો  
થયો માલિકનો ધર્મ, અને એક વખતે અલિપ્રાય વ્યક્ત  
થઈ ગયા બાદ અંતે સર્વસંમતિથી જે કાંઈ નિર્ણય થાય  
તેને અતુસરવામાં બાળક થઈ જવાનું. કયારે કયું સ્વરૂપ  
ધારણ કરવું તે નક્કી કરવા વિવેકધૂદિ જોઈએ. પરંતુ  
બાળક અને વયસ્ક આમ અંને ભૂમિકા નિલાવતાં આવડે  
તો જ સંખ્યાને સ્થિર બનાવી શકાશે. સંગળન મજબૂત  
બનાવવા પરસ્પર નિકટના સંખ્યાં હોય, સેવાની જવાખદારી  
હોય, શાનપ્રાપ્તિની ભૂખ હોય, એકમેક માટે આદર અને  
વિશ્વાસ હોય તે અત્યંત જરૂરી છે.

### नीचे पउलाने उपर उठावो।

स्नेहीजनेए पणु ज्ञवनमां जांचे यढवानुँ छे. ज्ञवन एक सतत् आरोहणु छे. ज्ञवनमां यढाणेनो कोई अंत नथी. सेवाधारी, सहयोगी के स्नेही सौ कोई ए तपस्वी अनवानुँ छे. ज्ञवनमां सतत् तपेयज्ञ रहे छे, तो ज्ञवन हरियाणुँ बने छे. वृक्षो तापमां तपे छे तो लीलांछम रहे छे, आ ज नियम मानवीय ज्ञवनने पणु लागु पडे छे. तपस्या करवानी एट्टे शुँ जगतमां जर्ज पलांडी मारी योग्यासन करवानां? ना, के दोको हजु फुःभमां छे, अज्ञानमां छे, तेमना ज्ञवनमां ज्ञाननो, आनंदनो हीप्रयग्याववानो—आ छे तपस्या. संस्कारी दोकोना हुदयनां आश्रयस्थान बनो, आश्वासनइप बनो, सहायडप बनो.

आजे आजुँ जगत सणगी रह्युँ छे. भोग्यासनानां अंआवाती तोझनेमां तेए। अटवाई गया छे. गमे तेट्ला अठणक धनमां ठेला छे, छतां य मनथी तो हजु एवाने एवा लिखारी छे. भेणवी भेणवीने आलीभम छे, हजु वधु भेणववा सतत् हवातियां मार्या करे छे. आवा दोको माटे पृथ्वी पर तप करनारा दोकोनी संग्या वधवी ज्ञेईए.

तप कारा शांतिनां, प्रेमनां किरणो यारे तरइ ईलाववानां छे. जेवी रीते सूरज विश्वमां यारे तरइ पोतानां किरणो। ईलावी सौने नवज्ञवन अपै छे, ए ज रीते तपस्यानां किरणो। कारा सणगता जगतने शाता पहांचाडवानी छे.

केवण पोते सुखशांतिनो अनुभव कर्यो, त्यां अटडी

જવાનું નથી. કેવળ ખાતામાં જમા કરવાથી કામ નહીં ચાલે. અજનાને લુંટાવવો પડશે. ઝુશીનો અજનો, શાંતિ અને શક્તિનો અજનો, જ્ઞાન, ગુણ, સહયોગ, પ્રેમનો અજનો કેટલો ભર્યો તે મહત્વનું નથી. આ બધા અજના કેટલા લુંટાવ્યા તે મહત્વનું છે. લેવાનું મહત્વ નથી, મહત્વ છે દેવાનું. તપશ્વર્યા સ્વરૂપ એટલે લેવતાની ત્યાગ-મૂર્તિ. ત્યાગને કોઈ સીમા નથી, સરહુદ નથી, સતત, પ્રતિક્ષણું આપતાં રહેવાનું છે. લેવાના સંકલ્પમાં થોડી વાર માટે લેવાનું, પરંતુ સહાકાળ માટે ગુમાવવાનું છે. જ્યારે આપવામાં સહા ને સહાકાળ જ છે. બિન્હુ જ્યાં સુધી સિંધુમાં એકરૂપ થઈ સમાઈ નથી જતું, તે જ રીતે આ તપની પ્રક્રિયા જ્યાં સુધી સિંધુમિલન ન થાય ત્યાં સુધી સતત ચાલુ રાખવાની છે.

આપવાનું પણ પોતાનામાં જે શ્રેષ્ઠ છે તે. ઈશ્વરે એકે એક વ્યક્તિમાં કાંઈક ને કાંઈક એવી આગવી વિશેષતા મૂકી છે, જે બીજામાં નથી. જમાજને પ્રત્યેક વ્યક્તિની આ વિશેષતાનો લાલ મળવો જેઈએ. તો સમાજ પણ સમૃદ્ધ થશે, તેમાં વૈવિધ્યનો વૈલાવ છલકાશે. સમાજ આ રીતે જ સંપન્ન થઈ શકે. તમારી પાસે કાંઈક છે, તો ઓઝે તેનો અભાવ છે, અછત છે. તમારી પાસે પ્રેમ છે, તો પ્રેમનાં ભૂણ્યાં જન આ વિશ્વમાં અનેક છે. તમારી પાસે જ્ઞાન છે, તો જ્ઞાનપિયાસુ પણ અનેક લોકો છે. આ રીતે તમારી પાસે જે કંઈ છે, તેને અહુણ કરવા લોકો

તત્પર બેઠા જ છે. જરૂર છે આપણી ભીતર બેઠેદા હાતાને વહેવા માટે તૈયાર થવાની.

### જમણો હાથ અનીએ

હાથ એ માનવોને ઈશ્વર તરફથી મળેલું વિશેષ વરદાન છે. સુપિરિમાં ચોપગાં પ્રાણી અનેક છે, પરંતુ બે હાથ અને એ પગવાળાં પ્રાણી ધણ્ણાં ઓછાં છે. સંસ્કૃતમાં હાથ ને હસ્ત કહે છે, એટલે કે જે હસ્તાવે છે તે હસ્ત. કામ કરો, મહેનત કરો અને હસ્તાં રહો. હુનિયામાં કશું ય ન હોય, કેવળ હાથ હોય તો ય મસ્તોથી કહી શકાય કે ‘અપના હાથ જગનાથ’!

આમ, હાથ પ્રત્યક્ષ કર્મનો આધાર છે, બુલ સહચોગની પણ નિશાની છે. મહદ કરનારી માટે કહેવાય છે કે આ મારો જમણો હાથ છે. બુલ શક્તિકૃપે પણ ચોગખાય છે, એટલે તો કહેવાયું છે—‘બાહુબલ’. તહુપરાંત, હાથ સ્નેહના પ્રતીકર્પે પરસ્પર મેળવાય છે, નમસ્કારની મુદ્રામાં જોડાય છે. આપણે સૌચે આ ચારે ય અર્થોમાં પ્રભુની બુલ ઘનવાનું છે.

કેવળ બુલ નહીં, જમણી બુલ હશે તો પ્રત્યક્ષ કર્મમાં સત્યનું આરોપણ કરવું પડશે. આપણાં તમામ કર્મો શુદ્ધ અને શ્રેષ્ઠ કર્મ હોય, પછી લલે એને ડાખા હાથની મહદ મળે અને કામમાં જડય આવે.

ઈશ્વરના જમણા હાથ થવા માટે ઈશ્વરી કાર્યમાં મહદરૂપ થવું પડશે. કચારેક કૂસસહ મળી અને થોડું કામ કરી લીધું એને સહચોગી ના કહેવાય. તન, મન, ધન

સર્વસ્વ સમપોંને જ ઈશ્વરના જમણા હાથે બની શકાય. આપણાં સાંસારિક કાર્યોમાં જેઠલું મન લગાવીને ઉત્કટતા-પૂર્વક કામ કરીએ છીએ, તેના કરતાં વધારે ઉત્કટતા અને સંનિષ્ઠ ઈશ્વરી કાર્યોમાં જોઈએ. ચિત્ત, મન, પ્રાણુ પરોવી દઈને જ પરમેશ્વરી કાર્ય કરી શકાય.

ભુજ સ્નેહનું પ્રતીક પણ છે. કોઈને મળીએ છીએ તો હાથેહાથ મેળવીએ છીએ. આ તો થયું હૈલ્ડ સ્તરનું મિલન. આપણે તો સંકલ્પનું મિલન જોઈએ, સંસ્કારોનું મિલન જોઈએ. સમાનધમી પ્રભુ પ્રેમીએના સહસ્કલ્પ રૂપે ભુજ એક પ્રતીક છે.

છેવટે બાહુભલ. શક્તિ સંકલ્પની હોય. સંકલ્પ દ્વારા શ્રેષ્ઠ સૃજિની રચના થશે. વૃત્તિથી વાયુમંડળનું પરિવર્તન થશે. જ્ઞાનદ્વિષિથી અશરીરી સ્વરૂપની અતુભૂતિ થશે. સ્વરૂપદર્શન થયું હોય તો જ બાહુભલ ઈશ્વરી કાર્યોમાં ઉપયોગી થશે.

સ્વરૂપદર્શન અનેક પ્રકારનાં માયાનાં ચક્કરોમાંથી મુક્તા કરે છે. હુમેશાં પવિત્રભાવ અનુભવવો. આ સ્વરૂપદર્શન ઉપર ઉપરનું નથી. માનવનું સ્વરૂપ પરમેશ્વરી રૂપનું પ્રતિભિંભ છે. આ પ્રતિભિંભનું દર્શન થયું જોઈએ. પરમેશ્વરના જે ગુણો ગાઈએ છીએ, તે બધા ગુણો સ્વરૂપમાં પ્રગટ થવા જોઈએ. પ્રભુ અણુઅણુમાં વિરાજમાન છે, છતાં સહેણ નથી. પ્રભુની આ અભ્યક્તતા આપણા વ્યક્તિત્વમાં છલકાવી જોઈએ. હળવે ને પગલે આપણું

હેહ, આપણો અસ્તિત્વા, આપણો અહીં પોતાનાં માયાં જીંચકયા કરે, તો આત્માની અવ્યક્તતા પ્રગટ થવાને બદલે હેહની માયા જ પ્રગટ થતી રહેશે. પ્રભુની કાચા અને આ હેહની માયા એ એ વિશેધી વસ્તુ છે. હેહ બદ્લે હેહને સ્થાને રહે, એની ગૌણ ભૂમિકા અહા કર્યા કરે, તે સુખ ન અની જવો જોઈએ.

હેહમાં રહેવા છતાં વિહેહાવસ્થા અનુભવવી, આ છે માનવતું પરમ કર્તાબ્ય. હેહી અનીને, આત્મસ્થ અનીને હેહ પાસે કર્મો કરાવવાનાં છે. હેહ સાથે નિષ્ઠત્વ ન અનુભવતાં, હેહથી લિન્ન એવા આત્મામાં સ્થિત અનીને હેહને સાધન-રૂપે વાપરવાનું છે. આ છે વિહેહી સ્થિતિ, નિરાકારી સ્થિતિ. આત્માને કોઈ આકાર નથી હોતો.

આવી આત્મમય સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પરમ-પિતાને અનુસરવું પડશે. એની સમક્ષ પ્રક્રિયા લઈને નહીં, પ્રસન્નતા લઈને જવાનું છે. પ્રક્રાથ્ ચિહ્નન વક્તાની નિશાની છે, જ્યારે પ્રસન્ન ચિત્તનું ચિહ્નન છે વિરામ ચિહ્નન ! જ્યાંથી જુએ ત્યાંથી સહા એકસરખું. ગુરુ પાસે આવા પ્રસન્ન ચિત્તે જવું જોઈએ. ગુરુ પરમેશ્વર પણ હોઈ શકે, કોઈ શ્રદ્ધેય આત્મસ્થ વ્યક્તિ પણ હોઈ શકે.

પરંતુ જે હેહથી વિહેહ થવાનું છે, તે હેહનું પણ ધ્યાન રાખવાનું છે. હેહ આપણને લાડે મળ્યો છે તો એ હેહને સાક્ષ, સ્વર્ણ, સ્વસ્થ રાખવો તે આપણી ઝરણ છે. ધર્મિન આપણા હેહને સેવાનું નિમિત્ત અનાવી રહ્યો

છે, તો તે પ્રભુનું વરદાન સમજવું જોઈએ. કોઈ પણ કારીગર પોતાના ઓળખને હંમેશાં સાક્ષિ, તૈયાર અને સજ્જદું રાખે છે એ રીતે સેવક માટે પોતાનો દેહ સેવા કરવા માટેનું સાધન છે. એ સાધન પાસે તેણું આજીવન કામ લેવાનું છે. એટલે પોતાના દેહની તંહુરસ્તી પ્રત્યે લાપરવાહી દાખવવી તે અનાસક્તિ નથી. તે તો મૂર્ખતા છે, ઇરજાચ્યુતિ છે. જે પોતાનાં કર્તાંથી પ્રત્યે જાયત છે, સેવા પ્રત્યે વર્ઝાદાર છે તે પોતાના દેહને હંમેશાં સેવા માટે તૈયાર અને તત્પર રાખશે. આપણું દેહ કોઈનામાં વાસના જગાડે તેવો, મોહંધ કરે તેવો સજ્જાવીએ નહીં, પરંતુ દેહનું જે સ્વાસ્થ્ય છે, દેહનો જે ઉપયોગ છે, તેનો લાભ સમાજને મળવો જ જોઈએ. સેવકની તંહુરસ્તી આહર્ણ તંહુરસ્તી હોવી જોઈએ, જેનામાંથી અનેકોને સ્વાસ્થ્ય સાચવવાની પ્રેરણા મળે. તંહુરસ્ત શરીરમાં જ તંહુરસ્ત મન, બુદ્ધિ, હૃદય રહે છે તે ભૂત્વાના જોઈએ.

### માધ્યવનું માધ્યુર્ય વેરવા મધુવન

સેવકોનું આપણું આ મધુવન આખા જગત માટે એક દર્શનીય સ્થાન અનવું જોઈએ. એવું સ્થાન જેમાંથી સૌને જીવનને જીંચે ઉડાવવાની પ્રેરણા મળે. મધુવનમાં આપણે જે કાંઈ કરતા હુદિશું તેનાથી ખીજને કરવાની પ્રેરણા મળશે. અહીં દરેકે સમજવું પડશે કે અહીં કોઈ એકદું નથી. કોઈ એક સમય ચોજનાના આપણે અંશમાત્ર છીએ. નિયંતા આપણું પાસેથી કાંઈક કામ લેવા માંગે છે

અને એની કાર્યાલયનાના આપણે અંશમાત્ર છીએ, વાહક-માત્ર છીએ. આપણું કર્તવ્ય આપણે દક્ષતા તથા સંનિષ્ઠા-પૂર્વક પાર પાડીશું તો જ ઈશ્વરની યોજના સુચારુપણે પાર પડશે. ઈશ્વર આપણને મદદ કરવા એકો છે. આપણે તો એના હુલારા છીએ, લાડકા છીએ. એટલે આપણે આપણાં કર્મા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો આપણને અનુસરશે. જેવી રીતે માના પેટમાં ગર્ભ હોય છે તો મા ડગલું ભરતાં ય સાત વાર વિચાર કરે છે. એ રીતે આપણે પ્રત્યેક કૃતિ અંગે સાત વાર વિચારવું પડશે. કારણ કે લોકો આપણી કથની નહીં, કરણી જેશે. આપણી પોતાની જેવી રૂચના હશે તેવી સમાજની રૂચના થશે.

આજે આપણને એ વિચાર લેટર્ડપે મળ્યા છે. એક તો એ કે, એક જ લગનમાં હર પણ રહેવું. બીજું એક પ્રત્યેની અનન્યનિષ્ઠા-એકનિષ્ઠા. ચિત્તને ચારે ભાજુથી ખેંચાણ રહેશે, પરંતુ આપણી જે એકાશબુદ્ધિ હશે, અનન્યનિષ્ઠા હશે તો કોઈ આપણને ખેંચી શકશે નહીં. સાધનામાં સ્થિરચિત્ત અને એકનિષ્ઠા અનિવાર્ય ચીજ છે.

### હિંમતે મર્હા તો મદદે ખુદા

સંગઠનની પણ એક શક્તિ હોય છે. પરંતુ એ શક્તિની સાથોસાથ પોતાની શક્તિ પણ જોઈએ. કહેવાયું છે કે હિંમતે મર્હા તો મદદે ખુદા. આપણામાં હિંમત જોઈએ. હિંમત હોય તેને પ્રભુની મદદ આવી મળે છે. જે કાઈ નાના નાના સંકલ્પ લઈએ તેને પાર પાડતા જવાથી હિંમત

વધતી જય છે. આપણે પ્રભુનું કામ કરનારા અનવાનું છે. તેના વારસહાર અનવાનું છે.

પરિસ્થિતિ પારખીને નિર્ણય લેવા જોઈએ અને પછી જે-તે નિર્ણયને વળગી રહેવું જોઈએ. મન અને બુદ્ધિને અંકુશમાં રાખીને તેની પાસેથી કામ લેતાં આવડવું જોઈએ. પૈતાના સંકલ્પમાં સ્થિર રહેવાથી અભ્યક્તતાનો અનુભવ પણ આવે છે. ત્યાંના ગુણોનો પણ સ્પર્શ થાય છે. આપણે આપણે બિન્હુ છીએ અને તે જિંધુ છે. એ મહાવૃક્ષ છે, આપણે તેના બીજ છીએ. પણ બીજરૂપ હોવાને લીધે તેનામાં જે કાંઈ છે તે તમામ આપણામાં છે. આપણે તે ઐશ્વર્યને-પ્રભુતાને પ્રગટ કરવાની છે. બીજમાં આપું વૃક્ષ છુપાયેલું છે, એ રીતે આપણામાં વિરાટ ચૈતન્ય સમાયેલું છે.

પરમપિતાની મદ્દદ લઈ હિંમત સાધી આપણે કળિયુંગી મારીના પહાડને સતયુંગી સોનું અનાવવું છે. ક્રક્ત આપણી બુદ્ધિ દઠ અને ફરંદેશી જની રહેવી જોઈએ. આપણા આત્મમય સ્વરૂપમાં વધારે ને વધારે રહેતાં આવડવું જોઈએ. ક્ષણુમાં સાડાર, તો ક્ષણુમાં નિરાકાર. સગુણ અને નિર્ણણ બંને સ્થિતિનો અનુભવ આવવો જોઈએ. અને જે ક્ષણે જે સ્થિતિમાં પહોંચ્યી જવું જરૂરી હોય તે સ્થિતિમાં સ્થિર થઈ જતાં આવડી જવું જોઈએ. પ્રવૃત્તિ કરતી વખતે પ્રવૃત્તિને પૂરતો ન્યાય મળવો જોઈએ. નિવૃત્ત થઈને એઠા હોઈએ ત્યારે પરિપૂર્ણ નિવૃત્તિ સધાવી જોઈએ. આનું નામ છે વક્ષાદારી. હાથમાં કામ એક હોય અને મન અન્યત્ર

હોય, તો તે વ્યલિચાર છે. સહાચાર એ છે કે જે સમયે જ્યાં હોઈએ ત્યાં આપેઆપા હાજર રહીએ અને જે કરતા હોઈએ તેને પૂરો ન્યાય આપીએ.

### પ્રતિપણ સાવધાનતા

સમાજમાં જેમને પરિવર્તન લાવવું છે, સમાજની જેમને સેવા કરવી છે, તેમને પોતાનાં કર્મી પ્રત્યે ખૂબ સાવધાની રાખવી પડે છે. જેવી રીતે શો-કેસવાળું પ્રદર્શનનું કણાટ હોય છે, તેમાં રાખેલી ચીજે સ્વચ્છ અને સુંદર રાખવી પડે છે એ રીતે સાધકનું જીવન, સેવકનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે. તેમાં નાનું સરખું સખલન પણ અનેક સુંદરનો જીલાં કરી શકે. એટલે સાધકે પ્રત્યેક વ્યવહારમાં સમ્યક્કપણું જાળવવું પડશે. મિતસાષી, મિતાહારી અનવું પડશે. જરૂર કરતાં કોઈ પણ ચીજમાં અતિ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. સમત્વ એ સાધકનું લક્ષ્ય-બિનહુ રહેશે. અકારણ, નિષ્પયોજન એવું કશું જીવનમાં ન ઘટવું જોઈએ. પ્રત્યેક ગતિને એની મંજિલ હોય છે. સાધકની મંજિલ છે અવ્યક્તામાં સ્થિર થવું અને તે સ્થિરતા-પૂર્વક સર્વત્ર વિહરવું.

નિરંતર જગૃતિ, સાવધાની એ સાધકાવસ્થાની મુખ્ય પરહેલુ છે. સમજણું આવી ગયા પછી પણ કથારેક ગાઈલપણું અનુભવાય છે, તેનું કારણ છે સુસ્તી. આ સુસ્તીનું જ એક સ્વરૂપ છે આળસ, પ્રમાદ. ઈચ્છા છે, પુરુષાર્થ પણ છે, પરંતુ સુસ્તીને લીધે ઢીલાશ આવી પડે છે. જાન જાણી લીધું

એટલે બુદ્ધિને તૃપ્તિ થઈ જય છે કે કામ તો ચાલી રહ્યું છે. પરંતુ સાધનામાં સંતૃપ્તિ ન ચાલે. પુરુષાર્થમાં હજુ વધારે શક્તિસિંચન કરવું રહ્યું.

વ્યવહાર અને પરમાર્થ બંનેમાં દ્વારા રહેવું જોઈએ. કર્મમાં કુશળતા હોવી તે યોગનું લક્ષણ મનાયું છે. એટલે સાધકની કૃતિ વ્યવહારપરિપૂર્ણ અને અનુકરણીય હોવી જોઈએ. એનું ઊઠવું, એસવું, ઓલવું, ચાલવું વગેરે પ્રત્યેક ભાષ્યત લોકોના મૂલ્યાંકન માટે ખુલ્લી રહેશે. લોક-દળિભાં જે સાચ્ચા હરશે, તે જ સેવા કરી શકશે.

એકી સાથે સાવધાન અને હળવા, બંને રહેવાની બુક્તિ સધાવી જોઈએ. એક ક્ષણની પણ અસાવધાની નહીં અને છતાંય એ સાવધાનીને. ચિત્ત પર એને ના લાગે, ચિત્ત સાવ હળવું ફૂલ થઈને સુઝતાતા અનુભવ્યા કરે તેવું થવું જોઈએ.

### સાધક તે સમાજની મૂડી

મુખ્ય વાત એ છે કે સાધકે પોતાની જતને સમાજની, પરમપિતાની અમાનત માનવી પડશે. પ્રભુની અમાનત બની જવાથી અનાસક્તિ સધારેશે. ઈશ્વરની અમાનત છીએ તો એ જે કાંઈ કાર્ય કરાવે તે કરવાં. ‘મારુ’ કશું બચે જ નહીં, પછી લાર શેનો? સંકલ્પ, વાણી, કર્મ, સંબંધોમાંથી મમલાવ હડી જય છે, પછી કોઈ એને રહેતો નથી. અને જે લોકો મમત્વથી છૂટી જઈ સાવ હળવા ફૂલ છે, તેમનો સદ્ગ-અસદ્ગ વિવેક એટલો બધો જગૃત હોય છે કે તેઓ

પણ માં પરિસ્થિતિ પામી જાય છે. બુદ્ધિની સૂક્ષ્મતા હશે તો પરિસ્થિતિ મુજબ જતને પલટવાની શક્તિ પણ પ્રાપ્ત થશે. જે હળવું હશે તે જતને પલોટી શકશે. સ્નેહની તાકાતથી પરિસ્થિતિ પીળાણશે અને શક્તિથી પરિસ્થિતિ બદલાશે. શક્તિ દ્વારા પરિસ્થિતિના માલિક અનવાનું છે અને સ્નેહ દ્વારા નભરતા તથા સેવા દાખવવાની છે.

વૃત્તિ, દષ્ટિ અને વાળું દ્વારા સાધકના આંતરમનની ત્રિમૂર્તિ રચાય છે. વૃત્તિ શરીર સાથે ન રહેતાં અવ્યક્ત આત્મા પ્રત્યે ઢેલી હોય, દષ્ટિ મંગળતા જ જુઓ અને વાળું પણ શુભ જ ઉચ્ચારે. આવો ત્રિવેણું સંગમ રચાય ત્યારે ત્રિમૂર્તિની સ્થાપના શક્ય અને. જીવનમાં સત્યમું, શિવમું, સુંદરમુંની સાધના કરવી હોય તો સર્વાધી, માંગદ્ય અને સૌંદર્યને ઉપાસવાં પડશે. તે માટે જતે સાચું, કલ્યાણુકારી અને સુંદર જીવન વિતાવવું પડશે. જીવનની પ્રત્યેક ક્ષણમાં શીલ, સૌંદર્ય, પાવિન્ય અને સત્ય સાકાર થાય તે માટે મથવું પડશે. જીવનનાં જે સનાતન મૂલ્યો છે, તેને સેવી પોતાના ચિત્તનો સ્ફેર કરવો પડશે. ચિત્તનું રૂપાંતર ચેતનામાં થાય તે માટે મૂલ્યનિષ્ઠાનું સેવન થવું જોઈએ. વૃત્તિએને વ્રતપાલનમાં ઢાળવી પડશે. જેના જીવનમાં વ્રત, સુવ્રત હશે તેને વૃત્તિ, સદ્ગૃત્તિ, નિવૃત્તિ હસ્તામલકવતું સિદ્ધ થશે.

### વૈરાગ્યમૂલક પ્રેમની સાધના

મૂળતઃ પરમધામના રહેવાસી, પરંતુ આ પ્રગટ દેશમાં આવ્યા છીએ ઈશ્વરીય કર્તાય કરવા. મધુરતાને વહેંચવા આવ્યા છીએ, પરંતુ અંતરમાં વૈરાગ્ય છે. સૌની સાથે સ્નેહ કરવો છે. સૌને સહયોગી બનાવવા છે, પરંતુ રાગ-મોહે કોઈનો ન અપે. સૌને સાથે રાખીને ચાલવું છે, અટકી જવું નથી. પહેંચવું છે પરમપિતા પાસે.

ધ્યેય સુનિશ્ચિત છે, એટલે કોઈ પણ કામ માટે વાયદા કે અવિષ્ય નહીં. જે કાંઈ કરવું છે તે અત્યારે જ, આ ક્ષણે જ કરવું છે. જીવનમાં આપીને સુખી બનવું છે, કરીને કૃતાર્થ બનવું છે. જીબન વહેંચવું છે. પોતાની અચલ અપ્રસ્થા, સતત સેવા, આવું આ એક અચળધર છે. સૌ સાથે જોડાયેલા, છતાં થ સૌથી વેગળા. નિકટ છતાં થ હુર. આમ પ્રત્યેક સંભાંધમાં વચ્ચે આકળજીણો. પડદો રહે, તેમ છતાંથી પરસ્પર પરિપૂર્ણ સ્નેહાદરની અનુભૂતિ આવે.

### ભૂતકાળને દરેનાવો

આપણે વર્તમાનમાં જીવતાં શીખવાનું છે. અતીતનું ભૂત સાથે લઈને દરેનાર કહાપિ કાંતિ નથી કરી શકતો. આપણે તો પ્રભુને સદાસર્વદા સાથે રાખવાના છે. જેટલો સમય પ્રભુનો સાથ હશે, તેટલો વખત શક્તિનો સંચાર અનુભવાશે. દિવસભર ગમે તે પ્રવૃત્તિ કરીએ, પરંતુ ઈશ્વરના સાક્ષીત્વમાં કરીએ તો બહારની સ્થૂળ માયાજંલણ આપણુંને બાંધી શકતી નથી. એટલે પ્રભુ સાથે ડેવળ પ્રેમ બાંધીએ

તેટલું પૂર્તું નથી. એને સહા પડ્યે રાખીએ. એની પાસે સહાસર્વ દા ખુલ્લા રહીએ. કશું ય એનાથી છુપાવીએ નહીં. એ સાક્ષીરૂપ હશે તો ભૂલો ઓછી થશે. આપણા પ્રત્યેક સંકલ્પને અભ્યકૃત સ્વરૂપ સાથે સરખાવી જોઈએ. સત્તસંકલ્પથી વિરોધી સંકલ્પ આપણામાં ન ઊડવો જોઈ એ, તો જ અપકર્માથી બચી શકશે.

આપકર્મી બનવાનું છે. બીજાની કમાણુંના આધારે જીવવાનો વિચાર જ પાયામાંથી ભૂલ છે. કમર કસવાની છે. સત્તસંકલ્પ, સત્કર્મ પર જીવનની સાચી કમાણું કરવાની છે. તે માટે પુરાણા સંસ્કારોમાં પરિવર્તન લાવવું પડશે. પુરાણા સંસ્કારોની અસ્થિયોનું પણ કાળસાગરમાં વિસર્જન કરી દેવું પડશે, નહીં તો એ અસ્થિયોમાં પણ ફરીથી ભૂત દાખલ થઈ જશે અને તમારી આજની સ્થિતિને ડોલાવી દેશે.

એક રીતે આપણે આપણો તમામ વ્યવહાર પ્રભુમય અનાવવાનો છે. પ્રભુમય એટલે બધું સત્યમય હોય, સંકલ્પ, વાણી, કર્મ, વ્યવહાર બધું જ સત્યમય હોય. કોઈ પણ કામ અધ્યકૃત એટલે કે મન વગરનું કરવાનું ન થાય. આપણી સમય હુસ્તિ પરોવી દઈને, મન પરોવી દઈને કામ થશે તો જ તેમાં સૌંદર્ય સોણે કળાએ ખીલી ઊડશે. અભ્યકૃત સાધના પરિપૂર્ણતાની સાધના છે. તેમાં કશું અધ્યકૃત, એછું ન ચાલે. આ પરિપૂર્ણતા એવી ચીજ છે કે ગમે તેટલી પૂર્ણતા સાધો, તો ય બધું પૂર્ણતા પ્રાપ્ત કરવાની

ખાડી જ રહી જાય છે. પરિપૂર્ણતાની આ સાધના માટે અનંત જીવનનો કાંઈ હિસાબ નથી.

### અંતર ઘટાડી અંતરતમને પાડો

લીતર ડેક્કિયું કરવાનું છે અને અંતરના ગર્ભા-ગારમાં જે એઠો છે તેને પિછાળુવાનો છે અને પછી તેનામાં સ્થિર થવાનું છે. પ્રભુ સમાન અનવાનું છે એનો અર્થ જ એ છે કે આજે એનાથી અંતર છે, તે આપણાથી ફર છે. તેની અને આપણી વચ્ચેનું આ અંતર ઉત્તરોત્તર ઘટાડવાનું છે. આ અંતર શાખદના એ અર્થી થાય છે. એક તો અંતર એટલે તદ્દીવત, ફરી. બીજું અંતર એટલે કે અંદરનું. આપણું જે શુષ્ટ સ્વરૂપ છે તે આંતરિક સ્વરૂપ છે, અંતરનું સ્વરૂપ છે. પ્રભુ વચ્ચેનું અંતર જેટલું ઘટતું જશો, તેટલું આ આંતરિક સ્વરૂપ વધુ છતું થતું જશો, વધુ પ્રગટ થશો અને આપણે ઉત્તરોત્તર પ્રભુસમાન અનતા જઈશું. ‘આપણે પરમપિતાનાં ચરણોમાં જેટલું અહંકારનું સમર્પણું કરીશું’, તેટલી પરમપિતા સાથેની સમાનતા સાર્થક કરી શકીશું. આપણા જીવનમાં વધુ ને વધુ ગુણો પ્રગટાવી આ પ્રભુતાને સાકાર કરી શકીએ.

### ચિત્તને અચલાયતન અનાવો

આપણુને જે મન મહિયું છે, તે સ્વલાવે ચંચળ છે. તે આપણુને કયાંય સ્થિર થવા દેતું નથી. આપણે સ્થૈર્યને સાધવાનું છે. આપણી સ્થિતિ હાલકડોલક અને અસ્થિર નહીં, ખદકે સ્થિર ભૂમિકામાં અવિચળ થતી જવી જેઈએ.

કોઈને આપણું છબી પાડવી છાય તો હાલ્યા કરીએ તો સારી તસવીર ન આવે. તો હૈટો પાડતી વખતે જે રીતે હાલી ન જઈએ તેનું ધ્યાન રાખીએ છીએ, એ જ રીતે આપણું સાધનામાં પણ આપણું અડોલ રહેવું જેઠીએ. આપણું પ્રતિક્ષણું કોઈ હૈટો પાડી રહ્યું છે તેવું કલ્પો. આવી અવિચણ સ્થિતિ ગ્રાસ્ત થશે તો જ પરમપિતા સમાન બનાશે.

પ્રભુ પાસે જવું છે તો સંપૂર્ણ બનીને જવું છે તે ચાહ રાખો. એમાં ઢીલાશ થાય તો તે લયંકર છે. ઢીલે દુઃખ ઉનજરસ (Delay is dangerous). મોડું કર્યું કે ઢીલા પડ્યા તો કામથી ગયા તેમ સમજવું.

આજકાલ મોટા ભાગના લોકોની ઇસ્થિયાહ આવે છે કે નાહિંકના વિચારો, વ્યર્થ સંકલ્પો ખૂબ ઊઠ્યા કરે છે. આ વ્યર્થ સંકલ્પો ન ઊઠ્યા કરે તે માટે તમારી હિન્દ્યાર્યા નક્કી કરી રાખો. આપણું મન સમક્ષ પ્રત્યેક ક્ષણનું કાર્ય નક્કી હશે તો નાહિં ઊઠતા સંકલ્પો પોતાની બાળ સંકેતી લેશો. આ હિન્દ્યાર્યામાં ચાર વાતો ચાહ રાખો. મિલન, વર્ણન, મગન અને લગન.

મિલન—પરમપિતા સાથેનું મિલન સ્થવાનું છે તે કહી ન લુલાય.

વર્ણન એટલો સેવા ક્ષારા ઈશ્વર મજ્યા તુલ્ય આનંદનું વિવરણ.

મગન—પ્રભુસમરણમાં મગન રહેવું તો જ એની લગની લાગે તે લગન.

મુખ્ય વાત છે પરમપિતા સાથેના અનુસંધાનની. એ અનુસંધાન કાયમ રહેશે, નજર સામેથી લક્ષ્ય હટશે નહીં તો ધીરે ધીરે પિતા આપણું ભીતર એનાં લંગર નાખશે.

### સાધક સમાજની દીવાઢાંડી

આપણું આ પાંડવોની સેનામાં લર્પૂર શક્તિ હશે. પરંતુ આ શક્તિ ક્ષારા તે સૌની આગળ રહેશે કે સૌની પાછળ રહેશે? ગાઈડ આગળ રહે છે, ગાર્ડ પાછળ રહે છે. પાંડવ સેનાએ ગાર્ડની ભૂમિકા લજવવાની છે. તેને હવે અધું સંતુષ્ટ છે, સાંકે છે. એટલે જ એ સંતુષ્ટ છે. સતત સ્વરૂપસમરણું, સ્નેહ, સહયોગ અને સહનશક્તિ આ ચાર પ્રકારનાં બળ જેનામાં સમાનરૂપે પ્રગટ થતાં હોય છે તે સંપૂર્ણતાની હિશામાં આગળ વધી રહ્યો છે.

કોઈ આગળ હોય, કોઈ પાછળ હોય પરંતુ સૌ પુરુષાર્થી હોય છે. એક હરોળમાં કોઈનો પુરુષાર્થ તીવ્ર હોય, કોઈનો હીલોઠાલો મંદ હોય; કોઈનો પ્રગટ પુરુષાર્થ હોય તો કોઈનો ગુપ્ત હોય. તીવ્ર પુરુષાર્થમાં સર્વ સંકલપોને ત્યાગ આવે છે. જલ્દે શુલ કાર્ય હોય પણ જ્યાં ‘મેં કર્યું’નો અહુંભાવ જાઓ છે ત્યાં સાધના પાછી પડે છે. આપણું ભીતર પડેલી આ બધી અધૂર્પોને યજમાં હોમવાની છે, લહીમાં સળગાવવાની છે. અભિસ્નાનમાંથી જે સંક્ષણ પાર જિતરે છે તે ફરિશ્ટો અનીને, પથગંભર અનીને સર્વત્ર વિહંગી શકે છે.

માનવ તો સાગરતું એક બિન્દુ માત્ર છે, જ્યારે

परमपिता तो सिंधु छे. विश्वमां आ ये हस्ति छे. एक बिन्हु अने बाकीतुं बधुं सिंधु. बिन्हुनी बहान वे कांઈ छे ते बधुं सेवा माटे छे. साव सरण भाबत छे. परंतु समृति कायम टक्की नथी एटदे सहेली वात पछु अधरी थर्ह पडे छे. विसमृति अनेक विधनो जिलां करे छे. सूर्यास्त थाय छे अने रातना काणा ओणा जितरी आवे छे. परंतु सूरज झण्डणतो होय त्यारे ?

### संभंधीमां निरपेक्षता

ज्यां सुधी साधकावस्थामां छीये, संपूर्ण अन्या नथी, त्यां सुधी शुं करीशुं ? वे द्वाको हजु साधकावस्थामां आव्या नथी, तेमना लुवनमां साधना प्रगटाववी. घुट संपूर्ण अनवुं अने सौने पूर्ण अनाववा. सौनी साथे डेवण आ सेवानो संभंध. परस्पर द्रेष, स्पर्धा के हुंसातूंसीनो कोई प्रक्ष ज नहीं. अहके सतत् चिंता अनी रहेवी लेईये के वे पाछण छे ते आणण केवी रीते वधे-कोईनी साथे वधारे संभंध अने कोईनी साथे ओछो संभंध तेवुं नहीं, पछु प्रत्येक साथे समानांतरे रहेतां शीखवुं पडशे. जुही जुही व्यक्तियो साथेना वत्ता—ओछो संभंधने परिणामे द्रेष, इर्ज्या, स्पर्धा वगेरे अवगुणो विक्षवानी संलावना रहे छे. कोईनी पासेथी कशी ज अपेक्षा राखवानी नथी, पछी कोई वधारे नजुक अने कोई वधारे फ्रर तेवुं शा माटे ? सौनी साथे समान संभंध अ ज निरपेक्षतानी कसोटी छे.

### એકાંતમૂલિક એકતા

આપણુમાં પરસ્પર એકતા હોય તે સારું જ છે. એકતા તે તો સામુહિક સાધનાનો પ્રાણ છે. સૌના અંતરમાં એક જ પરમચૈતના વિલસે છે, આ એકત્વનું લાન થાય ત્યારે આવી એકતા અખંડિત રહી શકે છે. એટલે એકતા તો જોઈએ જ.

પરંતુ આ એકતાને ટકાવવા માટે એક બીજુ ચીજ જરૂરી છે, તે છે એકાંતવાસ, એકાંતપ્રિયતા. થોડું વિચિત્ર લાગે રેવી બાખત છે, પણ લુચનનું આ સત્ય છે. સૌની સાથે જે એકત્વ સાધવું હશે, તો કોઈ પણ એકની સાથે વધારે સંખંધ રાખી નહીં શકાય. એકતા માટે એક સાથેની વધારે પડતી એકતા છોડવી પડશે, ત્યાં એકનો અંત લાવવો પડશે. આ છે એકાંત. બધાંની સાથે સમાન સંખંધ, સમાન અંતર રાખવું હશે તો એકાંતવાસ કરવો પડશે. સર્વના પ્રતિનિધિ સમો કે પરમેશ્વર છે તેમાં આ બધા નાના નાના એકનો અંત લાવી ઇકૃત તેની સાથે જ ઐસતાં શીખવું પડશે. આ એકને જે જાણી લેવાય, તો બાકીનું શેષ જાણી શકાય છે. આ એકને પામવાથી સૌ કોઈ આવી મળે છે. એકની આ પ્રાપ્તિ અખંડ રહે છે. ઘડીકમાં તે મળી અને ઘડીકમાં ગુલ થઈ ગઈ એવું નથી હોતું. તે મળી તો મળી જ, આવી અનુપમ સંપ્રાપ્તિ છે આ. આમાં બધું એકરસ છે.

એકની સાથે એકરૂપ થવા માટે હળવા બનવું પડે

છે, અહુંને ઓગળવો પડે છે. આપણે હળવા હઠશું તો ઈધરને આપણી પાસે ને કાઈ કામ કરવાનું હશે તે માટે તે આપણુંને વાળી શકશે, પલોટી શકશે. એટલે હળવા હાવું, નરમ હાવું તે ખૂબ જરૂરી છે. નરમાઈ હશે, નમતા હશે તો સેવાગુણું સધારે. આ નમતા દ્વારા વ્યક્તિત્વનું નિર્માણ થશે અને એની સાથે આત્મતેજની શક્તિ પણ હશે, નેને કારણે કોઈને આધીન, ઓશિયાળા નહીં અનુભવાય. સ્વાધીન, આત્મનિર્ભર અને છતાં ચ્યાપેમાળ, સેવાલાવી એવું વ્યક્તિત્વ નિર્માણ કરવું હોય તો ને વિરાટ એક છે, તેની સાથે અલિન્નતા, એકરસતા અનુભવવાનો અખંડ પ્રયાસ ચાલુ રાખવો પડશે.

સેવાની સફળતા નમતામાં છે. નેટલી વધારે નમતા તેટલી વધારે સફળતા. આપણે નિમિત્તમાત્ર છીએ એ લાવના દદ થાય તો નમતા આપોઆપ કેળવાય છે. નમતા કેળવવાથી સૌ તમને નમન કરશે. સેવા માટે આપણું શરીર નિમિત્ત બન્યું એવી નમતા હાખવવાથી.

ત્રીજી વાત છે દષ્ટિ-પરિવર્તનની. દષ્ટિ બદલાશે તો સુષ્ટિ આપોઆપ બદલાશે. દષ્ટિ બદલાવાથી ગુણ અને કર્મ આપોઆપ બદલાય છે.

### સાધકાવસ્થા સાધારણાથી વેગળી

આપણુંને વિવિધ ઇન્ડ્રિયો મળી છે. સાંભળવા માટે કાન, જોવા માટે દષ્ટિ. આ ઇન્ડ્રિયો અંદરની હિશામાં

પણ જોઈ શકે, બહાર પણ જોઈએ. અંતર્મુખી દર્શિ અને બહિર્મુખી દર્શિ. એ જ રીતે દર્શિ ઉપર ઉપરનું સ્થળ દર્શન પણ કરી શકે અને આંતરિક દર્શન પણ કરી શકે. બાધ્ય કોચલાને લેદીને જે અંદરનું દર્શન કરી શકે તે જ સાચું દર્શન છે. જીવમાત્રની લીતર આત્મા છે. આ આત્મા જેને હેખાય તેની દર્શિ આત્મિક દર્શિ છે, દિવ્ય દર્શિ છે તેમ કહી શકાય. આ આત્મિક દર્શિ એ જ યથાર્થ દર્શિ છે, કારણ કે માણુસનો બાધ્ય હેહ તો એના ધર્મકાર અટકી જશો ત્યારે મરી પરવારશે. પરંતુ માણુસની ભીતરનો જે સાચો હેહ છે, આત્મા છે તે સ્વરૂપ કાયમ ટકી રહેનારું છે. તેને જેવાની દર્શિ સાંપડે તો તે યથાર્થ દર્શિ રહેવાય.

આ દર્શિ અત્યંત મહુતવનું સાધન છે. સાક્ષાત્કાર કરવાનો છે, તે પણ આ દર્શિથી જ. એટલે આંતરિક દર્શિ ખીલવવી પડશે. ચર્મચક્ષુ દ્વારા જેટલું હેખાય તેટલી જ સુદૃષ્ટિ નથી. સુદૃષ્ટિ તેને પાર પણ વસે છે અને એ પેલે પારની સુદૃષ્ટનું દર્શન જે દર્શિથી થાય છે, તે છે આંતરચક્ષુ !

આપણાં ચક્ષુને સાક્ષાત્કારનું સાધન ઘનાવવાં છે. એક વિશેષ દર્શિ આપણે ખીલવવાની છે. સાધારણ દર્શયો. જેવા માટે આપણે સર્જન્યા નથી. આપણે તો વિશેષ દર્શન પણ કરવાં છે, સાક્ષાત્કાર કરવો છે, તો વિશીષ દર્શિ જોઈએ જ.

### સમદર્શિકા દ્વારા સમતા

આ દષ્ટિ પક્ષપાતી ન હોવી જોઈએ. અધા ઉપર સમાન હોવી જોઈએ. આપણે જે રીતે આપણો ઉદ્ઘાર દૃચ્છીએ છીએ, એ જ રીતે બીજાના ઉદ્ઘારની ચિંતા પણ આપણે જ સેવવાની છે. આપણે ઈશ્વરી સંકેતના વાહન અનવાતું છે. આપણું સ્વરૂપ પ્રિય હોય, કોમળ હોય, પરંતુ ઈશ્વરી સત્યતું વહન કરનારું હોય. વૃક્ષની નાની નાની સુકોમળ પાંદડી મનોહર લાગે છે, પરંતુ એ ચકલીના અન્યાને પણ ખૂબ ભાવે છે. આપણું પ્રિય સ્વરૂપ પ્રલુદ કાજે રહે, અન્યના લોગ કાજે નહીં, તે ધ્યાનમાં રહેવું જોઈએ. આપણું ભીતરતું જે શીલતું સૌંદર્ય છે, તેને પ્રગટાવવાતું છે, ઉપરતું દેહનું ભૌતિક સ્વરૂપ નહીં.

### દૈહિકતાને વીંધતાં શીખીએ

વૃત્તિ અને દષ્ટિમાં શુદ્ધિ આવવી જોઈએ. વૃત્તિ અને દષ્ટિ બંને આધ્યાત્મિક થબી જોઈએ. શરીરને ન જેતાં ભીતરના આત્માને જોઈએ તો દષ્ટિ અને વૃત્તિ બંને આધ્યાત્મિક થઈ જાય છે. આધ્યાત્મિક વૃત્તિ ખીલવવા માટે પ્રત્યેક ચીજના અંતરના હાર્દને જેવું પડે છે. પોતાનામાં પરિવર્તન કરવું હોય તો પ્રત્યેક ચીજની જે સ્થૂળતા છે તેને વીંધીને તેની અંદર રહેલી સૂક્ષ્મતાને પિછાણી એને જ અહુણું કરવી પડશે, હાથ-પગ દ્વારા જાદે ભૌતિક કાર્ય કરીએ, લૌકિક જગતમાં જઈએ, પણ અંદરથી સતત એવી સલાનતા રહે કે આપરે તો આ ખંડું અલૌકિકતા

પ્રાપ્ત કરવા માટે જ છે. જમવા એડા છીએ તો લદે શરીરને લોજન આપીએ, તો પણ અંહરથી અનુભવીએ કે આત્માની શક્તિ વધારવા માટે આ કોળિયો ખાઈએ છીએ. લૌકિકમાં રહેવા છતાં અલૌકિક સાથે અનુભંધ રહે, આમ બધાની બચ્ચે હોવા છતાં બધાથી ન્યારા થતાં શીખવાનું છે. હુનિયા કરતાં આપણું કાર્યો પણ નિરાળાં હશે અને આપણી વૃત્તિ પણ નિરાળી હશે.

આખરે આ સમસ્ત માનવદેઝને પ્રબુધામ બનાવાનું છે એ વાત સાચી હોવા છતાં, સૌ માનવો એક જ કક્ષા પર નહીં હોય. એટલે સાધકેનું જીવન ચીલાચાલું વ્યવહારિયા લોકોથી ન્યારું હશે. આ ન્યારાપણુંમાં કોઈ મોટાઈ અનુભવવાની નથી, પરંતુ ગૌરવ જરૂર અનુભવવાનું છે. તેમાં મઝ્જમ રહેવાનું છે. સાધકનો રંગ સાધારણોને લાગવે જોઈએ, સાધારણોને રંગ સાધકોને લાગે તો સમજવું કે હજુ કચાશ છે. પોતાની જાત માટે અભિમાન ન હોવું જોઈએ, પરંતુ અંતર આત્મવિચાસ અને આત્મ-ગૌરવથી છલોછલ છલકાવું જોઈએ, સાથોસાથ આ ચીજનું પણ નિરંતર ભાન રહેવું જોઈએ કે જીવનમાં હજુ ધણું સાધવાનું બાકી છે. જીવન એક અખંડ આરોહણ પ્રક્રિયા છે.

આપણી પાસે કોઈ થોડી વાર માટે પણ આવે, પરંતુ ઓપણા જીવનની આલા એવી હોવી જોઈએ કે આગંતુક સહાને માટે આપણા સ્વજન થઈને રહે. મહેમાન અહેમાન ન રહેતાં આપણા સાથી થઈ જય. આવું થઈ

શકે, જે આપણે આપણા જીવનને ઉઠટાપૂર્વક જીવતા શીખી લીધું હશે તો. આપણા જીવનની સર્વાઈનો, પ્રેમનો, સમર્પણશીલતાનો પ્રલાભ આવનાર પર એટલો બધો પડે કે એનું જીવન બદલવાની એને પ્રેરણા મળે. નહીં પાસે કોઈ જય અને જેવું ને તેવું, કોરુંધાકટ પાછું જય તેવું બનતું નથી. નહીંનું દર્શાન ચિત્તને પ્રસન્ન કરે છે, સંતાપ હરી લે છે. એ જ રીતે આપણી પાસે આવનારને આપણી ભીતરના પવિત્ર પર્યાવરણનો સ્પર્શ થવો જોઈએ. આવા સંસ્પર્શ ક્રારા આપણે એકેક બ્યક્ઝિને આપણામાં સમાવતા જઈ આપણી જમાત વિસ્તારવાની છે. સજજનોની જમાત વિસ્તરશે, સંગડિત થશો, સક્રિય થશો તો આવા સજજનો આખા સમાજને પલટી શકશે.



## [ ૪ ] સાધક-વિવિધ ભૂમિકાઓમાં

પરમતત્ત્વની પ્રાપ્તિ માટે આપણે અધ્યકૃતની સાધના કુવાની છે. અને એ અધ્યકૃતની પ્રાપ્તિ માટે આપણે આત્મમય ભૂમિકામાં સ્થિર થવાનું છે. પરંતુ જીવન છે ત્યાં સુધી જેટલો આત્મા સત્ય છે, તેટલો જ આ હેઠળ પણ સત્ય છે. અને આ હેઠળની અનેકવિધ ભૂમિકા હોય છે. માનવાચાયુષ્યની લિન્ન લિન્ન વયની પણ નિરનિરાળી ભૂમિકા હોય છે. જીવન એકધારું, એકસરખું વહેતું નથી. તેમાં આલ્યાવસ્થા, કુમારાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃજ્ઞાવસ્થા આવે છે. એ જ રીતે સામાજિક, પારિવારિક ક્ષેત્રની પણ લિન્ન લિન્ન ભૂમિકા હોય છે. સૂરજ તો તેનો તે હોય છે, પણ પરોદ્ધિયાનો સૂરજ, સવારનો સૂરજ, મધ્યાહ્નનો સૂરજ, અપરાહ્નનો સૂરજ, સમી સાંજનો સૂરજ—આ બધાની રંગછિટા અલગ અલગ હોય છે. આ જ રીતે માનવજીવન તેનું તે છે, છતાં ચ લિન્ન લિન્ન અવસ્થાનાં કર્તૃંયો, લક્ષ્ણો લિન્ન લિન્ન હોય છે. એ લક્ષ્ણો અને કર્તૃંયોના અનુસંધાનમાં જે-તે ભૂમિકા જીવાય તો એકંદરે સમય જીવન પરિપૂર્ણ બની શકે.

આપણું જ્યોત પ્રગટી ગઈ તેટલું પૂરતું નથી. આપણું અભિનશિખાથી ખીજની અપ્રગટ જ્યોતને પણ પ્રગટાવવાની છે. પોતાના સંગનો રંગ ખીજને ન લગાડી

શક્યા તો તેવી સંગતિનો શું અર્થ છે? અનેક પ્રગટાવેલા દીવડાની માળા! અને આ દીવા પણ નિસ્તેજ, મંદ અજવાણે અખૂક અખૂક થતા તારલા જેવા દીવા નહીં, અખંડિત તેજસાશિથી અળહળતા દીવા!

### વૈરાગ્યયુક્ત માધુર્ય

આપણું આ મધુવન છે. મધુવનની પહેલી વિશેષતા છે-મધુરતા. માધુર્યમાં મહાનતા છુપાયેલી પડી છે. જે મધુર છે તેના તરફ સૌ કોઈ એંચાય છે. માધવ મધુર હતો, એટલો જ સૌ કોઈને આકૃષ્ટ કરનારો આકર્ષણ કૃષ્ણ અન્યો. પણ અહીં કેવળ ‘મધુ’ નથી. આતો ‘મધુવન’ છે. વન અને અરણ્ય તપશ્ચર્યા માટે છે, વૈરાગ્યસાધના માટે છે, લોગ લોગવવા માટે નથી. તો મધુવનમાં માધુર્ય પણ જેઠી એ અને આત્માંતિક વૈરાગ્યવૃત્તિ પણ જેઠી એ. વૈરાગ્ય વગરનું માધુર્ય સામેની વ્યક્તિને વિનાશના ખાડા ભણી એંચી જાય, જ્યારે વૈરાગ્યયુક્ત માધુર્ય વિકાસનું આરોહણ ચ્યાદાવવા નિમિત્ત થાય. માધુર્ય દ્વારા સ્નેહતત્ત્વનું અને વૈરાગ્ય દ્વારા આત્મમાર્ગિતાનું શીલન થઈ શકે.

### અહ્લકન્યા તારક સિદ્ધ થઈ શકે

કુમારિકા ખ્રીમાં માધુર્ય અને વૈરાગ્યનો જે શુભ સંગમ થાય તો પૃથ્વી પર રવર્ગ જીતરે. કુમારિકાનાં સંકલ્પ, વાણી તથા કર્મ કર્માલનાં થવાં જેઠી એ. સ્નેહ અને શક્તિ અનેની ઉપાસના કરવી પડશે. જેટલો સૂક્ષ્મતામાં પ્રવેશ થશે, કર્મ કરવા છતાં ય કર્માસક્રિતના વળગણુમાંથી જેટલા

મુક્તા રહેવાશે તેટલી આંતરશક્તિ વધશે, આત્માનું તેજ પ્રગટશે. પરસ્પરના સંબંધમાં સ્નેહ તો જ આવે, જે ભૂમિકા સમાનતાની રહે. અસમાન કે જીંચ-નીચની કક્ષામાં સ્નેહતત્ત્વ પરિપૂર્ણપણે વિકસી શકતું નથી. પરસ્પરની સમાનતા એ જ સ્નેહની સાખ્તિ છે, પારાશીશી છે, અધિષ્ઠાન છે.

કપાળ પર ચાંદલો, તિલક વગેરે કરીએ છીએ, સાચાં વખાભૂષણાદિ પહેલીએ છીએ, પરંતુ આ બધું તો બાધા શોલા માટે. આંતરિક શોલા તો હૈવી ગુણો દ્વારા જ પ્રગટ થાય છે. બાધા શોલામાં કાન, નાક, હાથ વગેરે પર ધરેણું. પહેલાય છે, પરંતુ આંતરિક શોલા માટે કર્મનિદ્રયો દ્વારા ગુણું પ્રગટાવવાના હોય છે. માણુસમાં રહેલા શીલનું એજસ એટલું પ્રભાવઠ હોય છે કે તેની સામે હીરા, મેતી, ચાંદી, સોનાનો જળહળાઈ પણ બાંઘો પડે. એટલે આ ચારિન્યનું-શીલનું આભૂષણ પ્રાપ્ત થાય તે માટે ગુણવિકાસ ખૂબ જરૂરી છે. અહાચારિણી કન્યા પોતાના અંતર્જથી ફુનિયાનાં અંધારાં પી લે તેવી તાકાતવાળી અનવી જોઈએ.

### માતૃત્વ વ્યાપક બને

જે સ્વી મા બની ચૂકી છે તેનામાં એક વિશેષ ગુણુની અપેક્ષા છે. મા કેવળ પોતાના સાડા ત્રણ હાથના દેહમાં જીવતી નથી. એ પોતાની હસ્તિને વિસ્તારીને કુદુર્ભીજનમાં જીવે છે. પરિવારજન માટે છોડવું તેને માટે સહજ છે.

ત્યાગ તેની નસોમાં વહે છે. પરંતુ ત્યાગની સાથેસાથ મોહનાશ પણ જેઈએ. નહીંતર આસક્તિ બાંધે છે. મોહને, આસક્તિને યજાકુંડમાં જ્વાવવાનાં છે. માતાએ ચંદ્ર જેવા શીતળ અને છતાં ય પ્રકાશદાયીની બનવાનું છે. સૌભ્યતા, શીતળતા અને વળી પ્રકાશ ! ચંદ્રને સૂરજ સાથે પણ સંખંધ છે. સૂરજ સાથે અજવાળું અનિવાર્ય છે. સૂરજના પ્રખર ઉંલશને પોતાનામાં સમાવી તેમાંથી શીતળતા, સૌભ્યતા પ્રગટાવવાની છે. માતૃત્વ વ્યાપક બનશે તો જ પોતાનાં સંતાનો પ્રયેની આસક્તિના ગઠ તૂશે, અને વિશ્વનાં ખાળકેને બાથમાં ભીડવાની તાકાત આવશે.

મા કલ્યાણી પણ કહેવાય છે. હયા, કરુણા એ માતૃત્વના સહજ ગુણ છે. માતા પોતાના ત્યાગ, તપસ્યા દ્વારા વિશ્વનું કલ્યાણ પણ કરી શકે છે. માતાએ હવે જગતમાતા અની અનંત સેવામાં જીવન લગાવવાનું છે. માતૃત્વ કેવળ દેહ સાથે જેડાયલી ચીજ નથી. એમ તો પશુપાખી પણ ખાળકેને જન્મ આપે છે. પરંતુ માતૃત્વનો મહિમા તો ત્યારે સ્થાપિત થાય જ્યારે માતૃત્વ વિશ્વકલ્યાણનું વાહક બને. આજે જગતમાં હિંસા છે, યુદ્ધ છે, મારામારી અને કાપાકાપી છે. જગતમાં જે વાસ્તવમાં માતૃત્વ ખીલ્યું હોય તો વિનાશની નહીં, સર્જનની મહત્ત્વાની સ્થપાય.

તો માતાએ સામે આ પડકાર છે. તેમણે આગળ આવીને જગતને નવસર્જ નની દિશામાં દેસ્વાનું છે. પોતાના અધ્યાત્મ-૫

સંસારના નાનકડા ખાણોચિયામાંથી તેમણે બહાર આવવાનું છે, વિસ્તરવાનું છે. પોતાનું ધર અને બાળકો તો સચવાય, સાચોસાથ સમજ પણ સચવાય તેવું થવું જોઈએ. માતૃત્વ એક વૃત્તિ છે, અને એ વૃત્તિનો વિકાસ બધામાં થાય તે આદર્શ માતાએ જેવું જોઈએ.

### કૌમાર્યમાં બંધનમુક્તિ

કુમાર એટલે નિર્ભાધ. માણસને સૌથી મોટું બંધન મનના વ્યર્� સંકલપેનું હોય છે. તેમાંથી મુક્તિ એ જ સાચી નિર્ભાધતા છે. કુમાર એટલે સહા તીવ્ર પુરુષાર્થી. કારણું કે જે નિર્ભાધ હશે એની ગતિ સ્વતઃ તીવ્ર હશે. એજવાળો ધીમી ગતિએ ચાલે, હળવો જલ્હી ચાલે.

કુમારોએ પુરાણું ખાતું વ્યર્થ સમજવું, નવું ખાતું સમર્થ સમજવું. સંકલપ સમર્થ તો નવું ખાતું સમર્થ. ભૂતકાળમાં કથારેય થયું નથી એટલે થઈ ના શકે તેવી નથળી વાતો ચુવાનેને ન શોલે. કૌમાર્યનો અર્થ જ એ છે કે તે વણુણેણયલી લોમનું પ્રતીક છે. અત્યાર સુધી કથારેય જે પ્રગટ નથી થયું તે કૌમાર્યવસ્થામાં પ્રગટ થઈ શકે. વાસનાઓને જીતી આંતરિક શક્તિને વિશાળ મોકણું મેહાન આપી દેવાનો પુરુષાર્થ આ વયમાં કરવાનો છે. આપણા પૌરાણિક ધર્તિહાસમાં શુક્રદેવ, નાનીકેતા, પ્રહ્રલાદ, દ્વિવ, સનતકુમાર જેવા કુમારોએ જ જીવનનાં પરમોચ્ચ શિખરો સર કર્યાં છે. કુમારે તન અને મન બંનેના સ્વામી સિદ્ધ થવાનું છે.

કુમારાવસ્થા તે માનવજીવનની સુવણ્ણિવસ્થા છે. આ અવસ્થામાં જીવનની મહાનમાં મહાન શક્તિ અનુભવી શકાય છે. કમણેરી માટે કોઈ અવકાશ ન રહે તેટલું બધું અજૂમી શકે તેવી શક્તિ આ વયમાં હોય છે. એટલે આ ઉંમરમાં જીવનનો ઊંચામાં ઊંચા કૂદકો મારવા તત્પર રહેવું જોઈએ.

આજે પરિસ્થિતિ વિપરીત છે. જે ઉંમરમાં જીવનનું મોટામાં મોટું સાહસ ખોડાવું જોઈએ, તે ઉંમર લોગવિલાસ અને ક્ષુદ્ર આકર્ષણીયામાં ગળારૂઘ ખોવાઈ ગઈ છે. તેમાં તેમનો દોષ નથી. પરંતુ લોગવવું તો તેમને જ પડે છે. એટલે પહેલાં તેમણે તેમાંથી મુક્તા થવું પડશે. કોરી પાટી હોય તો તો તેના પર તરત અક્ષરો લખવાનું શરૂ કરી શકાય. પરંતુ કમલાંગે, પાટી કોરી નથી. એટલું બધું ચોમેરથી આકમણું છે કે પાટી કોરી રાખવી મુશ્કેલ છે. કાંઈક ને કાંઈક તો લીટાડા પાટી પર આડાઅવળા હોરાઈ જ ગયા હોય છે. એટલે પહેલું કાસ હાથમાં કલમ લેવાનું નહીં, હાથમાં લૂધવાનું કપડું લેવાનું કરવાનું છે.

### શિક્ષણની એવડી પ્રક્રિયા

યુવાનોએ એવડી પ્રક્રિયા ચલાવવાની છે. પહેલાં જે સીડી પર ચડી ગયા છો તે સીડી પરથી નીચે જિતરવાનું છે, અને નીચે જિતર્યા ખાદ બીજી સીડી પર ચઢવાનું શરૂ કરવાનું છે. કેટલુંચ શીખી ગયા છો, લણી ચૂક્યા છો તેને ભૂતવાનું છે, મિટાવવાનું છે, ભૂંસવાનું છે અને કેટલુંક નવું ભણવાનું છે. આજાંકાલની જીવનપદ્ધતિ એવા અવળા

પ્રવાહે ચઢી ગઈ છે કે વગર કારણે યુવાનોને આ બેવડી તપશ્ચિર્યામાંથી પસાર થવું પડે છે. પરંતુ જ્યાં સુધી આખા સમાજનો વ્યવહાર બદલાય નહીં, ત્યાં સુધી ચીલાચાલું પ્રવાહેના પ્રહાર સહન કરવા રહ્યા. પરંતુ 'જાયા ત્યારથી સવાર'ના ન્યાચે, જે કણે સત્ય સમજાય તે કણે સંકલપપૂર્વક જીવન-પરિવર્તનનો અડગ પુરુષાર્થ કરવો જોઈએ. સાધના માટે યુવાવસ્થા ઉત્તમ અવસ્થા છે. અધ્યાત્મ એ જીવનનો જીંચામાં જીંચો કૂદકો છે અને એ કૂદકો મારવાની ઉત્તમ ઉંમર યુવાવસ્થા જ છે.

કુમાર એટલે માયાને જીતનારે. કુમાર પાસે માયાએ સહા માર જ ખાવાનો હોય. કુમાર માયાળત હોય, આ જ એની મોટામાં મોટી બહાદુરી, મોટામાં મોટું સાહસ. કુમાર અવસ્થાને કોઈ સરહદો નહતી નથી, કોઈ સીમા બાંધી શકતી નથી, કોઈ છેડા બાંધી શકતા નથી. અનંત, અસીમ ક્ષેત્રને જે એડે છે, તે છે કુમાર. કુમાર પરમ ચૈતન્યને વારસદાર છે. એને કોઈ સીમા અડે તો કુમારને અડે. વિશ્વથી નાનું નામ કુમારની જુલે આવવું ન જોઈએ. આજે વિજ્ઞાનને કારણે જગત એકદમ સાંકડું થઈ ગયું છે, નાનું થઈ ગયું છે. હુર હુરના દેશો નજીક આવી ગયા છે. માણુસ હવે અવકાશયાત્રી બન્યો છે. મંગળ-શુક્ર વર્ગે અહેં-નક્ષત્રો આપણા પાડોશી બન્યાં છે, તેવા સમયે હૃદયને વ્યાપક બનાવવાને બહલે સાંકડું બનાવી કેવળ સ્વાર્થમાં આંધળા બની જઈએ તો યુવાની લજવાય. યૌવન

હંમેશાં અશક્યને શક્ય બનાવે છે. આજની પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય તો પણ તેમાંથી નવી હુનિયા નિર્માણ કરવાનું ચુગકાર્ય ચુવાનો સમક્ષ છે.

તમે બધા રાજકાજમાં પડેલા લોકો છો. રાજયોગી કેને કહીશું? જે તમામ કર્મનિર્ધયોનો સ્વામી છે, રાજ છે તે છે રાજયોગી. ઇન્દ્રિયોને જે વશ છે તે રાજ ન હોઈ શકે. એક વાર ખબર પડી ગઈ કે આ બધી ઇન્દ્રિયો તો આપણી ગુલામ છે, અને આપણે તેના સ્વામી છીએ, પછી માલિકે સેવકને વશ થવાનું શેનું? ઇન્દ્રિયો વશ હશે તો અધિકાર આપોઆપ મળશે.

બાકી સંસાર લોગવવા માટે નથી, સેવા માટે છે, આટલી વાત યાદ રહેવી જોઈએ. ઈશ્વરનું સાંનિધ્ય સહા કાયમ રહેશે તો સંપન્તિ સહેલે આવી મળશે. પછી સંસાર પાસે કશું માંગવા જવું નહીં પડે. ઈશ્વરના ઉદ્ઘાનના ગુલાખ બનવાનું છે. ગુલાખની મહેક બીજને ઐંચી લાવશે. ગુલાખમાં રંગ છે, રૂપ છે, સુગંધ છે. આપણે પણ પ્રભુના અગીયાના અવિનાશી ગુલાખ બનીને સૌમાં પ્રેમ, ગુણ અને સહૃદાવની સુગંધ પ્રસરાવવાની છે.

જીવનમાં હંમેશાં હળવાશ અનુભવો. એજવાળો મનુષ્ય જાંચે જાડો શકતો નથી. આવો હળવો મનુષ્ય જ અરમેશ્વરી પયગામને સર્વત્ર ફેલાવી શકે.

### સ્વરાજ્યનો સૂરજ

સંગઠનનો મુખ્ય આધાર સત્તા નથી, સેવા છે, સ્નેહ છે. જ્યાં કેવળ સેવાની ગાહી છે, સ્નેહની ગાહી છે, તે કહી

હગમગતી નથી. સ્વરાજ્યની, વિશ્વરાજ્યની અહીં સત્તા છે. એને કોઈ ડોલાવી ના શકે. અહીં જેમની સેવા થાય છે તેમને માટે કોઈ સ્વાર્થ નથી. નરી અનાસક્તિ છે. અનાસક્તિને લીધે જ તેમાં આધ્યાત્મિકતા પ્રવેશો છે. કોઈ ને કોઈ સ્વાર્થ યા કારણુસર કરેલી સેવા ભૌતિક સેવા થઈ જાય છે, તેમાં અધ્યાત્મની સુગંધ આવતી નથી. સ્વાર્થી સેવા કાગળના કૂલ જેવી છે. તેમાં શોલા હશે, પરંતુ સુગંધ નથી. સુગંધ તો ત્યારે જ આવે, જ્યારે સેવા નિઃસ્વાર્થ બને.

એટલે સેવા અને સત્તા એ બંને એ બ્રૂબિન્હુ જેટલા ફર છે. સાચી સેવાને સત્તાપ્રાપ્તિ સાથે કાંઈ સંયંધ નથી. હકીકતમાં તો નિઃસ્વાર્થ સેવા કરનારને સત્તા આપોઆપ આવી ભણે છે. બદકે, એ સત્તા વાપરવા તૈયાર નથી હોતો. સત્તા અને સ્વરાજ્ય બંને સાથે ના રહી શકે. પ્રત્યેકમાં પડેલી શુલ્ક ભાવના કામ કરતી થઈ જાય, પ્રત્યેક જવાખારે એકમ બને આ જ છે સ્વરાજ્યનો મર્મ. સત્તામુક્તિ એ જ સ્વરાજ્યનો સૂરજ છે.

ચિત્તની સહા પ્રસન્નતા, આ છે અધ્યાત્મ-તત્ત્વની કસોટી. હુંમેશાં આનંદ-ખુશીનું અરણું સતત વહ્યા કરે છે, વહેતાં વહેતાં પ્રસન્નતાનો પ્રસાદ વહેંચે છે. હુવા સતત વહેતી રહે છે અને હરહુંમેશ આનંદને લુંટાવતી રહે છે. શ્રીમાર્યાવિસ્થામાં સંયમ હોય, અદ્વાર્ય હોય, તેથી દિવેલીયું મોહું રાખવાની જરૂર નથી. સંયમ પરમપ્રસન્નતાનું પ્રતીક છે. સંયમ એ કર્માયેલા કૂલની નિશાની નથી, સંયમ એ.

તો ખેલિલા કૂલનું પ્રતીક છે, જે હસે ને હસાવે. પ્રસન્નતા એ આપણી સહજવસ્થા થઈ જવી જેઈએ. હુનિયા આખીની ચિંતાનો પછાડ ઉપાડીને જીવવાની જરૂર નથી. જગતની ચિંતા કરનારો એડો છે. આપણે તો આપણાથી થાય તેટલું કરી છૂટવાનું છે. આપણા કર્તૃવ્યમાં જરા પણ ચુંબુતિ થાય તો ચિંતા કરવી. બાકી આપણે પૂર્ણ જવાખદાર હોઈએ તો પછી કુળ પ્રલુને સમર્પણ. એ જગતવિધાતા છે, જગતનિયંતા છે. એ પ્રેરણા પણ આપી શકે છે. એને હુનિયાને જે રીતે ઘડવી હશે તે રીતે પ્રેરણા આપતો રહેશે. આપણે તો ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા દાખવી, સતત કર્મશીલ રહેવું કે આપણુને સદ્ગુરુદ્વિ આપી સન્માર્ગ ચાલવાની પ્રેરણા આપી.

### કમાણી મારે જગરણ

એકૂત અને વેપારીને કમાવાનું હોય છે ત્યારે રાતોની રાતો જગવું પડે છે. આપણે પણ જીવનની સાચી કમાણી કરવી છે એટલે જગરણ કરવું પડશે. ધનહોલત માટે જાગીએ તે તો ઉનગરો કહેવાય. પણ પ્રલુપ્રાપ્તિ માટે જાગીએ તેને જગરણ કહેવાય. આવા જગરણમાં લગવાનનો સાથ પણ મળે. જેના માટે જગરણ કરીશું તેની પ્રાપ્તિ થશે. ઈશ્વરે આપણુને ઈચ્છાવર આપ્યું છે. એટલે કે જેવી ઈચ્છા કરીશું તેવું વરદાન તે આપશે. આપનાર પરમહાત્મા એ સવાલ આપણી અર્જુલનો છે. પરમનિયંતા પાસે ધનહોલત, ખગીચા-વાડી, ખંગડા-ધરેણાં માંગવાં કે સદ્ગુરુદ્વિ, નિષ્ઠા, સુક્રિત માંગવી, તે આપણી વૃત્તિ પર નિર્બંધ છે. વૃત્તિનું

નિરંતર સંશોધન કરતાં રહેવું જોઈએ. શોધન એટલે શુદ્ધિ પણ ખરી. વૃત્તિને શુદ્ધ અનાવતાં અનાવતાં છેવટે નિ-વૃત્તિ સુધી પહોંચવાનું છે. આ આપણી પરમકમાણી છે. એટલે નાની નાની કમાણી માટે ઉલગરા વેઠયા કરીએ તેવું ન થાય. પરમધનની પ્રાપ્તિ માટે જગરણુને સાર્થક કરીએ. જે જગે છે તે જ પામે છે. જગરણની વેળા પણ છે. જગીએ અને જગાડીએ. જગીએ, જગાડીએ અને જે કાંઈ પ્રથોધાયું છે તેને પ્રાપ્ત કરીએ.

હંસ એક સુંદર પ્રતીક છે. એ શુભ છે, પ્રત્યેક જીવ પ્રત્યે શુભ ભાવના રખનાર નિર્મિણ હૃદયનું એ પ્રતીક છે. હંસમાં એવો વિવેક છે કે તે કાંકરા અને રતન વચ્ચેનો લેદ પારખી શકે છે. બહારની અકલ્યાણની વૃત્તિને તે બદલી શકે છે, એટલી ઉત્કટ એની કલ્યાણભાવના હોય છે. એ હંમેશાં હસમુખ રહેશે. આમ બુદ્ધિ, વૃત્તિ, દષ્ટિ અને મુખ એમ ચારેયમાં હંસના ગુણોનો વિકાસ થવો જોઈએ. પોતાની જાતને કડક રીતે તપાસતા રહી ચકાસવી જોઈએ. સાધારણ વ્યર્थ ચીજેમાં સમય વેડફેવાની વૃત્તિ હોય તો હંસત્વ પ્રાપ્ત ન થાય. પહેલાં પોતાના પર વિજય, પછી સર્વે પર વિજય અને છેવટે પ્રકૃતિ પર વિજય. આવા ત્રિવિધ વિજય વિજયમાળાના વિવિધ મણુકા અનશો. આવા અનેક મણુકાએનો, ફૂલોની માળાને વૈજ્યનિતમાળા કહેવાય છે.

ચિત્તમાં નિમિત્તભાવ રહેવો જોઈએ. એનાથી નિરાકારીતા, નિર્વિકારીતા અને નિરહંકારીતા સધાય છે. પ્રભુની

અનાવેલી હુનિયાને ખ્યાર કરવો એ જ પ્રલુ પ્રત્યેના ખ્યારની સાખિતી છે. પ્રલુની પાસે આપણા બધાનું જમા-ઉધાર ખાતું લખેલું છે. પ્રલુના ખ્યારની સેવા કરીશું તો પ્રલુના ખ્યારા અની શકાશે. આ વેપારમાં બજેટ પણ અનાવવું પડશે.

બધાને જીવનમુક્તિ પ્રાપ્ત થાય એ જ લક્ષ્યાંક. હુનિયાહારી બજેટમાં બધાને રોજુરોટી મળશે, મકાન આપીશું, પાણી-વીજળીની વ્યવસ્થા કરીશું વગેરે વગેરે ચોજના કરીએ છીએ એ રીતે આ વેપારમાં પણ બજેટ કરવું પડશે કે કેટલાના રાગ-દ્રેષ એછા થશે અને કેટલાની શક્તિ લોકસેવામાં લાગશે.

સેવાનું જીવન એ જ આદ્યાદ્ય જીવન છે. સેવા વગર આદ્યાદ્ય જીવન ટકી ન શકે. સેવા કહી ઉપરછલ્લી, મૌખિક ન હોઈ શકે. સેવા ઐલવાની નહીં, કરવાની હોય છે. વળી તે નિઃસ્વાર્થ હોવી જરૂરી છે. સ્વાર્થ અને સેવા એ બંને વિરોધાલાસી શાખાઓ છે. સર્વેને સુખી કરનારી સેવા ઈશ્વરીય સેવા છે. તે સર્વોત્તમ સેવા છે.

ઓનિ નંબરની સેવામાં ફળની આશા છે. આપણું ભલું થાય, કીર્તિ મળે આવી કાંઈક ને કાંઈક ફળેચ્છા તેમાં રહેલી હોય છે એટલે તેનો નંબર ઓનિ અને છે. સર્વોત્તમ સેવા તો ગુપ્ત રહેશે, જ્યારે ફળાકંક્ષી સેવા ઐલતી હશે. ગુપ્ત સેવાનું મહત્વ અત્યંત છે. એવી સેવા કરનારો આત્મા સહા સ્વયંતૃપ્ત હશે. એને કશાની પરવા નહીં હોય. માનઅકરામ કશાની ઘેવના નહીં. નિજમાન,

સ્વમાન એ જ એમને મન મોટું માન છે. એમને તો અવિચણ, અવિનાશી તત્ત્વની પ્રાપ્તિ એ જ જંખના છે. આવા આત્મા વિશ્વકર્માણુકારી સેવાધારી કહી શકાય. આ હીરા સમાન છે. આવા સેવાધારીની પાછળ પાછળ સફળતા આવે છે. પ્રસન્નતા એ તો સેવાની કૂઝે જન્મતી સંતતિ છે. સેવા કરીને કોઈ ઉદ્દાસ થાય, ગ્લાનિ અનુભવે તો સમજે કે તે સેવા જ નથી. સાચી સેવા શાંતિ, પ્રસન્નતા અર્પે છે. સેવા શાંતિનું દાન અર્પે છે. પ્રત્યેક આત્માની શાંતિ પર જ વિશ્વશાંતિ ટકેવી છે. પ્રકૃતિ પણ ત્યારે શાંત થશે જ્યારે માનવોમાં શાંતિ હશે. મનુષ્ય શાંતિનો ખાસ કેશો તો પ્રકૃતિ, વિશ્વ સર્વત્ર શાંતિના ખાસોખાસ ઈલાશો. એટલે પહેલાં તો માનવે શાંતિસદ્ધન બનવું પડશે. તેનામાંથી શાંતિના કિરણો કૂટશે તો વિશ્વશાંતિ શક્ય બનશે. શાંતિ એ મનુષ્યજીવનનો ખાસ છે. સેવાધારી માનવ તરફથી અશાંતિ માટે કોઈ કારણ નહીં મળે. એ સમસ્યારૂપ નહીં, ઉકેલરૂપ હશે. સ્વમાં જે પ્રતિબિંદિત થશે તે વિશ્વમાં થશે. માટે એકેક વ્યક્તિની શાંતિ, સેવા એ બીજરૂપ છે, જેમાંથી વિશાળ વટવૃક્ષ પેદા થઈ શકે.

સેવામાં ગુણવત્તા જોઈએ, સંખ્યા પણ જોઈએ. સેવકેની સંખ્યા ન હોય તો સેવકને થાક લાગે.

ગમે તેટલાં કર્માના દર્શિયા ડહોણી નાણો, પણ તે અધાને અંતે જે આંતરિક પ્રસન્નતા, આનંદનો અનુભવ ન આવે તો સમજે કે આપણે ઉપર ચઠવાને બદલે નીચે.

પડી રહ્યા છીએ. પ્રસન્નતાને છોડી હેવા કરતાં આવી સેવા છોડી હેવી વધારે સારી. અનહુદ શાંતિ, પ્રસન્નતા એ જ સેવાની સાચી ઝળશૂતિ છે. તે પ્રાપ્ત ન થાય તેવી સેવા શા કામની? એટલે સેવા કારા આપણા હૃદયની હન્દિયાળી લીલીછમ થઈ જવી જોઈએ, તેમાં વિવિધ કૂલ ઊગવાં જોઈએ. તેને બદલે હૃદયમાં કાંટા લોંકાય તો આ બધી ઉડવેઠનો કશો અર્થ નથી.

હકીકતમાં ખુશી એ જ ખુશનસીધી છે. સત્તા હોય, સંપત્તિ હોય, જગીરદારી હોય પણ ચિત્તની ખુશી ના હોય તો તે કમભાગ્ય કે સદ્ગલાગ્ય? અને અંતરની ખુશી કહી છુપાવી શકતી નથી. સુરજની દોશની છુપાવી ન શકાય, તેમ અંતરની ખુશી છુપાવી ન શકાય. વળી આવી અંતરની ખુશી જે પામે છે, તે બીજાની ખુશી પણ પામે છે. ખુશી એક ચેપી વસ્તુ છે. કેવળ ખાવા, પીવા અને માં કરવામાં ખુશી પેહા નથી થતી, ખાવામાં અને અવકાવવામાં સાચી ખુશી પેહા થાય છે.

ઇશ્વરની સાથે સોહો કરનારા કાવી જય છે. સાવસસ્તો સોહો છે આ! ખસ, મારો પરમેશ્વર છે એમ માની લીધું. પછી આગળ-પાછળ કોઈ માથાકૂટ નહીં. પછી બધી ચિંતા એના માથે. હન્દિયાદારીના સોદામાં તો કેટલી બધી જંજટ! ધન ગુમાવવાની લગલે ને પગલે ચિંતા. વળી લય તો સહા માથા પર જ્યૂમતો જ હોય! જ્યાં ‘મારુ’ મારુ’ છે, ત્યાં નિર્બિયતા કહી હોઈ જ ના શકે. સોનાને સોનુ-

સિદ્ધ થવા માટે અભિનપરીક્ષામાંથી પસાર થવું પડે છે. તો પ્રલુના સોદાગર અનવા માટે 'હું અને મારું' ને બાળવા પડશે.

વેપાર કરવો હોય તો ખચત પણ કરવી પડે. સંકલપ-શક્તિ, વાણીની શક્તિ, કર્મની શક્તિ, સમયની શક્તિ નિર્દર્થક વેડફાવી ના જોઈએ. ઈશ્વર સાથેના સોદામાં વિશ્વના તમામ જીવને કાંઈક કર્યાછો થવો જોઈએ. આ સોદામાં એ પણ વિચારવું જોઈએ કે હુનિયાની તમામ શક્તિઓનો ઉપયોગ કેવી રીતે થાય? સૌએ કાંઈક ને કાંઈક આપવાનું અને સૌએ કાંઈક ને કાંઈક મેળવવાનું. સૌને લાલ જ લાલ! સૌનું શુલ જ શુલ! લાલ અને શુલ-ઘોટ અને અશુલ જેવી ચીજ ઈશ્વરી સોદામાં હોઈ ના શકે.

હુનિયાહરીનાં માપતોલ અને આધ્યાત્મિક જીવનનાં માપતોલ જુહાં હોય છે. હુનિયાહરીમાં અક્ષલવાળાને મોટા કહેવામાં આવે છે, જ્યારે ઈશ્વરની હુનિયામાં દિલવાળાનું સ્થાન મોટું છે. એમાં ઈશ્વરને જાણી લેવાની અક્ષલ પર્યાપ્ત થઈ જય છે. બાકી દિલ જોઈએ, દિલની સર્કાઈ જોઈએ. સાઝદિલ આહમીની સેવા એણી હશે તો પણ તેની કિંમત અદ્દેરી છે. દિમાગના આધારે સેવાના ટગલા થયા હશે, પરંતુ હૃદયશુદ્ધિ નહીં હોય તો એ સેવાના ટગલામાં કાંઈ તેજ નહીં આવે. દિમાગી સેવાવાળાને કીર્તિ ખૂબ મળે, નામના ખૂબ થાય, જ્યારે દિલવાળા હુઅ કમાય છે. તેમને અંતરની આશ્રિષ મળે છે.

આજે ખાદ્ય જગતમાં સર્વ ત્ર તમોગુણી વાતાવરણ છે. તેમાંથી જતને સલામત રાખી જગતના પરિવર્તનનું કામ કરવાનું છે. એક વિશાળ કાર્ય સામે પડ્યું છે, તેને માટે ખાસ્તી તૈયારી જોઈએ. મુખ્ય ચીજ છે, માનસિક તૈયારી. આંતરિક સંકલપથળ હુશે તો ગમે તેવી વિપરીત સ્થિતિમાં પણ ટકી શકાશે.

સંગઠનનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. સાથીહારોમાં જો ઢીલાશ આવી ગઈ તો આપણુંમાં પણ આવી જાય છે. સાથીહારે જડપલેર આગળ વધી રહ્યા છે, તો આપણે પણ હેંશમાં આવી જઈએ છીએ. એટલે મુખ્ય ચીજ છે—લક્ષ્ય પ્રત્યે ધ્યાન. સંગઠનની તો મહદ્દ લેવાની છે. તેને સીડી બનાવીને આગળ વધવાનું છે. સંગઠનને જ લક્ષ્ય બનાવી હઠશું તો કયાંયના નહીં રહેવાય. એટલે ‘મારે આટલું’ કરવાનું જ છે’ તે લક્ષ્ય સામે રાખી, સંગઠનમાં બીજા સાથીએ પણ તેટલું કરવા પ્રેરાય તેવા પ્રયત્નો કરવાના છે. સંગઠિત શક્તિનું ભારે મોડું મૂલ્ય છે. સર્વેની શક્તિ લાગે તો એટમ બોખ્ય પણ એની પાસે જાંઝો પડી જાય, કારણું કે આ આત્મિક બોખ્ય છે.

સંગઠનમાં બધાના સંસ્કાર લિન્ન રહેવાના. પરંતુ એ વિવિધ સંસ્કારોને પચાવી જઈ તેમાંથી એકતા ડિલી કરવી એ જ છે સફેદતાની ચાવી. સેવાને જ ધર્મરસ્તમરણ બનાવી હો. યાદ અને સેવા અંને સાથે સાથે ચાલે. અંનેનું સંતુલન રહેવું જોઈએ.

## અધ્યાત્મિક કસરતો

આત્માનું મૂળ સ્વરૂપ શાંત સ્વરૂપ છે, મૌન સ્વરૂપ છે અનાદિ સ્વરૂપ મૌનનું, આદિ સ્વરૂપ શાખદનું. લદે શાખદેણી હુનિયામાં આવાગમન થાય, પરંતુ મૌનની સ્થિતિમાં જ કાયમી વસવાટ થાય તે જોવું જોઈએ. આધ્યાત્મિક વ્યાયામમાં આવા વ્યાયામ કરવાના હોય છે. ચારે તરફ ગમે તેટલો કોલાહલ હોય, તો પણ જે ક્ષણે ધંઢીએ તે ક્ષણે મૌનના મહામંહિરમાં પ્રવેશ કરી શકીએ તેવી ક્ષમતા મેળવી લેવી જોઈએ. શાંત વાતાવરણુમાં શાંત-સ્વસ્થ એસી શકીએ, તેમાં કોઈ નવી વાત નથી. અશાંતિની વચ્ચે શાંત એસી શકીએ તેવો અભ્યાસ કરવો જોઈએ. સંસ્કારોની ગમે તેવી લારે મોટી હુલચલ હોય, પરંતુ તેની વચ્ચે અચળ રહેવું તે સાધનાનો વિષય છે.

દેહ, દેહના સંખ્યા, દેહના સંસ્કારો, વૈભવ-ધર્મ-સંપર્દા, ચારે તરફનું વાતાવરણ-આ ખંડાંની વચ્ચે સમત્વ જળવવાનું છે. જેવા છતાં ય ન જોવાય, સાંભળવા છતાં ય ન સંભળાય, આવી જળકમળવત્ત નિલેંપવૃત્તિ કેળવવાનો અભ્યાસ કરવાનો છે.



## [ ૫ ] વિવિધ ઉત્સવોનું રહસ્ય

આનંદ, ઉલ્લાસ, ખુશી એ માનવજીવનના આકાશના અળહણતા સિતારા છે. સુખ અને હૃદાય, હાસ્ય અને આંસુ એ તો રાત-દિવસ જેવી અઠલ ચીજ છે. આ બધી પરિસ્થિતિમાં રહીને પણ માણુસને આનંદ, ઉલ્લાસ ગમે છે એટલે સમૂહજીવન જીવતાં માનવીઓએ તહેવારોનું આયોજન કર્યું : રોજરોજની ઘરમાળમાંથી, રોજિંદી ચાંપ્રિકતા-માંથી થોડા બહાર નીકળી સમસ્ત માનવસમૂહ સહિત્યારો આનંદોત્સવ ઊજવી શકે તે માટે વિવિધ ઝતુ અનુભાર વિવિધ દિવસોમાં વિવિધ ઉજવણી ગોડવી. રોજિંદી ઐતી, કામધીયો, ઝતુ સુજબની કામગીરીમાંથી જ્યારે થોડી હળવાશ અનુભવાય ત્યારે આવા તહેવારોની ઉજવણી ગોડવી.

આ તહેવારોને ‘પર્વ’ પણ કહે છે. આનંદ, ઉલ્લાસ તો પર્વ ઉજવણીના પ્રયોજન છે જ, તહુપરાંત આ પર્વ-ઉજવણીનો એક બીજે સાંસ્કૃતિક ઉદેશ પણ છે. ‘પર્વ’ને ‘ઉત્સવ’ પણ કહે છે. આ બંને શાખોમાં ગહન સંકેતાર્થી પહ્યા છે. પર્વત પર જ્યારે ચઢીએ છીએ ત્યારે એક આરોહણ ચઢી ગયા પછી પર્વતારોહણનો અંત આવતો નથી. એક પર્વતની પાછળ બીજે પર્વત ઊલો હોય છે. આ વિવિધ શિખરોને ‘પર્વ’ કહેવાય છે. ગયે વર્ષે એક

પર્વ ઊજીયું, આ વર્ષે કોરી વાર એ ‘પર્વ’ આવ્યું, તો જૂનું ને જૂનું પર્વ ઊજીયા કરીએ તો તેમાં કઈ લલીવાર ન કહેવાય. આ વર્ષે થોડા આગળ વધીને પર્વની ઊજવણી કરવી જોઈએ. આ જ સંકેત ‘ઉત્સવ’ શાખદમાં પણ છે. આધ્યાત્મિક સાધનાના ધણા શાખદોમાં આ ‘અત્ર’ ઉપસર્ગ આવે છે. ‘અત્ર’ એટલે ઊંચું. ઉત્સવ ઊંચે ચઢવા માટે છે, આરોહણ કાને છે. નીચે ઊત્તરવા નહીં, પતન માટે નહિં, ઉત્થાન માટે ઉત્સવો નિર્માયા છે. એટલે જીવનમાં પ્રત્યેક ઉત્સવ ટાણે જીવનગિરીનાં પગથિયાં વધારે ને વધારે ચઢવાં જોઈએ. જ્યાં ને ત્યાં રહીએ તો પછી તહેવારે ઊજીયાનો કશો અર્થ જ નથી. બલે નાની સરળી એક ડગલી મંડાય, પરંતુ તે જીવનપથ પર આગળની પગલી હોય, પાછળની નહીં. આ દણિએ ઉત્સવોને જેવા જોઈએ..

આપણે કહીએ છીએ કે તહેવાર ઊજવવા. ઊજવવું એટલે અજવાળવું, ઊજજવળ થવું. જીવન ઊજજવળ કયારે થાય? ધસાઈને ઊજળા થવાય. તો ઉત્સવ દ્વારા આપણુંને ભીજી માટે ધસાવાની પ્રેરણું મળવી જોઈએ. હીવેં પણ ત્યારે જ અજવાળાં પાથરી શકે છે જ્યારે એ પોતાના વાટને સળગાવે છે, પોતાના તેલને ખાણે છે. અજવાળાં પાથરવા માટે આપણી ભીતરનું કશું સળગાવવું પડે છે, બાળવું પડે છે. આ બાળવું, સળગાવવું તેનું જ નામ છે તપ. ઉત્સવ આનંદ કાને ઊજવીએ, પરંતુ શુદ્ધ આનંદની પ્રાપ્તિ થાય છે, તપમાંથી.

આ દર્શિએ આપણા વિવિધ ઉત્સવોને જોઈશું તો પ્રત્યેક ઉત્સવમાંથી કાંઈક ને કાંઈક નવી પ્રેરણા, નવો સંહેશ પ્રાપ્ત થઈ શકે. વર્ષ દરમ્યાનના બધા ઉત્સવો આવા ઉદેશ-પૂર્વક ઉજવાયા હશે તો તે બધા પરોના મહારાજા સમાનુતન વર્ષની પ્રાપ્તિ થશે. દિવાળીનાં અંધારાં ઉલેચાશે તો જીવનમાં નૂતનતા પ્રગટ થશે. આ અંધારાં રાતોરાત ના ઉલેચાય. તે માટે વર્ષ દરમ્યાનનાં જેટલાં પણ પરો આવ્યાં હોય તે બધાંમાં જે—તે પર્વની સૂચક તપશ્ચર્યામાંથી શુજરવું જોઈએ.

### સંકાંતિ એટલે સંસ્કારોમાં કાન્તિ

મકર સંકાંતિના દિવસે તલ આવાનો રિવાજ છે. તલના લાડુનું દાન કરાય છે. તલ એટલે સાવ જીણું ચીજ. કોઈ ચીજ નાની હોય તો તે તલ જેવડી ગણણાય અને મોટી હોય તો પહાડ જેવડી ગણણાય. સાધનામાં તલ જેટલા જીણું બનવાનું છે. તલની સાથે જોળ લેળવીએ તો શક્તિ અને માધુર્ય એઉ મળે. મધુરતાના આધાર સાથે સંગઠનની શક્તિ ઉમેરવાની છે. જે કાંઈ નખળાઈ હોય તે છોડી હેવી, જીણું બનવું એટલે નિરાલિમાની બનવું અને મધુર બનવું. સંકાંતિ એટલે સંસ્કારોમાં કાંતિ લાવવાનો દિવસ, સંસ્કાર પરિવર્તનનો દિવસ. પુરાણાં મૂલ્યો, પુરાણાં સંસ્કારો છોડી ફર્જ નવા ચુગને ચોણ્ય નવાં મૂલ્ય, નવા સંસ્કાર જીવનમાં સિદ્ધ કરવા જોઈએ. સંસ્કારો બદલાય તો જીવનમાં સંકાંતિ અધ્યાત્મમ-૬

આવે, પરિવર્તન આવે. કેવળ ઋતુનું સંક્રમણ થાય તે પર્યાપ્ત નથી. સંસ્કારેનું સંક્રમણ પણ થવું જોઈએ. ચીલાચાદુ જીવનનાં ભૂલ્ય સાવ જુદાં હોય છે. ઈર્ષા, રાગ, દ્રેષ, સ્પર્ધા, વોલ, હિંસા વગેરે સર્વસામાન્ય હોય છે. પરંતુ સાચેસાચ જે સંકાંતિ જીજવવી હોય તો એમ, શાંતિ, સહયોગ, નિઃસ્વાર્થના ગુણો જીવનમાં વિકસાવવા જોઈએ. આપણે તહેવારો જીજવીએ છીએ, ત્યારે એના આદ્ય કર્મકાંડમાં રહી જઈએ છીએ. એના હાર્દને પકડતાં નથી. ઉત્તરાણનો દિવસ જીજવીએ, માત્ર તલના લાડુ વહેં-છીએ, પતંગ ઉડાડીએ. પરંતુ હૃદયમાં તો એવી ને એવી કટુતા લરી રાખીએ તો એ તહેવાર જીજવવાનો કાંઈ જ અર્થ નથી.

### હોળીનો તહેવાર

પવિત્ર બનવું હોય તો જન્મજન્માંતરની એક શૂંખલા જોઈએ. પવિત્રતાપ્રાપ્તિ એ અનેક જન્મોને જોડતી રેખા છે. દુનિયાના કોકો મહેનતપૂર્વક, સાધનાપૂર્વક પવિત્ર બને છે. પરંતુ જે પ્રભુના રંગે રંગાયેલ છે, તેમને પાવનતા વારસામાં મળે છે. એમને માટે હોળીનો તહેવાર જીવન બનાવવા માટે છે. અવિનાશી રંગ તેમને લાગ્યો છે, જે ધોઈ નાખવાની કોઈ જરૂર નથી. આ એનો પાકો રંગ છે જે ધીરેધીરે પ્રભુ સમાન બનાવી દઈ શકે. આપણે પિતા સમાન બનવા માટે હોળી રમવાની છે. જાનનો રંગ, આત્મસ્મુત્તિનો રંગ, શુણુનો રંગ, સર્વોત્તમ વૃત્તિ, લાવનાનો રંગ ચઢાવવાનો છે. હોળી જીજવવી એટલે હોલી (Holy-Pવિત્ર) થવું:

હોળીને દ્વિવસે આપણે હોળી પ્રગટાવીએ છીએ. આ હોળીમાં પુરાણા સંસ્કારો, વાસનાએ ચોગાળિમાં ભાગવાનાં છે. પછી પ્રત્યેક આત્મા સાથે મળવાનું છે. મીઠી વાણી એ જ મીઠાઈ. સામે કોઈ આસુરી સંસ્કારવાળી વ્યક્તિ હોય તો પણ તેની સાથે મીઠો વ્યવહાર જોઈએ. સંસારી લોકો હંમેશાં ફુઃખમાં હોય છે એટલે ઉત્સવો ઊજવી આનંદ મેળવે છે. પરંતુ સાધક તો સદ્ગુરુ, ખુશી-આનંદમાં હોય છે. એને મન ઉત્સવ-તહેવાર એટલે જીવનને બનાવવું. હોળીના જે કંઈ સંકેતાર્થી છે તેને અલિવા. હોલી એટલે હિન્દીમાં ‘હો લી’ જે કંઈ થવાનું હતું તે થઈ ગયું. ભૂતકાળ પરવારી ગયા. હવે અતીતમાં નહીં, ભવિષ્યમાં જીવવાનું છે. સાચી લગ્ન હોય તો માર્ગ નિષ્ઠાટક બની જય છે. વિધનો વિધન લાગતાં નથી. નવી હિંમત, નવો ઉત્સાહ આવે છે.

સામે હીપમાળા અળહળી રહી છે. વિશ્વની જ્યોતિ પ્રગટાવનાર હીપમાળા નિહાળી રહ્યા છે. કઈ હીપમાળા? જેના હૃદયનો હીવો પ્રગટી ગયો છે તેવા જગૃતાત્માઓની હીપમાળા તેઓ જોઈ રહ્યા છે. આ હીપમાળા એક વિચિત્ર હીપમાળા છે. તેની ત્રણ વિશેષતાએ છે.

એક તો, હીપમાળા એને કહેવાય જે નાનુક નાનુક હોય. માળાનાં મોતી ફૂર હોય તો માળા ન કહેવાય. તે એકસૂત્રે ગંઠાયેલી હોળી જોઈએ. તો સંમોપતા એ હીપમાળાની પહેલી વિશેષતા છે અને તેના મૂળમાં છે સ્નેહ.

સ્નેહ વગરના સામીધનો કશો અર્થ નથી. આ સ્નેહના આધારે જ હીવો અળહો છે. સ્નેહશૂન્યતા એટલે બુઝાપેદો હીવો.

એની બીજી વિશેષતા છે સંપન્તિના. દીપમાળા સંપન્તિનાની નિશાની છે. કેવળ પૈસો તે ધન નથી, લક્ષ્મી નથી. જગૃતા સાધક તે તો અણુમોલ ધન છે, જેના પરિણામે જીવન ધન્ય બને છે.

ત્રીજી વિશેષતા છે—સંપૂર્ણતા. સતત જગૃતિ દ્વારા સંપૂર્ણતાની મંજિલે પહોંચાય છે. હીવો અળહો છે, તો ચાત્રા ચાલુ છે. હીવો અખૂડ અખૂડ થાય તે ન ચાલે, તેની શાગ સીધી એકીધારે સળગતી રહેવી જોઈએ.

આવા વિશેષ હિન ઉત્સવના દિવસ તરીકે ઉજવાય છે. ઉત્સવો ઉજવવા માણુસને ગમે છે. મોટા દિવસે રજા પળાય છે. શેમાંથી રજ ? મહેનતમાંથી. સાધકની મહેનત કઈ ? પોતાની નથળાઈએ, વાસનાએ. સાથેનો સતત સંધર્ષ. તેમાંથી સુક્રિતા એટલે રજ. તેવી મહેનત ના રહી, રહી માત્ર મહેણાભત. જીવનનું ઠારણ—પ્રયોજન પ્રેમ અને જીવનનો ઉદેશ જ પ્રેમ. સાધકોની રજનો આરામ—વિરામ કેવો ? સાધકો માટે તો રામ એ જ આરામ—વિશ્રામ. આમ દિવાળી ઉજવવી એટલે પોતાની જતને ઘડવી, દિવાળી પહેલાં દશેરા ઉજવાય તો જ દિવાળી આવે. દશેરા એટલે વિજયોત્સવ. પોતાનો પોતાના પર વિજય. આ વિજયપ્રાપ્તિ પછી જ જીવનમાં અજવાળું ફેલાય.

ઇંટરેવ એટલે શું ? કોઈ એક શક્તિમાં વિશ્વાસ,

ભરોસો, તાકાત અનુભવાય તે છે ઈષ્ટદેવતા. પછી તે નામરંપે હોય કે અવ્યક્તારૂપે હોય. જેને ઈષ્ટદેવ પ્રાપ્ત છે તે અહીં-ત્યાં લટકતા નથી. એ એકાશ્ર હોય છે. આપણાથી જે પાછળ છે, તેમની શ્રદ્ધા આપણને પ્રાપ્ત થવી જોઈએ. તેમને માટે ઈષ્ટ બનવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. તે માટે આપણું જીવન પાથેયરૂપ બનવું જોઈએ. કેવળ લાખણ નહીં, પરંતુ પ્રત્યક્ષ જીવનમાં લાખણ પ્રતિલાસિત થવું જોઈએ.

### દીવડાએની હાર પ્રગટાવીએ

દીપાવલીમાં આપણે દીપમાળા પ્રગટાવીએ છીએ. તેમાં શું કરીએ છીએ? એક પ્રગટેલા દીવાની જ્યોતા વડે બીજા અનેક દીવડા પ્રગટાવીએ છીએ, તો અનેક દીવડા આ એક દીવા સાથે સંખ્યાંધિત છે. પરમતત્વની સાથે લગન એ દીપશીખા છે. એ શીખા હુશે તો જ દીવડા પ્રગટાવી શકાશે.

દીપક અનેક પ્રકારના વર્ણવાયા છે. એક તો સર્વ-સાધારણું દીવડો, બીજે છે આત્માનો દીપક, 'આત્મદીપો ભવ'-કહેવાયું છે; ત્રીજે છે 'કુળદીપક', ચાંદો છે આશાદીપ. આ ચારેય પ્રકારના દીપક પ્રગટે ત્યારે દીપમાળા પૂરી પ્રગટાવી કહેવાય. એવું એક પણ કાર્ય આપણે હાથે ન થાય, જેથી સાચી કુલપરંપરા તૂટે. આપણા પૂર્વજોએ આપણામાં જે આશા રાખી, તે આશાનો લંગ થાય તેવું કૃત્ય ન થવું જોઈએ.

### નવા વર્ષની લેટ

આ નવા વર્ષની લેટ છે. પરિવર્તનની શક્તિ એ નૂતન વર્ષની લેટ. નવા વર્ષના મુખારક તો સૌ કોઈ આપી જાય,

પણ ઉત્કટ પુરુષાર્થની પ્રેરણા સૂક્ષ્મમાંથી મળે એ જ સાચી લેટ છે. આ પુરુષાર્થને પરિણામે વિશ્વતું પરિવર્તન શક્ય અનશે. પુરાણા, વાસી પડી ગયેલા, જર્જર થઈ ગયેલા સંસ્કારોને, ભૂલ્યોને વિહાય અને નવાં ભૂલ્ય, નવા સંસ્કાર, નવી પ્રેરણા, નવા ઉમંગ ઉત્સાહ, નવા સંકલ્પને સુસ્વાગતમ् ! સર્વને મુક્તિ આપો શકે તેવા પુરુષાર્થના શ્રેષ્ઠ સંકલ્પને આવકાર અને મુખારકખાહી !

સ્વદેશ અને વિદેશ આ ખંને વચ્ચે નજીકનો સંખંધ છે. વિજ્ઞાનયુગમાં વિશ્વ નાતું અની ગયું છે. વિશ્વના નાના નાના ટાપુ હવે ફરવા જીવાનાં સ્થળ અની જશે. આપણે વિશ્વના અન્ય રાન્ય પાસેથી કાંઈક લેવું પડશે અને તેમને કાંઈક આપવું પણ પડશે. વિશ્વ પાસેથી ખિસ્તને લઈશું અને કૃષ્ણને આપીશું. પશ્ચિમમાં છે સાયન્સની સત્તા, આપણી પાસે છે સાયન્સની સત્તા. વિજ્ઞાન અને અધ્યાત્મમની શક્તિને જોડીશું.

આમ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પરિવર્તન થશે, ત્યારે વિશ્વ પલટાશે. નવું વર્ષ સોનેરી વર્ષ ત્યારે જ અની શકે જયારે અસંભવ લેખાતા પરિવર્તનને સિદ્ધ કરવા માટે પુરુષાર્થી, મરજીવા સાધક કટિખાદ થાય. આવા પ્રયત્નશીલ પુરુષાર્થીઓને અભ્યક્તમાંથી આશીર્વાહ અને પ્રેરણા મળ્યાં જ કરશે. નવું વર્ષ, નવા સંસ્કાર, નવે સ્વભાવ, નવે ઉમંગ, નવો ઉત્સાહ પેહા થાય, નવું વિશ્વ રચવાનો શુભ સંકલ્પ જાગે ! પુરાણાને વિહાય, નૂતનતાતું સ્વાગત !

આવા પરિવર્તનના કાર્યમાં લાગેલા સૌ કોઈને યાદ,  
ખ્યાર અને નમસ્કાર !

આપણે નવી હુનિયાની નવી રચના કરવી છે. તે માટે  
પહેલાં આપણે નવા થવાનું છે. પુરાણું બધું સમાપ્ત, નવો  
જન્મ, નવી જિન્હગી. જીવન બદલવાનો અર્થ છે નવો  
સંકલ્પ, નવા સંસ્કાર, નવો સંબંધ. ધર્મ નવો અને કર્મ  
પણું નવાં. એકેક બાળતમાં નાવીન્યનો જન્મ થવો જોઈએ.  
નવો દેહ ધારણું કરીને પુરાણા સંસ્કાર કામ કર્યા કરે તેવું  
ન થવું જોઈએ. દેહ આહારણુનો, તો સંસ્કાર શરૂના ન  
ચાલે. અહિધાપડધા બંને સંસ્કાર હોય તે પણું ન ચાલે.  
મૂળભૂત પરિવર્તન થવું જોઈએ. ત્યારે નવા વરસની  
મુખારુકખાહી લઈ-ફર્જ શકાય.

નવા વરસે નવો ચોપડો શરૂ કરીએ છીએ. નવા  
ચોપડા પર સ્વસ્તિકનું ચિહ્ન કરી ગણેશજીને યાદ કરીએ  
છીએ. સ્વસ્તિક એટલે સ્વ અસ્તિત્વમાં સ્થિત હોવાનું સૂચન  
છે. ગણેશજી શાનના પ્રતિનિધિ છે, શાનસ્વર્દ્ધ બનીને  
સ્વસ્તિતિમાં સ્થિત થવું-આ છે નવા વર્ષનો શુલ સંકેત.

સંકલ્પ દદ હોવો જોઈએ. પાયામાં રેતી નાંખીએ તો  
મહાન મજબૂત ન થાય. આપણે મોટેલાગે પરચિંતન, પર-  
દર્શિના પ્રપંચમાં મળન રહીએ છીએ. એને બહલે સ્વહર્ષન  
કરવું જોઈએ. પોતાની જતને રોજેરોજ નવેસરથી તપાસતા  
રહી ઘડતા રહેવી જોઈએ. ધીરે ધીરે દેહની આસપાસ  
ગૂંથાયેલાં તત્વો ઘટતાં જઈ, ઉત્તરોત્તર વધુ ને વધુ અંતરમાં

સ્થિર થતાં જવાં જોઈએ. નવી હુનિયા બનાવવી હશે, તો નવાં મૂલ્યો જીવનમાં સાકાર કરવાં પડશે. હુનિયાને આપણે અંદરથી બદલવી છે. તો પહેલાં આપણે અંદરથી બદલાવું પડશે. આપણાં વિચાર, વાણી અને વર્તનમાં આપણે ક્યાં રૂઢિગત રીતે વિચારીએ છીએ, એલોએ છીએ અને વર્તીએ છીએ તેનું ધ્યાન રાખવું પડશે. આપણે જેટલા નવા થઈશું, તેટલા નવાં સ્પંદનોને ઓલી શકીશું, નવા વિચારોને આચારમાં મૂકી શકીશું.

### પરિપક્વ પરિવર્તન

પરિવર્તન એ સાધકજીવનની મુખ્ય ધરી છે. આ પરિવર્તનશીકૃતાની સાથે સાથે પરિપક્વતા પણ સધાવવી જોઈએ. નિશ્ચયભુદ્ધિપૂર્વક ઉત્તરોત્તર પરિપક્વતા આવવી જોઈએ. આચાર, વિચાર અને વાણી ત્રણેમાં એકવાક્યતા લાવવી હશે તો ચિત્તમાં પરિપક્વતા જોઈએ. કાચા માટલા પર કોતરણી ન કરાય, તે તૂટી જાય. એટલે દદ નિશ્ચય થવો જોઈએ. ધર્શનમાં વિશ્વાસ, જ્ઞાનમાં વિશ્વાસ અને પોતાની જાતમાં પણ વિશ્વાસ; આવો ત્રિવિધ વિશ્વાસ પ્રગટ થવો જોઈએ.

પરંતુ નિશ્ચયભુદ્ધિ હાલકડોલક થાય છે, તેનું કારણ છે પોતાના પરના કાખૂનો અલાવ. શું એલવું, શું ના એલવું, શું કરવું, શું ના કરવું, આ તમામ ચીને અંકુશમાં રહેવી જોઈએ. જેનાં વાણી, વિચાર અને વર્તન નિરંકુશ છે તે કહી દફનિશ્ચયી ઘની શકતો! નથી.

સર્વ પ્રકારે અંકુશ મેળવવા માટે પોતે થોડા હળવા અનવું પડે છે. વજનહાર બોલે માથા પર હોય ત્યારે સંતુલન રાખવું સુશકેલ થઈ પડે છે. પતંગને જાંચે ઉડાડવો હોય તો થોડી ઢીલ છોડવી પડે છે. તો આપણા પર અંકુશ લાવવો હોય તો અહુંને થોડા ઢીલો કરવો પડશે. અહું અક્કડ રહે તો કાણ્ણું પામવો સુશકેલ પડશે. પોતાની જતને શૂન્ય અનાવતાં આવડે તો અંકુશ આપોઆપ નિર્મિષું થાય.

આપણે પૂર્ણ વિરામના ચિહ્નન માટે શૂન્યના બિનનું પ્રસંગ કર્યું છે. એસ, આ પૂર્ણ વિરામનું બિનનું અની જરૂરી અને વાતને પૂરી કરી નાંખીએ. પછી કેાઈ પૂર્વ થહું નહીં, પૂર્વ સમરણ નહીં. વાત થઈ પૂરી આપણને અહૃપવિરામ, પ્રશ્નવિરામ, આશ્ર્ય કે ઉદ્ગારનાં ચિહ્નનો મૂકૃતાં આવડે છે, પરંતુ પૂર્ણ વિરામનું ચિહ્નનો મૂકૃતાં નથી આવડતું. જેવી રીતે કાગળ પર જન્યાં જે ચિહ્નનો મૂકૃતાં જરૂરી હોય તે મૂકીએ ત્યારે જ રચના પૂરી થઈ ગણ્યાય. એ રીતે જીવનના કાગળ પર પણ થથોચિત નિશાનીએ મૂકૃતા જરૂર છેલ્લે કયાંક પૂર્ણ વિરામ આવે ત્યારે જ રચના પૂરી થઈ ગણ્યાય, અને રચના પૂરી થાય ત્યારે જ પ્રવીણુતા પ્રાપ્ત થઈ ગણ્યાય.

આખરે તો આપણે આપણો અંતહીંવો પ્રગટાવવાનો છે. ઈશ્વરે દીવાની સધળી સામની અંદર મૂકી રાખી છે. દીવી, વાટ, તેલ અધું જ છે. માત્ર જાન વડે આપણી વાટ પ્રગટાવવાની છે અને આપણો દીવો પ્રગટે એટલે એ દીવા વડે બીજી દીવા પ્રગટાવવાના છે. આ અંતર-

ઉણશ કરા આપણું તેમ જ સમાજના જીવનમાં પથરાયેલા કાળાડીખાંગ અંધારાને ફૂર કરી પુનિત અજવાળાં પાથરવાનાં છે.

### પ્રતિક્ષણ નવું વર્ષ

નવું વર્ષ વર્ષે હહાડે નથી આવતું. જેની પ્રત્યેક પળ નવી છે, જેનો પ્રત્યેક સંકલપ નવો છે, પ્રત્યેક પુરુષાર્થ નવો છે તે સદા નવા વર્ષમાં જ જીવે છે. એની પ્રત્યેક ક્ષણમાં નવું વર્ષ ઉજવાય છે. અહીં નિત્યનૂતનતા છે. અહીં કશું વાસી નથી થતું. ચીલાચાલું નૂતન વર્ષાલિનંદનમાં તો બીજે દિવસે અલિનંદન વાસી પડી જાય છે. જ્યારે સેવા-કાર્યમાં પ્રભુ તરફથી મળતાં અલિનંદન સદા નૂતન હોય છે. આપણે નવચુગના ગ્રહણી છીએ. નવો ચુગ, નવો માનવ પેટા કરવો છે. તે માટે સ્વયંમાં નવીનતા આરાધવી પડશે. આપણે પુરાણા રહીને નવીનતાને સળ્લ ના શકીએ.

આ નવીનતા પોતાનામાં લાવવી હોય તો પ્રત્યેકમાં પરમાત્માને જેતાં શ્રીભવું પડશે—પ્રભુની અનંત કળા છે. બીજામાં પ્રભુ જેશો તો એ અનંત કળામાં એવા ઐવાઈ જવાશે કે રોજ નવદર્શાન, નવજીવન સિવાય બીજું કોઈ નહીં મળે. ગઈ કાલે જેથેલો માણુસ આજે ફરી જેવા જ ન મળે. નહીમાં જેમ નિત્યનૂતન પણું, તેમ માણુસ પણ નિત્યનૂતન.

### વિશાળતા માટે નિત્યનૂતનતા

શક્તિવાન, શુણવાન, સુંદરને તો સૌ પસંદ કરે, પરંતુ પરમાત્મા તો તમે જેવા છો તેવા તમને પસંદ કરે છે. જેમણે જીવનમાંથી આંશા ગુમાવી હીધી છે તેવા નિરાશ

લેકોમાં તે આશા, ઉત્સાહ અને પ્રેરણા સીંચે છે. પ્રલુની પસંદગી પામ્યા એટલે બધું પામી ગયા. હવે તો જે પામ્યા તે બીજાને પીરસવાનું છે. પૃથ્વી પર કોઈ પ્રલુપ્રસાહથી વંચિત ન રહી જાય.

તે માટે હૃદય અત્યંત વિશાળ અનાવવું પડશે. વિશાળતા ત્યારે આવે જ્યારે આપણા પ્રત્યેક કર્મમાં નિત્યનૂતનતા પ્રગટે. એકધારી સેવા એક જ પ્રકારે કર્યા કરવાને બદલે નિત્યસેવામાં નિત્યનૂતનતા પ્રગટ થવી જોઈએ. જેમની સેવા કરીએ તેમને લાગવું જોઈએ કે એ પ્રતિક્ષણ પ્રલુની વધુ ને વધુ નજીક પહોંચી રહ્યો છે. હૃદયમાં સતત શુલ્ભભાવના સેવવાથી ભલે ફૂરના સ્થાને પહોંચી ના શકીએ તો ય મહદ પહોંચાડી વિશાળ, વ્યાપક અની શકાય છે. મુખ્ય ચીજ છે વ્યાપકતા, વિશાળતા.

પૃથ્વી પરથી જાય, નિરાશા, આતંક ફર કરવાં છે. પ્રાણીમાત્રમાં ઝુશી અને આશાની લહેર દોડવી જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે ક્ષલાણા માણસ તો ખૂબ કઠણ છે. એનું પરિવર્તન કઢિન છે. પુરુષાર્થ, સ્નેહ હુનિયામાં અશક્યને શક્ય અનાવે છે. તમે પોતે બદલાયા તો હુનિયા શું કામ નહીં બદલાય? શુલ્ભ ભાવનાનું હંમેશાં શ્રેષ્ઠ ક્ષળ જ આવે છે, વિશ્વાસ રાખવાથી હંમેશાં સારાં ક્ષળ જ મળે છે. આપણે આપણી જાત પર ભરોસો મૂકી પરથરમાંથી હીરા અની જવા માટે સાધના કરીએ છીએ, તો હુનિયાની કોઈ પણ વ્યક્તિ શા માટે બદલાઈ ના શકે? એ વ્યક્તિની

ભીતર પડેલી આંતરશક્તિ પર આપણો ભરોસો જોઈએ. પછી જ તે વ્યક્તિનો આત્મવિદ્યાસ જગાડી શકાશે. સુખ્ય વાત છે આત્મવિદ્યાસ. વ્યક્તિમાં એક વાર અંતરનો ભરોસો જાગી જાડે છે, પછી કુંગરા ઓટલા બની જય છે.

શરૂઆતમાં ભલે આપણે અનુકૂળ વ્યક્તિએને સન્માર્ગે લાવવા માટે મથીએ, પરંતુ પછી હંમેશાં અનુકૂળ વ્યક્તિ-એની જ વાટ જોઈને બેસી ના રહેવાય. જે કોઈ સન્મુખ હોય, સરળ હોય કે કઠણું, સાચી વાત તેને સમજાવવી. એક વાર નહીં; અનેક વાર. કેવળ શાખદોષી નહીં; આપણા જીવનથી. તો જરૂર આપણા જીવનમાં જિગેલી શાંતિ અને પ્રસન્નતાનું તેને આકર્ષણું થશે.

હંમેશાં સહનશક્તિ અને ખીલને પોતાનામાં સમાવી લેવાની વૃત્તિ સરળતા અપાવશે. એક બાજુ ઈશ્વરની આંગળી પછીને ચાલવામાં મદદ મેળવવાની છે, અને બીજી તરફ લોકોની આંગળી પછી તેમને ચાલવવાના છે.

### સુવર્ણાત્સવ માટે સોના જેવી શુદ્ધતા

નવા વર્ષ ની શરૂઆત ત્યારે જ થાય, જ્યારે જૂનું ખાતું જોઈ જમા-ઉધાર સમળું લેવાય. આપણે સુવર્ણ મહોત્સવ જીજવવા માગીએ છીએ, પરંતુ સુવર્ણમય વર્ષ તો ત્યારે થાય, જ્યારે આપણી પ્રત્યેક કૃતિ, પ્રત્યેક સેવા સુવર્ણમય બને એ સેવામાં જરા પણ પુરાણા સંસ્કારોની લેણસેળ ના હોય. નહીંતર ગીલેટવણું સોનું બની જશે. અંહરથી ઈર્ધ્યા, અભિમાન ગયાં ન હોય તો સેવા શુદ્ધ સુવર્ણમયી ન બની

શકે. સ્વ-પરિવર્તન એ પાયાની ચીજ છે. મુખ્ય વાત છે પોતાનો પોતાના પર અધિકાર. આપણો અધિકાર થીન પર ચલાવવા માગીએ છીએ. પણ આપણું પોતાના પર આપણું ઇન્દ્રિયોનો, ઇચ્છાઓનો અધિકાર ચાલે છે. ઇન્દ્રિયો તો આપણું પ્રણ છે. આપણે સ્વરાજ્ય સ્થાપિત કરવું હોય તો આપણું તમામેતમામ ઇન્દ્રિયો પર આપણું રાજ્ય ચાલવું જોઈએ. તો જ કોઈ સમસ્યા જિલ્લી થાય તો આપણે સમાધાન સ્વરૂપે ખડા રહી શકીએ. નહીંતર આપણે પોતે જ સમસ્યા અની જઈ સમસ્યાને એવડાંયા સિવાય વિશેષ કાંઈ ન કરી શકીએ. આ રીતે જ સુવણ્ણમહેત્સવ જિજીવી શકાય.



## [ ૬ ] મંગળ વિશ્વની રચના

આપણે વિશ્વ પર રાજ્ય કરવું છે, પરંતુ આ રાજ્ય કોઈ ચીલાચાલુ સત્તા હાથમાં ધારણ કરીને રાજ્ય કરવું નથી. આપણી સત્તા જેહુકમીની સત્તા, આપખુહીની સત્તા, સત્તાવવાની સત્તા કે દાહાગીરીની સત્તા નહીં હોય. આપણી સત્તા તો વિશ્વકલ્યાણુની જઘનામાંથી જરેલી આખા હશે. જે હૃદયમાં વિશ્વકલ્યાણુની લાવનાનો હીપઠ જળહળતો હોય, તે હૃદયની આણ આપોઆપ ખીજ પર ચાલે. જેટલી વિશ્વકલ્યાણુની લાવના વધુ પ્રખળ, તેટલી વિશ્વ પર રાજ્ય કરવાની સત્તા આપોઆપ ઉત્તરોત્તર વધુ ને વધુ આવી મળે. હકીકતમાં રાજ્યનો અર્થ થાય છે જળહળવું, પ્રકાશવું. જેના હૃદયમાં વિશ્વકલ્યાણુનો સૂરજ જોગે છે, તેના પ્રકાશથી વિશ્વ જળહળે છે.

આ વિશ્વકલ્યાણુની લાવના અને એના પરિણામે પ્રાપ્ત થતી વિશ્વરાજ્યની સત્તા બંને કેવી રીતે પ્રાપ્ત થાય? તે માટે પોતાનામાં પરિવર્તન કરવું પડશે. પ્રાતઃકાળની અમૃત વેળાથી માંડીને રાત સુધીની એક અખંડિત સાધના સાધવી પડશે. અત્યારના આપણા ચીલાચાલુ રોજિંદા જીવનમાં પરિવર્તન આણવું પડશે.

સકળજન સાથે જેવાનો સંખંધ  
પહેલું પરિવર્તન છે, પોતાના પ્રત્યે જેવાના અકિંગમમાં.  
પોતાને જેવાની નજર અહલવી પડશે. સવારના પહોરમાં જ

આંખ ખૂલતાં હૃદયમાં સંકલ્પ જાગવો જોઈએ કે હું એટલે આ શરીર નથી, પણ આત્મા છું. આપણા આ માનવહેઠની ભીતર એઠેલા આત્માને એની કણ પ્રગટ કરવાનો વધારે ને વધારે મોકો તો જ મળે, જે આપણું ચિત્ત પોતાના આત્મમય વ્યક્તિત્વ તરફ વધારે હેઠલું હોય. મનુષ્યની માનવતા પ્રગટાવવાનો આ આહિ સંકલ્પ છે અને તે આહિકાળમાં જાડવો જોઈએ. રૈન્જેરેજનો આહિકાળ પ્રાતઃકાળ છે. સૂરજ જાગતાં પહેલાનું ટાણું તે આખા હિવસમાં સૌથી વધારે અમૃતવેળા છે. અને આપણે ત્યાં પ્રાણમુહૂર્ત કહે છે, કારણું કે એ વેળામાં કોઈ પણ પ્રયાસ કર્યા વગર અંતરમાંથી હૃદય પ્રહૃતિ એટલે કે અત્યંત વ્યાપક વૃત્તિ અનુભવે છે. પ્રહૃતિ એટલે બૃહદ્દ. જે અત્યંત બૃહદ્દ છે તે છે પ્રહૃતિ. અને આવા પ્રહૃતની જે સાધના કરે છે તે છે પ્રાણણ. પ્રહૃતની સાધના માટે સૌથી વધારે અનુકૂળ સમય કાજળકાળી રાત્રિના ગર્ભમાંથી કૂટતા પરોદિયાનો પ્રાતઃકાળ છે. આ અંધકાર અને પ્રકાશના સંધિકાળમાં આપણા મૂળ સ્વરૂપ અંગેની ઓળખાણમાં કશી કચાશ ન રહી જવી જોઈએ. કારણું કે આપણી યાત્રાનું આ પ્રથમ આરંભ બિનહુ છે. કોઈ પણ રૈખા દોરવી હોય તો તેનો પ્રારંભ પ્રથમ બિનહુથી થાય છે. તો આપણી કલ્યાણયાત્રાનું પ્રથમ બિનહુ છે—આત્માની ઓળખાણ, સ્વરૂપનું લાન. હું કોણ છું, તેનો યથાર્થ જવાણ-સોહમ ।-

જીવનયાત્રાની રૈખાનું બીજું બિનહુ આવે છે—અન્ય સાથેનો સંબંધ. ‘હું’થી યાત્રા આરંભાય છે તે આગળ વધે

છે જ્યાં ‘તુ’ આવે છે, ‘તે આવે છે’, ‘એવો આવે છે’ અને એમ આગળ વધતાં વધતાં ‘સૌ’ આવે છે. આ જે મારા સિવાયની મારા બહારની જે કોઈ હસ્તિ છે, તેમનું પ્રચોજન મારા માટે શું છે? તેમના તરફ જેવાની મારી નજર કેવી હોવી જોઈએ? આ છે પરિવર્તનના આગળના સુકામ, જે ‘સર્વ’માં વિલીન થાય છે. માનવની યાત્રા ‘સ્વ’થી ‘વિશ્વ’ સુધીની દીર્ઘ યાત્રા છે.

મારી સાથે અનુભંગિત જે કાંઈ સચરાચર જગત છે, તે બધા પરમાત્માની પ્રતિકૃતિ છે. તે સૌમાં પરમત્વનું ચૈતન્ય વિલસે છે. અને મારા તેમની સાથેના સંખંધનું પ્રચોજન છે સેવા. તેમની પાસેથી મારે સેવા કેવી તેમ નહીં, તેમની સેવા મારે કરવી. એ માટે તેઓ મારા સંખંધમાં આવ્યા છે. મારા હૃદયમાં જે વિશ્વકર્માણુના રાજ્યની પતાકા ઝેરકાવવી હશે તો મારી ભૂમિકા સેવકની અને મારી સાથે જે કોઈ સંખંધમાં આવે તે સૌને ‘સેવ્ય’ માની અપનાવવા પડશે.

### સેવા પણ નિરપેક્ષ

આપણે ત્યાં ‘કર્ણાનુખંધ’ નામનો એક વિચાર ચાલે છે. કર્ણાનુખંધ એક જીવ બીજા જીવ સાથે સંપર્કમાં આવે છે. આ કર્ણાનુખંધના ત્રાસદ્યાઙ્ક પ્રભાવમાંથી સુક્ત થવું હોય તો સંખંધીના હેતુ તરીકે માત્ર ‘સેવા’ને અપનાવવી જોઈએ. તો કર્મી અંધાશો નહીં, કર્મમોચન થશે. સેવા સુક્ત કરશે. સંખંધીની જણ બાંધે નહીં, તે માટે સેવાનો સંખંધ હોય છે, પરંતુ એ સેવામાં પણ જે આસક્ત થઈ

ગયા તો તે પણ કર્મધન જિલ્લાં કરશે. પુષ્યકરોની પણ આસક્તિ હોય છે અને તે પણ જીવને ખાંધે છે. માટે સેવા નિરપેક્ષ હોવી જોઈએ, નિરાસકતા હોવી જોઈએ. સેવા ખાતર સેવા. ચિત્તમાં નિઃસ્પૃહતા જોઈએ, નિઃસંગતા જોઈએ. ચિત્તની આવી નિર્બેંધ અવસ્થા એ જ સાચો ત્યાગ છે, એ જ સાચી તપસ્યા છે. નિર્બેંધ સંખંધ તે જ સાચો અનુખંધ છે.

ચિત્તમાં આસક્તિ અંગેનો આવો ત્યાગસાવ નહીં હોય તો સેવાનો પણ એક લારે મોટો સંસાર, ધરાટોએ જિલ્લો થઈ જશે. કયારેક કયારેક તો સ્વાર્થના સંસાર કરતાં આવા પરમાર્થના સંસારની જરૂરિયાં વધારે ખાંધનારી, ગુંઘવનારી હોય છે. ઈશ્વરે શરીર આપ્યું છે, તો તેના નિર્વાહ માટે સેવા છે. પરંતુ આ નિર્વાહ કરતાં થ મોટું લક્ષ્ય છે આત્માનો નિર્વાહ. આત્માના નિર્વાહ માટે ચિત્તની નિઃસંગ, નિરાસકત, નિર્બેંધ વૃત્તિનું ટકી રહેવું ખૂબ જરૂરી છે.

### સાધન અને સાધના સામસામે

નેવી રીતે ચેતનવંતી વ્યક્તિએ સાથેના સંખંધમાં કેવળ સેવાસાવને પોષવાનો છે અને તે સેવાસાવ પણ નિરાસકત સેવાસાવ. એ જ રીતે સ્થૂળ નિર્જીવ ચીને સાથેના સંખંધની પણ એક ચોક્કસ પદ્ધતિ નક્કી કરવી પડશે. ચીજવસ્તુએ તથા વૈલવવિલાસ પ્રત્યે અનાસકત રહેણી, તેની લાલસા ચિત્તમાં જિડવા ન હો તો એ ચીને તમારી દાસી ખનીને તમારી સાથે નોડાશે. એ ચીને માટે ચિત્તમાં જે લાલસાનો ભાવ જાગશે તો એ ચીને તમારી માલિક ખનીને ચુંખકની જેમ અધ્યાત્મ-૭

તમને એંચ્યા કરશો. આ એંચાણુ એટલું બધું હર્દિ વાર અને અટલ હશો કે તમારી તમામ શક્તિ એ ચીજવૈભવને પ્રાપ્ત કરવા પાછળ ખર્ચાઈ રહ્યો. એટલે આ સ્થળ સાધનોને તમારે વશ રાખો. તે માટે તેના પ્રત્યે નિઃસ્પૃહ રહો. સાધન અને સાધના પરસ્પર વિરોધી બાબત છે. સાધના માટેની લાલસા, વાસના સાધનાને સ્થિર નહીં થવા હે, તમને તમારી મૂળ ભૂમિકામાં નહીં રહેવા હે. તે સતત તમને એંચતી રહેશો. સાધન માટેની લાલસા વિનાશ તરફ લઈ જનાર ચીજ છે, જ્યારે આપણી સાધના અવિનાશી તત્ત્વને પ્રાપ્ત કરવા માટે છે. વિનાશી સાધનના આધાર પર અવિનાશી સાધના થઈ ના શકે. સાધન તો નિમિત્તમાત્ર છે, જ્યારે સાધના તો નિર્માણનો આધાર છે. બાધ્ય સાધન સાથે જીવ એકાકાર થઈ જાય છે, એકરૂપ થઈ જાય છે ત્યારે જીવનું સિદ્ધ સ્વરૂપ અંખું પડી જાય છે, આપણું મૂળ સ્વરૂપ સિદ્ધનું છે, સાધનનું નથી. સાધકાવસ્થામાંથી આગળ વધતાં વધતાં છેવટે સિદ્ધ થવાનું છે.

આપણી પાસે કાંઈ હોય તેના કરતાં આપણે પરિપૂર્ણપણે હોઈએ તે અત્યંત મહત્વનું છે. આપણે પામવાનું નથી, આપણે ‘હોવા’ની સ્થિતિમાં સ્થિર થવાનું છે. એટલે આપણી બહાર જે કાંઈ છે તેને મેળવવા પાછળની આંધળી હોટો, લોલૂપતા, લાલસાવૃત્તિને શમાવી હેવી પડશે.

### શ્રવણને સામે પાર-મૌન

એક અવસ્થા સાંલળવાની, શ્રવણની હોય છે. પરંતુ આ અવસ્થાથી ઉપરની એક બીજી અવસ્થા છે, તે શ્રવણને

પેલે પારની મૌનની અવસ્થા છે. આપણે જે રીતે અનાયાસ પળમાત્રમાં બહારના કોઈ પણ અવાજમાં પ્રવેશ કરીએ છીએ એ જ રીતે ક્ષણમાત્રમાં અવાજમાંથી બહાર નીકળી જતાં પણ આવડવું જોઈએ. એક ધ્યાસમાં અવાજની લીતર, બીજી ધ્યાસે કે ઉચ્છવાસે અવાજમાંથી બહાર, આવી સ્થિતિ જ્યારે આવી જાય ત્યારે સંપૂર્ણતા સધારો. કયારેક સાગરની લહેરો પર, તો કયારેક તળિયે, આમ પળભરના ઐલ ઐલતા થવું પડશે.

સંપૂર્ણતા સધાય પછી વધારે પુરુષાર્થ નહીં કરવો પડે. પછી બધું સહજ, સરળ થશે. સફળતા સહેને આવી મળશે. આજે સાધકાવસ્થામાં સફળતા માટે જૂઝવું પડે છે.

અભ્યક્ત જગતમાં અવાજ નથી, વાણી નથી, એલી કે લાખા નથી, એઠેલે જેમણે અભ્યક્તની સાધના કરી હશે તે સામેની વ્યક્તિને વગર એલે સમજ જશે. પરસ્પર મૌનની આ લાખા વધારે તાકતવર હશે પરંતુ પરસ્પરના આ મૌન નીરવ સંવાદ માટે બુદ્ધિની સ્પષ્ટતા જોઈએ. જીવનમાં અતૂટ શ્રદ્ધા, અટલ મનોભળ અને અથાક પરિશ્રમ હશે તો બુદ્ધિમાં સ્પષ્ટતા અને નિઃસંશયતા આવશે. સાથેસાથ લવિષ્યકાળનું પણ દર્શન થશે. જેવી રીતે નજર સામે વર્તમાનકાળ સ્પષ્ટપણે સુરેખ હેખાય છે, એ જ રીતે લવિષ્યકાળનું પણ દર્શન થશે. જેવી રીતે સૂરજ જિગે છે તો તમામ ચીજ સાઁકે સાઁકે હેખાઈ આવે છે, એ જ રીતે જીનનો સૂરજ જિગે છે ત્યારે માયાનો અંધકાર સમેટાઈ જાય છે અને બધું સાઁકે વર્તાય છે.

## પોતે જ પોતાના ઘડવૈયા

લેવાનું છે અભ્યક્ત જગત અને એને જેઈને પછી કહેવાનું છે એને આપણી રોજિં હી વ્યક્ત ભાષામાં આપણે આપણી જતને સહા તપાસ્યા કરવાની છે. જેટલી જતને તપાસીશું એટલી આપણે આપણી જતને બનાવી શકીશું આપણે નિરીક્ષક-પરીક્ષક પણ બનવાનું છે અને નિર્માતા પણ બનવાનું છે.

આજે સર્વત્ર બ્રહ્માચાર અને લેળસેળ ચાલે છે. આપણી અંદર પણ જે કાંઈ બ્રહ્માચાર અને લેળસેળ હોય હેને તપાસી લેવાનાં છે. એ સુધારી લીધા પછી સમાજના બ્રહ્માચાર મિટાવવા માટે આગળ આવવાનું છે. આ રીતે પોતાની નિર્મિતી થશે. જે પોતાની જતને ઘડે છે તેના પર કોઈ ખીજું શાસન નથી કરી શકતું. એ પોતે જ પોતાનો શાસક છે. સ્વયં અધિકારી બની ગયા પછી એના પર કોણું અધિકાર ચલાવી શકે? રાજનો તે વળી કોણું રાજ હોય? એ સ્વાધીન છે. એ ધનિદ્રયોનો પણ શુલામ નથી. સ્વાધીન હોવાને લીધે તેનું ચિત્ત પણ ઉદાર હોય છે. ઉદારચિત્ત હોવાને લીધે તે બીજા માટે ઉદાહરણુરૂપ અને છે અને બીજા અનેક લોકોનો તે ઉદ્ધાર પણ કરી શકે છે.

## પ્રમાણાં વિવિધ સ્વરૂપ

આપણી અંદર માયા ક્યા સ્વરૂપે દ્વારા થાય છે? પહેલાં તો આપણનાં વિવિધ રૂપ ધારણ કરીને આવે છે. દેહાલિમાન પણ પછી આવે છે, પહેલાં તો આપણા જ

પ્રવેશ કરે છે. તે આવે છે એ જોવાની પણ વૃત્તિ નથી થતી, એટલી હુદે આપસ પ્રવર્તે છે. આપસને લીધે સુસ્તી, ઉદાસીનતા વગેરે આવે છે અને પછી બુદ્ધિ પણ ખેડેર મારી જાય છે. એને લીધે હેઠળો અહંકાર માથું ભાંચકી પોતાનું વિકરણ સ્વરૂપ પ્રગટ કરતો જાય છે. સાત્ત્વિક ભાષ્ટોને આગળ ઉપર ડેલતા જવાની વૃત્તિ વધી જવાને લીધે સાવધાનીનો લંગ થાય છે, નિરંકુશતા વધતી જાય છે. આ સ્થળે તપાસતાં રહેવાની જરૂર છે.

પ્રવૃત્તિનો ઈન્કાર નથી. પ્રવૃત્તિ તો કરતાં જ રહેવાનું છે. પરંતુ પ્રવૃત્તિઓમાં રહેવા છતાં આંતરિક વૃત્તિઓને નિરંતર તપાસતા રહેવાનું છે અને ધીરે ધીરે વૈરાઘ્યવૃત્તિને, નિઃસ્પૃહતાને વધારતા જવાનું છે. આપણે આ બીજી વાત ભૂલી જઈએ છીએ. આ વિસ્તરણ તે પણ આપસનું જ એક રૂપ છે. સુસ્તી આવે છે તો તે કંઈ એક જ રૂપ ધારણ કરીને નથી આવતી. આપણા જીવનના મૂળ ઉદેશને ભૂલી જવાટવીમાં અટવાતા રહેવું તે પણ આપસનું જ એક લક્ષણ છે.

**આજ ! આજ ! ભાઈ, અત્યારે**

કેટલાક લોકો બીજાને ખૂબ આગળ વધેલા જોઈ હિસ્મત હારી એસી જાય છે. આ આપણા પ્રમાદનું જ એક સ્વરૂપ છે. આપણે તો નવી હુનિયા, નવો માણસ અનાવવાનો છે, તો પહેલાં પોતે જ નવા નહીં બનીએ તો બહાર નાવીન્ય કચાંથી પ્રગટાવીશું ? એટલે પહેલાં તો પોતાના પુરુષાર્થ માં તીવ્રતા અને પરિપણવતા આવવી જોઈએ. આપણું એક સૂત્ર છે-

‘હમણાં નહીં તો કહી નહીં’ એ સૂત્ર આપણા માટે પણ યાદ રાખવાનું છે.

આપણે આપણો આંતરિક વ્યાયામ હંમેશાં નિયમિત રાખવાનો છે. હીર્દ્દાષિ અને નિર્ણયશક્તિ વધે તે માટે કસરતની જરૂર છે. રોજેરોજ મહાવરો વધે તો આ બંને શક્તિ પ્રગટ થશે. બુદ્ધિ સ્થિર થશે તેટલી આપણી સેવા, પ્રવૃત્તિ મજબૂત પાયા પર ઉલ્લો થશે, સધન બનશે. આપણે સાત્ત્વિકતાના વાહક બનવું છે, તો આપણી લીતર સાત્ત્વિકતાનો હરિયો. ઉછળતો હશે તો બહાર તેને બિંદુ સ્વરૂપે પ્રગટાવી શકીશું.

### પ્રસારી સંકેલતાં પણ શીખવાનું છે

આપણે જીવનમાં પ્રતિક્ષણ વિકાસ કરવો છે. સુષ્ઠિ પરના કેવળ સ્થૂળ વ્યક્ત જગતને એડીને એસી રહેવું નથી. આપણે અભ્યક્ત જગતને પણ પામવું છે અને આપણી લીતર પડેલી અભ્યક્ત શક્તિઓને વધારવી છે. આપણે અભ્યક્ત જગત સાથેનો સંખ્યાધ ઉત્તરોત્તર વધતો જય, દિવસમાં આપણે વધારે ને વધારે અભ્યક્ત સાથે જોડાયેલા રહી શકીએ તે માટે અભ્યાસ કરવો પડશે, સાધના કરવી પડશે.

આપણું વિસ્તાર કરતાં તો આવડે છે, પરંતુ વિસ્તારને સમેટી કેતાં આવડતું નથી. પ્રવૃત્તિઓના, વિચારોના, પથારાએ પાથરી હેતાં આવડે છે, પણ જે ક્ષણે ચાહેં તે

ક્ષણે તેમને સંકેલી લેતાં આવડતું નથી. સાધનામાં આ ઐવડી પ્રક્રિયા ચલાવવાની છે. ચિંતન, મનન, સેવા, શાન વહેરે તમામ ખાખ્તોમાં ગમે તેટલો વિસ્તાર કરો, પરંતુ જ્યારે આ બધું સંકેલી લેવાનું હોય, સમેટી લેવાનું હોય ત્યારે તેને ક્ષણાર્ધમાં સમેટી લઈ શકાય તેવું થવું જોઈએ. શાનનો વિસ્તાર પામીને પછી છેવટે શાનસ્વરૂપ ખીજડું ધારણું કરતાં આવડવું જોઈએ.

આને માટે એક યુક્તિ છે. આજે મોટા મોટા લોકો પોતાની હિન્દુર્યા નક્કી કરે છે. કયા સમયે શું કરવું તે નક્કી હોવું જોઈએ. આ હિન્દુર્યા નક્કી કરતી વખતે આખા જગતથી નિઃસ્પૂદ ભની અવ્યક્ત સાથે અનુસંધાન કેળવવાનો સમય પણ ક્ષાળવવો જોઈએ. હિવસલરની તમામે તમામ પ્રવૃત્તિ જે સમયને આધારે ચાલતી થઈ જય તો અંતર મુક્તતા અનુભવે છે. જેવી રીતે પતંગને આકાશમાં મુક્તાપણે ઉડાડવો હોય તો હાથમાં એનો દોરો પકડી રાખીએ તો તે ઊરી શકે છે. જે એનો દોરો કયાંક પકડાયેલો, એંચાયેલો ન હોય તો તે હવાના જપાટા સાથે કયાંક ઝેંકાઈ જઈ શકે. આપણા હિવસોને પણ અનંત વિહાર કરાવવાનો છે, પણ તે સ્વર્ચંહ વિહાર નહિ, અનંતતા, અસીમતા લણી લઈ જતો સ્વર્ગીય વિહાર !

### માંગલ્યની આરાધના

ચિંતન સહા શુલ રહેવું જોઈએ. શુલચિંતન ઘનવાથી અનેક આત્માચ્છોની સેવા થઈ શકશે. અનેક વસ્થિત આત્મા-

એના આવા શુભ ચિંતન કરા આપણુને સૌને અણુધારી મહદ મળતી રહે છે. અવ્યક્ત સુષ્ટિમાં શરીર નથી એટલે મહદ પહોંચાડવામાં જરા પણ વાર લાગતી નથી.

આપણું પણ જ્યારે ધ્યાને ત્યારે તરત જ અશરીરી સુષ્ટિમાં જઈ શકીએ તેવી શક્તિ પ્રાપ્ત કરી લેવી જોઈએ. કામ માટે દેહમાં આવ્યા, પરંતુ જેવું કામ ખતમ થયું કે તરત જ પાછા વિદેહાવસ્થામાં પહોંચી ગયા, તેવું થયું જોઈએ. કપડાં પહેરતાં-કાઢતાં તો વાર લાગે, તેનાથી પણ એછા સમયમાં અશરીરી અવસ્થામાં પ્રવેશ થઈ જવો જોઈએ. ઇરજ પર હાજર થતી વેળાએ જે પોશાક પહેરવો પડે છે, તે કાઢી નાખીએ ત્યારે હળવાશ અનુભવાય છે, આવી જ હળવાશ અશરીરમાં પ્રવેશવાથી અનુભવાશો. ઇરજ સમયે સાવધાન, સાખા અને પછી સહજ, હળવા ફૂલ !

આમાં કોઈ આગળ પાછળ નથી. છેલ્લે આવનારનો પણ પુરુષાર્થ ઉત્કૃષ્ટ હુશે તો તે સાથે થઈ જશે. મુખ્ય વાત છે-દઠ સંકલ્પની. સંકલ્પની દશ્તા અને પછી ધીશ્વરમાં શ્રદ્ધા, આ એ વાત હુશે તો યાત્રા સુંદર ચાલશે. નખળાઈ કે અધ્યુર્પોનાં રૈહણું રોવાનાં નથી. નજર સામે ગુણુસાગર હુશે તો અવણું. આપોઆપ ઓગળતા જશે. હુર્ગુણું ચિંતન કરવાને બદલે આપણામાં જે કાંઈ શુણું હોય તેને વધારતા જઈએ. નિરંતર પૂર્ણ ગુણવાન વ્યક્તિનું ચિંતન-સમરણ હુશે તો તેનો ચેપ આપણુને પણ લાગશે. તહુપરાંત જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાંથી તેને અપનાવવાનો, આત્મ-

સાતુ કરવાનો પ્રયાસ કરવો પડશે. વૃત્તિને ગુણુચ્છાહી ખનાવી હેવાની. શુણુ જેચો નથી અને એને બ્રહ્મણ કર્યો નથી તેવી ચિત્તની દશા થઈ જવી જેઈચો.

### મરીને જીવવાની કણા

આપણુને શૌખવવામાં આવે છે કે મરજીવા બનો. મરજીવા એટલે શું? મરો અને પછી જીવવાનું શરૂ કરો. કેઈ મરી જય છે ત્યારે તેના તે જીવનના સંસ્કાર પૂરા થાય છે. પછી નવો જન્મ અને નવા સંસ્કાર. તો આપણે પણ એક જ જન્મમાં પુનરાવત્તાર પામવાનો છે, દ્વિજ બનવાનું છે. મરીને પાછા ફરી જન્મવાનું છે. માટે પુરાણા સંસ્કારોને સહંતર તિલાંજલિ આપી હેવાય તો જ મરજીવા બની શકાય. મરી જવું એટલે શું? આપણી ભીતર ઈચ્છાઓનો, વાસનાઓનો કે દર્શિયો ધૂધવે છે તેને શમાવી હેવો. તેનું નામ છે મૃત્યુ. વાસનામુક્ત એવી એક પળ પણ અનુભવવા મળે તો જીવનનો, ચૈતન્યનો મહાસાગર અનુભવાય છે. આ જ છે જીવન, આ જ છે ચૈતન્યાનુભૂતિ. આ અનુભૂતિ મેળવવા માટે આપણુને માનવજીવન મળ્યું છે. એ અનુભૂતિનો આપણુને સ્પર્શ જ ન થાય અને કેવળ ઈચ્છાઓના દર્શિયામાં ગુંગળાતા રહીએ તો તે માનવજીવન પ્રત્યેનો અપરાધ ગણુશો.

### વિવેકખુદ્ધિને જીવનનું સુકાન સોંપાય

માનવના જીવનની દિશાસૂચક શક્તિ છે. તેની વિવેકખુદ્ધિ. વિવેકખુદ્ધિ તે માનવની આંખ છે. આપણી પારખવાની, સાચુંખોટું નક્કી કરવાની વિવેકખુદ્ધિ ઉત્તરોત્તર

વધતી જવી જેઈએ. કહેવાય છે કે હંસમાં નીરક્ષીરવિવેક હોય છે, એટલે કે હૃદ અને પાણીને તે જુદાં તારવી શકે છે. આપણે ત્યાં સિદ્ધ વ્યક્તિને પરમહંસ કહેવાય છે, એટલે કે આ જગતમાં નિત્ય-અનિત્ય, સત્ય-અસત્ય વચ્ચેનો વિવેક સહા જાગૃત હોય છે. આ વિવેકખુદ્દિ જાગૃત થઈ જાય, પછી સંસારમાં લટકવાનું, રઘળવાનું ખાસ રહેતું નથી. સહુ-અસહુ વચ્ચેનો તરફાવત પરખાઈ જાય, અસહુ માટે વેરાજ્યભાવ અને સહુ માટેનું આકર્ષણું જીવનમાં સ્થિર થઈ જાય તો જીવનનૌકા સરસરાઈ ચાલી જાય છે અને મંજિલે પહોંચે છે. આ વિવેકખુદ્દિ પ્રાપ્ત કરવા માટે સંતોનું સાંનિધ્ય, સહુથીનો સ્વાધ્યાય, સત્કર્મોની પરંપરા ઉપયોગી થાય છે. આવી જાગૃત વિવેકખુદ્દિને જીવન સોંપી દેવાથી નિશ્ચિન્ત યાત્રા શરૂ થને છે.

### વૈવિધ્યમાં એકતા

જીવનમાં સર્વત્ર લિન્નતા દેખાય છે, પરંતુ આ લિન્નતાની ભીતર છુપાયેલી એકતાને પ્રગટ કરવાની છે. વૈવિધ્ય તે તો આ જગતનું સૌંદર્ય છે, પરંતુ આ વૈવિધ્યની ભીતર છુપાયેલું સમાનત્વ પ્રાપ્ત થાય છે ત્યારે જીવનનું પાવિન્ય પ્રગટ થાય છે. ખાદ્ય રીતે બધું લિન્ન, પરંતુ અંદર એક સમાન પ્રાણુરસ, આત્મરસ, સૌ તત્ત્વોમાં વિલસે છે. નરી આંખે હંમેશાં બધું જુહું જ દેખાવાનું. જુહું ન હોય તો પછી જન્મ શા માટે? ઈશ્વરની સુષ્ઠિમાં કશું એક-સરખું નથી. નખશીખ સાવ સમાન માણસ બીજે ગોત્યો.

ના મળે. પરંતુ બહારથી જુહા દેખાતા વિવિધ જીવો, માનવો, વૃક્ષો સૌ કોઈની અંદર રહેલું આત્મતત્ત્વ એક છે તે જીવા માટે અંદરની આંખ કૂટવી જોઈએ. આવાં આંતરચક્ષુ તો જ કૂટે જે પરમ તત્ત્વ સાથેનું અનુસંધાન સિદ્ધ થાય. બીજા સાથે અનુભવાતું તાહાતમ્ય પરમેશ્વર લણી લઈ જાય, અને પરમેશ્વર તરફની ગતિ અન્યમાં તાહાતમ્યનો અનુભવ કરાવશે.

### નિરહંકારી, અધિકારશૂન્ય પરોપકાર

સામેની વ્યક્તિ ગમે તેટલો અપકાર કરે, ઉપકાર એ જ જીવનધર્મ. ઉપકારી અને તો ય નિરહંકારી. ઉપકાર કરવાથી અધિકાર પ્રાપ્ત થાય છે, પરંતુ તે અધિકાર તો જ ધૂટે છે, જે નિરહંકાર સધાય છે. આપણે કર્તવ્યપ્રધાન જીવન જીવવાનું છે, તેમાં અધિકાર તો ગૌણ છે. અધિકાર આપોઆપ આવી મળે છે. સુખ્ય ચીજ છે, કર્તવ્ય ધરમાં મા કર્તવ્યની મૂર્તિ હોય છે, તે સૌ પ્રત્યે પોતાની ફરજ અહા કર્યા કરે છે, તો તેની આણ સૌ પર ચાલે છે. પોતાના અધિકાર માટે તેને સંધર્ષ કરવો પડતો નથી. જીવન ઉદાત તો જ અને છે, જે તે બીજા માટે જીવાય છે. પરોપકાર કર્યા છતાં મનમાં અલિમાન ન આવે એવી સ્વાલાવિક સ્થિતિ થઈ જવી જોઈએ. સૂર્ય પ્રકાશ આપે છે, વૃક્ષ ફળ આપે છે, નહીં પાણી આપે છે, પણ તેમના આ પરોપકારોનું કોઈ પ્રગટ ઇય દેખાય છે? એમને માટે આ પરોપકાર એ જ સહજ જીવન છે. આ રીતે પરોપકાર જીવનમાં શાસોધ્યાસની જેમ વણુાઈ જવો જોઈએ.

### માનવનો પ્રલાવ . અહો-નક્ષત્રો પર

આપણે પૃથ્વીનિવાસી ઉપરના આકાશના ચંદ્રવામાં ભાતભાતના તારલા ટમટમતા લોઈએ છીએ. જેવી રીતે આકાશ તારમંડિત છે, એ જ રીતે આ પૃથ્વી પર એક એક ચંદ્રવો છે, અને એમાં ભાતભાતના સિતારા ચમકે છે. વિવિધ મનુષ્ય એ એક એક તારલો છે. પ્રત્યેકનો આગવો પ્રકાશ છે. અહોં કોઈ તારલો યોગી તારલિયેં છે, તો કોઈ જાની, તો વળી કોઈ સ્નેહી, કોઈ નિરંતર સેવાધારી તો કોઈ વળી અપેક્ષા-આકંક્ષાઓથી ભરેવો. આ તમામ તારાઓનો સારો-ખૂરો પ્રલાવ પ્રકૃતિ પર પડે છે. એવું માનવને કોઈ કારણ નથી કે નક્ષત્ર-અહોની અસર માણુસ પર પડે છે, અને માણુસની એમના પર કોઈ અસર નથી. અહ્યાંદનાં તમામ સૃષ્ટિતરવેની એકખીન પર અસર પડે છે. સારપ અને બુરાઈ બંને ચીજ વાયુમંડળ બીલે છે. વાયુ-મંડળમાં અમૃતતત્ત્વ વધારવું હોય તો પૃથ્વી પર સારપ વધારવી જરૂરી છે, જે બુરાઈની જ હવા સર્વત્ર વહેતી રહેતો હોય. ચોમેસના વાતાવરણમાં તેનો જ પ્રલાવ જિલાશો.

પરંતુ તારક આખરે તારક છે. કાળજીકાળા અંધકારમાં તારલિયાનું તેજ નિરાણનું હોય છે, અનુપમ હોય છે. આ જ રીતે લલેને પૃથ્વી પર ચારે તરફ ઘોર અંધારું ઝેલાયું હોય. એમાં ટિમટિમાતા તારલાનું તેજસૌદ્દર્ય છૂપું નથી રહેતું. લલે નાનકડું ટપકું, પણ છીએ જ્યોતિર્ભિન્દુ, પ્રકાશના પ્રયગંખર !

### સેવાની જરૂર ન પડે તેવી સેવા

આ પ્રકાશ કયાંથી પ્રગટે છે? સેવાભાવમાંથી. સેવાભાવનું મૂળ શું છે? પ્રત્યેક જીવ પ્રત્યે શુભ લાવના. સૌનું ભલુ થાય તેવીં ઉત્કટ ઝાંખના અને સાચું કલ્યાણ, સાચું ભલુ શેમાં છે તેની સ્પષ્ટતા પોતાનામાં જ હોય. તેઠલાથી સેવાભાવ નથી કેળવાતો. સામી વ્યક્તિને સાચા કલ્યાણની દર્શિ આપવી તે છે સેવાભાવ.

આવા સેવાભાવમાં તપસ્યા નિહિત જ છે. ત્યાગ, તપસ્યા અને સેવા મળીને જ એક પૂર્ણ ચીજ બને છે. ત્રણેય એકમેક વિના અધૂરાં છે. ત્યાગ અને તપશ્વર્યા વગરની સેવા અહૃપકાલીન હોય છે. તેનાં ક્રણ કાયમી ટક્કાં નથી. મુખ્ય સેવા તો પરમતત્વની સાથે સૌનું અનુસંધાન કરાવી આપવું તે છે. દરેક જણને સ્વાવલંખી બનાવી હેવા આપણે કાયમ સેવક રહીએ અને સામેની વ્યક્તિ સહા સેવ્ય રહે તે વાજખી નથી. તે સાચી સેવા નથી. સેવ્ય સેવકની ભૂમિકામાં આવે તે સાચી સેવા છે. સેવ્યાનો હુનિયામાં તોટો. નથી, તોટો. છે સેવકોનો.

અસંતોષી જીવ કહી બીજાની સેવા ન કરી શકે, એનાથી તો કુસેવા જ થાય, કારણ કે અસંતોષનું એ સંકમણુ કરશો, બીજાને ચેય લગાડશો. આવી સેવા ન કરવી તે સારું છે. એટલે પહેલાં તો પોતે સંતુષ્ટમણિ થવું. આવી સેવાનો એને કોઈના પર ચઢાવવો હીં નથી. એના

કરતાં તો એકાન્ત સાધના સારી. એનો બોલે તો કોઈના પર નહીં પડે. સેવા બોજ ઘરાડે, વધારે નહીં.

માનसિક સેવા પણ ભાગી સેવા છે, ત્યાગ અને નભ્રતાપૂર્વક એકાન્ત સેવન કરીને જગતનું હિત ઈચ્છાવું તે પણ એક પ્રકારની સેવા છે. જ્યાં સુધી જગતની કમનેરી-એને પચાવી જનારો સેવાભાવ પેહા ન થાય ત્યાં સુધી આવી એકાન્તિક સેવા વધારે સારી.

સાચ્ચા સેવાભાવ સામાની નિર્ભળતા પોતાનામાં સમાવી હું છે. પોતે સહન કરી ખોળને શક્તિ આપે છે. એટલા માટે સહનશક્તિ કહેવાય છે. સહન કરવું એટલે શક્તિ સરવી, શક્તિ સીંચવી. સહન કરવાનું છે, મરવાનું નથી. સામે રાવણ હોય તો પણ એનાથી હારવાનું નથી. એ પણ જરૂર અદ્વારો તેવો આત્મવિશ્વાસ જોઈએ. તેના પર અનુકંપા રાખો. આ બધું તો જ થાય જે અજૂનની જેમ 'નષ્ટામોહ'ની સ્થિતિ પ્રાપ્ત થઈ હોય. આંધળો આંધળાને હોરી ના શકે. આંધળાને હોરવા હેખતો જોઈએ, નહીંતર એઉને ફૂવામાં પડવાનો વારો આવે.

સંસારમાં હલચલ થાય અને સેવક પણ હાલી ભડે, તોલી ભડે તો એ શું સેવા કરશો? સેવકે અચળ બનવું પડશો, ગમે તેટલી જાવાતી પરિસ્થિતિ નિર્માણ કેમ ન થાય? જ્ઞાનની મહાન શક્તિ એની પાસે હશે, જે એને અવિચળ રાખશે. શાંતિનો ફૂત સ્વયં અશાંત બને તો કેમ

આવે ? આગને આગ બુઝાવી ના શકે, આગ બુઝાવવા પાણુની શીતળતા લેઈએ.

કામ દેશમાં થાય કે વિહેશમાં, સુખ્ય ચીજ છે સ્નેહ. કોઈ ગમે તેટલો અભિમાની હોય, તો પણ સ્નેહ તેને એંચો શકે છે. શાંતિને અનુભવ પણ સ્નેહ દ્વારા થાય છે. સ્નેહ-પ્રાપ્તિ માટે નિરાભિમાની બનવું પડે છે. નિરાભિમોનતાથી જ ચાસ્ય-નિર્માણ થાય છે. સૌનું સાંસળવું અને સૌને સ્નેહ કરવો એ સંકળતાને આધાર છે. આખરે તો સમસ્ત વિશ્વ એક નાનકડો પરિવાર બની જવો લેઈએ. જેવી રીતે શરીર એ એક અખંડ અવિલાક્ષિત સંરચના છે, એ જ રીતે વિશ્વ તે પણ એક અખંડ, અવિલાક્ષિત સંરચના છે. શરીરને આપણે જીવતું ત્યારે કહીએ છીએ, જ્યારે દેહના કોઈ પણ અવયવને પીડા થાય તો તેનો સંદેશો મગજને પહોંચી જય. આ જ રીતે વિશ્વના દેહને પણ જીવતો ત્યારે ગણીશું, જ્યારે વિશ્વના કોઈ પણ ખૂણું ઘટતી ઘટનાની સંવેદના વિશ્વના પ્રાણુર્દ્ય સેવકોને પહોંચી જય. સહાનુભૂતિ સૌ કોઈને થાય, પરંતુ સેવકો તો તે પીડાથી હાતી જિડે. પોતાની લીતરના ‘સ્વ’નો વિસ્તાર આટલા વ્યાપક ‘વિશ્વ’ સુધી થાય, તો જ સર્વત્ર મંગળતા પ્રસરે.

આજે આપણે નાના નાના ચોકડામાં, બંધિયાર વિલા-ગોમાં વિચરતા થઈ ગયા છીએ. પરિણામે સૌનાં હિત પરસ્પર ટકરાય છે. હકીકતમાં વિશ્વ જે અખંડિત હોય તો એકખીલના હિતમાં હિતવિરોધ શા માટે જોખો થવો

જોઈએ ? હૃથ સુદ્ધ રહે, તેમાં પગને કંઈ નુકસાન હોય ખરું ? આંખે સરખું ના હેખાય, તેનો ગેરલાલ પગને ના મળે ? દુશ્વરે એવી સુષ્પિત રચ્ચી છે કે તેમાં એકના લલામાં સૌનું લલું છે.

તો આવા એક અખંડ, એકરસ વિશ્વની રચના કરવી છે, જેમાં સૌનાં સુખહુઅ સહિયારાં હોય. આવા એકરસ વિશ્વના માનવોમાં ઉધ્વર્ણાહુણુની એક પ્રેરણું હશે, જે નવા માનવને જરૂર આપશે. નવી માનવતા નવા મંગળ વિશ્વની રચના કરશે. આવું કરવા દેશદેશાવર કરવું જરૂરી છે તેવું નથી. આપણું ચિત્તને નવું બનાવીએ, પુરાણું ચીલાચાલું આધાત-પ્રત્યાધાતોના વિષયક માંથી મુક્ત થઈ એ. “હું” બહલાશે તો વિશ્વ આપોઆપ બહલાશે.

### પરમભાગ્યની છણી

જીવમાત્રનો જે ભાગ્યનિયંતા છે તે પોતાનાં સંતાનોના ભાગ્યની તસવીર જેતો રહે છે. દરેકના ભાગ્યની જુદી જુદી છણી છે. કોઈની હૃથેળીની રેખાઓ એકખીન સાથે મળતી આવતી નથી. પરંતુ છણી કોની સુંદર લાગે છે ? જેના ચહેરા પર સ્મિત છે, હોકોમાં અને આંખોમાં સ્મિત જિલાયું હોય છે, તેની છણી સુંદર હોય છે.

આંખોની સુંદરતા શેમાં છે ? જે આંખોમાં વિશ્વકર્ત્યાણું, કરુણાવાન પરોપકારી દણિત સમાઈ છે, તે નથીન સુંદર છે. આવી દણિતવાળો મનુષ્ય જ ભાગ્યશાળી છે. બીજના હુઃએ હુઃખી થવાની સંવેદનશીલતા ક્રારા હોકો

પર સ્વિમત ઓદાય છે. પરમેશ્વરની યાદ અને કર્તાજ્યોતાની સલાનતા, આ એ ચીજ દ્વારા માનવ સૌભાગ્યશાણી બને છે. જે લોકો પાછળ પડી ગયા છે તેમને પોતાની સાથે કરી લેવા તે સાચ્યો પરોપકાર છે. પોતાની લીતર હંમેશાં સલસરતા, પરિપૂર્ણતા અનુભવવી, અને ખીજની અપૂર્ણતા હું કરવી આ છે સલસરતા, સંપન્તાની નિશાની.

કેવળ મુરલીએ આંલાજ્યા કરવાથી શું કશદ્દો? મુરલી સાંલળતાં સાંલળતાં મુરલીધર જેવા થતાં આવડલું જોઈએ. કહેવાય છે કે મુરલીથી સાપનું જેર પણ હું કરી દેવાય છે, તો કોઈનો ગમે તેટલો જેરીલો, ડાખીલો સ્વભાવ હોય, અને પણ વશ કરી નચાવી શકીએ તો મુરલીની જીત થઈ કહેવાય. મુરલી સાંલળીને આપણે સૌ સાથે જોડાવાનું છે. વનસ્પતિસુષ્ઠિ, પશુસુષ્ઠિ, માનવસુષ્ઠિ સૌ સાથે એકદ્વિતી થતાં શીખવાનું છે. સૌ ચૈતન્યમાં એક જ પ્રાણુરસ, એક જ આત્મરસ વહી રહ્યો છે. આ અંતરની એકતા તો જ સિદ્ધ થઈ કહેવાય, જ્યારે એકમેક માટે સંવેદના અનુભવાય. સામે કોઈ ભૂષણો, હુઃખી માણુસ એડો હોય અને હું અધ્યાત્મની અને પરમાત્માની વાતો કર્યા કરું તો તેથી કાંઈ અધ્યાત્મ જીવાયું ન કહેવાય. સામા માણુસની ભૂખ, તરફ, વેદના, પોડાનો મને સ્પર્શ થવો જોઈએ. માત્રી આંતર્વૃત્તિ જે એવી બુઝી થઈ ગઈ હોય કે કશું પહોંચે જ નહીં, તો તેવી હાલતમાં માત્ર મુરલી સાંલાજ્યા કરવાનો કરો।

અર્થ નથી. મુરલી તો મરેલાને એડા કરે. આપણું સંવેદન-શીલતા જે જગી ન જિડે તો મુરલી સાંભળવા માટે આપણું પાસે કાન નથી તેમ સમજવું.

ભગવાન એટલે ભાગ્યવિધાતા. સૌ કોઈના મસ્તક પર એ ભાગ્યવિધાતાએ ભાગ્યરેખા અંકિત કરી રાખો છે. સૌ સૌનું ભાગ્ય સૌ લોગવે છે. પરંતુ સાચો ભાગ્યવાન કોણ છે? સદ્ગુરૂજી તો એ છે, જે ઈચ્છામાત્રને અવિદ્યા સમજે છે. ભાગ્યની નિશાની ત્યાગ છે. ભાગ્યવાન આત્મા ભગવાનની જેમ નિરહંકારી અને નિર્વિકારી હોય છે. ભગવાન સદ્ગુરૂ સર્વ શક્તિમાન છે, તો તેનો વારસો જળવનાર ભાગ્યવાન યथાશક્તિમાન નથી હોતા? એ પણ પૂર્ણ શક્તિમાન બની શકે છે. આપણું સૌ સૌભાગ્યવાન છીએ, કારણું કે સેવા, પરોપકારની આપણુંમાં ભાવના જગી છે. જે ક્ષણે બીજનો વિચાર અંતરમાં સ્કૂર્યો, તે ક્ષણું પરમ ભાગ્યવાન સમજવી, તે ક્ષણે આપણું જીવનમાં સોનાનો સૂરજ જિંયો તેમ સમજવું. બાકી નાનકડા ખાણોચિયામાં જિંદગી વિતાવી દઈએ, તો ઉંમરભરનું અંધારું. ભાગ્ય કહી જિધડે જ નહીં. ભાગ્ય તો તો જ જિધડે, જે જીવનાંગણે સત્ય-નારાયણ, પ્રેમનારાયણરૂપી સૂર્યનો ઉદ્ઘય થાય.

સાધકો માટે છત્રછાયા કોની? ઈચ્છિકની યાદ એ જ તેમની વિશાળ છત્રછાયા છે. બીજાં અદ્વયકાલીન આકર્ષણુંના પાશમાં અંધારું ન જોઈએ. જગતનું મોટામાં મોટું આકર્ષણું જગતપતિ છે, એની છાયા હેઠળ આવી ગયા.

પછી માયાનાં આકર્ષણું પોતાનાં કાઈ કામણું ચલાવી નથી શકતાં. એટલે સુખમાં રામ અને હાથમાં રામનું કામ. શાસેશ્વાસે પ્રલુસમરણું થયા છે. એક પણ શાસે પ્રલુસમરણું વળરનો ન વીતે, તે જેવું જોઈએ. હડીકતમાં પ્રલુને યાદ કરવા માટે સાધના કરવી પડે તે જ વિચિત્ર છે. પ્રલુ પ્રત્યે જે સાચી લગન હોય, એનું સ્થાન હૃદયમાં અમીટ અંકાઈ ગયું હોય તો તેનું સહજ સમરણ થવું જોઈએ. એ કયારે યાદ આવે છે, તેવું પૂછવાને બહલે, કયારે યાદ નથી આવતો તેવું સહજ થઈ જવું જોઈએ. આવું તો જ થાય જે પ્રલુ માટે આપણને અનન્ય પ્રેમ થાય. એટલે સુખનું વાત આ છે કે તેની સાથેની આપણી અભિનનતા અંતરમાં વસી જવી જોઈએ. જીવનમાં પ્રતીતિ આવવી જોઈએ કે એનામાં જે વૃક્ષરસે છે, તે આપણામાં બીજરસે પડયું છે, એટલે તો આપણને જીવનમાં પ્રેમતરત્વ, સત્યતરત્વ, કરુણાતરત્વ આકષે છે, કારણું કે તે પોતે પ્રેમ, સત્ય અને કરુણાની પરમમૂર્તિ છે.

જગત એક બગીચો છે. તેમાં જતજતનાં ફૂલ છે. કોઈનામાં સુગંધ છે, તો કોઈનામાં રંગ છે, તો કોઈનામાં સૌન્દર્ય છે. માનવખોચામાં પણ આવું વૈવિધ્ય છે. કોઈનામાં જાનની ખુશાયું છે, તો કોઈનામાં ધારણાનો રંગ છે, તો કોઈનામાં સેવાનું સૌન્દર્ય છે. પરંતુ બગીચામાં સૌથી વધારે ધ્યાન કોના તરફ જય છે? જે ફૂલની સુગંધ દૂરથી આવે તેના તરફ ધ્યાન જય છે. માળીને તો બધાં

કૂલ સરખાં, પરંતુ કૂલહાનીમાં રાખવા માટે એકા હૃદથી સુગંધ ઇલાવનારા કૂલની પસંદગી થશે ને ? પ્રભુ રોજ અમૃતવેળામાં સ્નેહ અને શક્તિનું સીંચન કરી પોતાનાં ખ્યારાં કૂલ્ણાને મળે છે.

અમૃતવેળા એ પ્રભુમિતનની વેળા છે. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાની વેળા છે. આ સમયમાં લલાલોણા લંડારી પાસેથી વરદાનોના ખજના સહેલે મળી શકે તેમ છે. આવા જલોણા સમયને પારખવાની શક્તિ હોવી જોઈએ.

પરમશક્તિનું આકલન કરવું હોય તો જીવનમાં સોળ કળાનો મહિમા ગવાયો છે. સોળે કળા એટલે સંપન્તિના, સંપૂર્ણના અને સર્વતા. શુણુંમાં સર્વશુણુસંપન્તિના, જ્ઞાનમાં પરિપૂર્ણના અને વિસ્તારમાં સર્વશ્રદ્ધિ. કોઈ છૂટવું ના જોઈએ. ઈશ્વર સર્વાત્માંભી છે. સર્વમાં રહેલા ઈશ્વરને ઓળખીએ, પામીએ અને આત્મસાત કરીએ !



## સત્તવશીલ સાહિત્યની જરૂર

હું એ હિવસની રાહ જેવિં છું, જ્યારે  
દીવાનખાનાનાં ઇરનિચર જેટલી જ સત્તવશીલ  
સાહિત્યની જરૂર ગણુશે.

કોઈ પણ દીવાનખાનાની અંદર જઉં ત્યારે  
સહુથી પહેલાં હું ત્યાં પહેલાં સામયિકો અને પુસ્તકો  
તરફ નજર નાખી લઉં છું. મારે મન સાહિત્ય  
એ વ્યક્તિના સાચા સંસ્કારનો માપદંડ છે. વિનય,  
વિવેક, પ્રકૃત્વતા, નિષ્ઠા, આ બધાંનું મૂલ્ય છે જ,  
પણ આ શુણેના વર્ધનમાં સત્તસાહિત્ય જેટલું  
ઉપકારક પરિણળ ભીજું નથી. જે લોકો શબ્દની  
શક્તિ પ્રમાણે છે એમના માટે સારાં પુસ્તકો એક  
મહત્વનો મૂડી બની જય છે. પોતે તો મહાન  
મૂડીનો ઉપયોગ કરે જ છે, એ સાથે પોતાના મિત્રો,  
સ્વજ્ઞનો અને પરિવારને પણ એનો લાભ આપે છે.

—બાંસુરી રસેલ

